

નેત્ર ગુપ્ત લિંગ
તા. ૨૬-૧૦-૫૭

અજિતનાથ સ્વામિને નમો નમઃ ફુ
દ્વારક પ્રથમાલા-પ્રથાંક ૧૮ ॥
...મ....તિ....ના-

શ્રી યશોહિષણ
દ્વારકાલાલાલ
દિન : ૦૨૮-૨૫૨૩૨૫૨૫૨
ફોન : ૦૨૮-૨૫૨૩૨૫૨૫૨

૧૭૪૭ .

'વિવેક દર્શન'નું - પ્રદર્શન

* યાને *

પ્રસ્તાવના તિમિરતરણિની

અ.....સા.....ર.....તા

લ...ખ...ક-

શાસન સંરક્ષક - સમર્થ વ્યાખ્યાતા - વિક્રિવર્ય
શા...સ...ન...ક...ર...ડ...કો...દ્વ...ર...ક-

પુજ્ય પાઠકપ્રવર શ્રી હંસસાગરલ ગણ્યવર

પ્રકાશક અને પ્રામિસ્થાન :

શ્રી શાસનકંડેદ્વારક જ્ઞાનમંહિર વ્યવસ્થાપક-

શાંત મોતીચંદ દીપચંદ

જી ભાવનગર-વાયા તલાજા-સું ઠણીયા-[સૌરાષ્ટ્ર]

<p>વીર સં ૨૪૬૩ સને-૧૯૬૭</p>	<p>આગમેદ્વારક-સં ૦ ૧૮ કિં ૧-૦૦</p>	<p>વિ. સં ૨૦૨૩ શાક-૧૮૮૮</p>
---------------------------------	--	---------------------------------

[પ્રથમાવૃત્તિ - કોર્પી ૧૦૦૦]

‘પ્રસ્તાવનાતિમિરતરણિ’ની ચોરીછૂપી શું કામ?

નવા વર્ગે, તે નામની ખૂક પ્રથમ ‘શ્રી શાંખેશ્વર પાર્થનાથ અને વિવેકદર્શિન’ નામની ખૂકમાં છૂપાવેલ. ગત માગશર માસે છપાએલ તે ‘શ્રી શાંખેશ્વર૦ વિવેકદર્શિન’ ખૂકને પણ (અમૃક અમૃક સ્થળે જ મોકલ્યા આદ) ગત જેઠ ભહિના સુધી (અનેક ભાગ્યા-ભંગાવ્યા હતો ‘હજુ છપાય છે’ એમ જણાવતા રહીને) છૂપાવી રાખેલ.

તેમાંની એક ખૂક ગત મહા માસે મને પણ કાકતાલીયન્યાયે જ પ્રાપ્ત થઈ જતા મેં તેતો આ ‘નવામતિના વિવેકદર્શિનનું પ્રદર્શિન’ નામની ખૂકમાંનો ધડેલો જવાબ પ્રેસમાં ઠા. આગ તો ગત આપાદ માસે છપાઈ પણ ગયો ત્યાં સુધી તે વર્ગ તે ‘શ્રી શાંખેશ્વર પાર્થનાથ અને વિવેકદર્શિન’ ખૂક તો બહાર મૂકી જ ન્હોતી; પરંતુ તે ખૂકમાંની પાના ૧૪ થી ૧૪ સુધીની (ટાઇટલ ઉપર પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન વગેરે વિનાની) ‘પ્રસ્તાવનાતિમિરતરણિ’ ખૂકને અલગ ફરમાયો ઇપે ટીચીંગ કરીને છ ભહિના આદ અલગ ખૂક ઇપે બહાર પાડેલ છે! આથી સુરવાયકોએ એ વિચારખું રહે છે કે—‘તે વર્ગને પણ તે ખૂક ગંદી અને અસત્ય ન લાગી હોય તો તે વર્ગ, એ ખૂકને ઉક્ત પ્રકારે પ્રથમ ખીજુ ખૂકની અંતર્ગત છપાવવાની અને તે પછી પણ છ-છ ભહિના સુધી તે ખૂકને દાખી દઈને એવી ખીજુ ખૂક ઇપે ઠેંચવાનું ચોરી-છૂપીનું કૃત્ય શું કામ કરે?’

ગતવર્ષે બહાર પડેલી તે વર્ગની ‘પ્રત્યાયોગાદ્વિધિસંગ્રહ’ ખૂકની પ્રસ્તાવનાના ઝેરી લખાણુથી આઠ શ્રી પ્રેમસૂરજિ નિરાળા ન્હોતા તેમ તે વર્ગની ચાલુ વર્ષની એ ગલીય, અસત્ય અને—‘આ મૂળો અને આપ ગાજર’ જેવાં વર્ણશાંકરીય લખાણવાળી ખૂકથી એ નિરાળા નથી, એમ રખે ડાઈ માને. એ ગંદી ખૂક તો—ગતવર્ષે પાલીતાણું ચાતુર્માસમાં ગુર્વનાજેય અને અશાનિપ્રિય શ્રી જંબુજુએ જ પોતાના તે નિત્યકલેશ-પ્રિય શિષ્યાદ્વિના હાથે લખાવીને પોતાના ઉભોઈ મુક્તાબાઈ શાનમંદિર તરફથી પ્રસિદ્ધ કરાએલ છે, એમ ધણુા પૂર્વાથી કહીએ છીએ.

૩૦ હંસસાગર

૩૧-૨૬-૧૦૫૭


શ્રી લાગુણ્યાચાર્ય

ફુ રાજકોટ મંડળ શ્રી સુપાર્થનાથાય નમે નમઃ ફુ

॥ શ્રી શાસનકંટેકોદ્વારક, અંથમાલા-અંથાંક ૧૮ ॥

ન...વા...મ...તિ...ના-

‘વિવેકદર્શનનું’ - પ્રદર્શન



શ્રી હેવસૂરે તંપાગંછ સામાજારી સંરક્ષક-ઘડુશુત-ધ્યાનસ્થ
સ્વર્ગત પૂ. આગમોદ્વારક આચાર્ય હેવેશ શ્રી આનંદસાગર-
શ્રી ધરજી મ.ના. અહુપ્રભાવક-સમાધિસ્થ સ્વ. પૂ. આ.
શ્રી હેવસૂરિલ મ. ના. પરમ વિનેય-શાસન
સંરક્ષક-શાસનકંટેકોદ્વારક-

પૂજ્ય પાઠક પ્રવર શ્રી હંસસાગરજી મહારાજ

પ્રકાશક અને પ્રામિસ્થાન :

શ્રી શાસનકંટેકોદ્વારક જ્ઞાનમંદિર વ્યવસ્થાપક-

શા. મેતીયંદ દીપયંદ

જ. ભાવનગર-વાયા તલાજી-સુ. ઠળીયા-[સૌરાષ્ટ્ર]

વીર સં. ૨૪૬૩	આગમોદ્વારક-સં.	૧૮	વ. સં. ૨૦૨૩
સને ૧૯૬૭	કિ.	૧-૦૦	શાકે ૧૮૮૮

[પ્રથમાવૃત્તિ — કોપી ૧૦૦૦]



આ.....મુ....ખ



નવા વગે ચાલુ વખે “શ્રી શાંખેશ્વર પાર્વતીનાથ-
અને વિવેક દર્શાન” નામની ખૂક પ્રસિદ્ધ-
કરીને તે ખૂકમાં ‘પ્રસ્તાવના તિમિર તરણી’
નામની સ્વમંત્રથ ચોપક જેરી વાતો
ભરેલી ખૂક ઘૂસાડી હેવાને।
વિવેક દર્શાવેલ છે,

તે વિવેક દર્શાનનું આ ખૂક દ્વારા સપ્રમાણુ પ્રદર્શાન
કરાવવામાં આવેલ છે

વાચક મહાશયેને વિજસ્નિ કે-આ ઐતિહાસિક પુસ્તિકાને
ખારીકાદથી તલસ્પર્શીપણે વાંચી-વિચારીને-
આપનો પ્રમાણિક અલિપ્રાય પાઠવશો.

વિ. સં. ૨૦૨૩ ના વૈશાખ
દદ ૧૦ શુ...ક.. વા...ર
શ્રીસુપાર્વતીનાથવર્ષ ગાંઠદિન
રા...જ...કો...૨

૬૧૦ કં. ૩૫૧૦
હ...સ...સા...ગ...ર
શ્રી તપાગચ્છ નૈત ઉપાશ્રય
માંડવી ચોક - દેરાસર શેરી

મુદ્રક : જ્યાંતિ દ્વારા, વસંત પ્રિન્ટિંગ પ્રેસ, ધીકાંટા, અમદાવાદ.

નવામતિના વિવેકદર્શનનું પ્રદર્શન

દે : શાંકુંદ્રપાઠીયાં શ્રી હંસસાગરજીણું

[] પૂ....ર્ધી....પી....ઠિ....કા []

[નવા વર્ગો ચાલુ વર્ષમાં મુનિ શ્રી નિત્યાનંદ વિ. ના નામે 'શ્રી શાંખેશ્વરપાઠીયાં' અને 'વિવેકદર્શન' નામે બહારથી રૂડી અને અંદરથી 'પ્રસ્તાવનાતિમિરતરણું' નામે લખાએ છું કૂડી એવી એક ભામક બૂક પ્રગટ કરેલ છે. જેમાં તેમણે અમારી 'પ્રસ્તાવનાતિમિરતાસ્કર' બૂકમાંના લખાણું એઠી રીતે એટું બતાવવા સારુ અતિ નિધ પ્રયાસ કરેલ છે. તે વર્ગના તે બૂકગત સમસ્ત લખાણુંમાંના છળ-પ્રપંચ-ઈણ્ઠાં અને તેજે-દ્રેષ્ટલયાં છલાછલ અસ્ત્યેને તથાસ્વરૂપે વિક્રાન વાચકો સમજી શકે એ સારું આ નીચે સં. ૧૯૮૭ની અમારી દીક્ષા પહેલાંના પણ પ્રસંગોને દર્શાવવા પૂર્વકનો કેટલોંક ઈતિહાસ રજુ કરવો આવશ્યક બનેલ છે.]

અમારી દીક્ષા બાદ અમોએ વાંચેલ અનેક પક્ષીય-પ્રતિ-પક્ષીય સાહિત્યનો તથા વચોવૃદ્ધ પૂ. મુનિરાજશ્રી ઉત્તમ વિ. મ., પૂ. આ. શ્રી. ઉમંગસુરિજી મ. તથા પૂ. પં. શ્રી નેમવિ. મ૦ આદ્દ અનેક સુવિહિત અને પ્રૌઢ મુનિવરોથી પ્રાપ્ત થયેલ વાસ્તવિક હુકીકતોનો આ નિષ્કર્ષ છે કે—“ સં. ૧૯૮૮ના પ્રથમ જેઠ શુદ્ધ સમયના રોજ સ્વર્ગવાસી બનેલા પૂ. આ. શ્રી આત્મારામજી મ. શ્રીએ, પોતાની વિધમાનતામાં પોતાના આજાંકિત શિષ્ય-

પ્રશિષ્યો પૂ. મુનિ શ્રી સોહનવિજયજી, પૂ. પ્રવર્ત્તક મુનિશ્રી કાંતિ-વિજયજી, મુનિશ્રી હંસવિજયજી મ. આદિ પૂ. સમસ્ત મુનિવરો સહિત ચોતાની પાટે ‘પદૃધર આચાર્ય’ તરીકે પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મ. શ્રીનેજ સ્થાપવાનું નક્કી કરેલ, તે મુજબ તેઓશ્રીએ તેમજ સમુદ્દરાયના વૃદ્ધ મહાત્માઓએ તે વાતનો સ્વીકાર કરવા પૂ. મુનિ શ્રી વલ્લભવિજયજી મ.ને વારંવાર પણ વિવેલ: આમ છતાં તે હોદા પ્રતિ નિરીહ એવા પૂ. મુનિશ્રી વલ્લભવિજયજી મહારાજે તેઓને તે હોદા સ્વીકારવાની વારંવાર પણ અનિચ્છા જણાવેલ ! એટલું જ નહિ; પરંતુ તેઓશ્રીએ ચોતાને બદલે તે સ્થાને પૂ. કમલવિજયજી મ.શ્રીને સ્થાપવાનું સૂચન જારી રાખેલ.

તે સૂચનના સ્વીકારમાં પૂ. આત્મારામજી મ.શ્રીની મહેચ્છાનું પાલન સચચવાતું નહિ હોવાથી સમુદ્દરાયના વડિલો પૂ. પ્રવર્ત્તક કાંતિવિ. મ. તથા પૂ. હંસવિ. મ. શ્રી આદિએ પૂ. આ. શ્રી આત્મારામજી મ.ના સ્વર્ગવાસ પણી પણ ચાર વર્ષ પર્યાત પાટ ખાલી રહેવા હેવી ઉચ્ચિત માની; પરંતુ તે સૂચનને અપનાવવું ઉચ્ચિત માનેલ નહિ ! એ પ્રકારે—પૂ. આત્મારામજી મ. જેવા સમર્થ દાદાગુરુની પાટ, અનેક શિષ્યો છતાં વર્ષો સુધી પદૃધર-વિહોણી રહે એ વાત પૂ. મુનિશ્રી વલ્લભવિ. મ.ને અસહ્ય બની. પરિણામે પૂ. પ્રવર્ત્તક શ્રી કાંતિવિ. મ. તથા પૂ. મુનિશ્રી હંસવિ. મ. આદિ વડિલોને ચેતે જાતે જ અને વારંવાર પણ પત્રો લખીને તેઓશ્રીની પાટે પૂ. મુનિશ્રી કમલવિ. મ.શ્રીને પૂ. સ્વર્ગસ્થ દાદાગુરુના પદૃધર તરીકે સ્થાપવાની સ્થિતિમાં મૂક્યા ! પરિણામે નિરૂપાય બનેલા તે તે વડિલોએ સં. ૧૬૫૭માં પાઠણ

મુકામે શ્રાવકસંધના હાથે પૂ. સ્વર્ગસ્થ આત્મારામજી મ.શ્રીની પાટે પૂ. મુનિશ્રી કમલવિ.ને પદ્ધત આચાર્ય તરીકે અને પૂ. મુનિશ્રી વીરવિ. મ.ને ઉપાધ્યાય બનાવવા પડેલ !

૭. શ્રી વીરવિ. મ. તથા મુનિશ્રી દાનવિજયજી

પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિ. મ., ગોધા પાસેના ‘બાડી’ના વતની અને જાતે લાવસાર હતા. તેઓશ્રી, સં. ૧૯૩૫ માં પંલભના અંખાલા ગામે દીક્ષા લઈ પૂ. મુનિશ્રી આત્મારામજી મ.શ્રીના શિષ્ય બન્યા હતા. પૂ. આત્મારામજી મ.શ્રીને વિશેષ મુનિસમુદ્દાય મૂલ સ્થાનકવાસી પંલબી સાધુઓને અને આ પૂ. ઉપાધ્યાયજી મ. એકલા જ કાઠિયાવાડી, લદ્રપરિણુમી અને અદ્વ્ય-૦૪૧૫ કુશાલ સાધુઃ એટલે સુમેળ એઠો અને અદ્વ્યમેળ; તે પણ કચવાટ લર્યો. આ સ્થિતિમાં તેઓશ્રીને પૂ. ગીતાર્થ-પ્રવર મુનિશ્રી જવેરસાગરજી મ., તેઓશ્રીનું મુખ્ય વિશ્રાંતિ સ્થાન લેખાતું. તેઓશ્રીએ શ્રી ઉત્તરાધ્યયનસ્ત્રાદ્ધિનું વાંચન તેઓ પાસે કરેલ. એધ તથા વકૃતૃત્વશક્તિ પ્રમાણમાં ઢીક ઢીક લેખાતા.

સં. ૧૯૪૬ માં તેઓશ્રીને ‘ઝીજુવાડા’ ગામના એક ઝોડાર=પોલીસપટેલનો સમાગમ થયો. તે ભાઈ જાતે જૈન અને લદ્રિકપરિણુમી લાસ્યા; પરંતુ સ્વભાવેય ઝોડાર જણ્ણાવાથી પૂ. ઉપાધ્યાયજી મહારાજે એની સાથે સંલાણીને એટલે કે-તેનું સ્થાન-કડકાઈ અને ખુમારી વગેરે ધ્યાનમાં રાખીને એમને દૃચ્છતી રીતે ધાર્મિક વાત કરવાનું રાખેલ. પરિણુમે જ્તે દસ્તાડે તેમને પૂ. ઉપાધ્યાયજી પ્રતિ આદર પ્રગટેલ અને કમેતે ઝોડારલાઈ ગોધા મુકામે જઈ પૂ. ઉ. મ.શ્રીના શિષ્ય મુનિ દાન-

વિજયજી મ. પણુ બની ગાયેલ. [પૂ. દાનવિ. મ. ની મૂળ
 ‘પોલીસપટેલ’ તરીકેની ઓળખને ભૂસી નાખવા સારુ
 તેઓશ્રીના પ્રપણિષ્ય પં. શ્રી કનકવિ. એ પોતાની સં. ૧૯૬૭ની
 ‘અમર તપો એ સાધુચરિત સૂરીશ્રીજી’ નામની ખૂબના
 પેજ ચાર ઉપર તેઓશ્રીને ‘સરકારી હોદાવાળા’ અને સં.
 ૨૦૦૨ની ‘સાધુશિરોમણી સ્વર્ગીય ગુરુહૈન્દ્ર’ નામની
 ખૂબના પેજ પાંચ ઉપર ‘સરકારી સ્કૂલના શિક્ષક-માસ્ટર-
 રની ખુરશીને અધિકાર પ્રાપ્ત થયો.’ એમ લિન્ન લિન્ન
 કદિપત વિશેષણોથી ઓળખાવાયેલ છે, તે આ નવો વર્ગ, ઇછનાં
 ગાણ્યાં ગાતી વેળા થીન મહાત્મતને તો લગભગ કોરાણે મૂકતા
 હોવાનું પ્રતીક છે.] એ પ્રકારે ગુરુ-શિષ્ય બજે કાડીઆવાડી
 બન્યા ખરા; પરંતુ એકનો સ્વભાવ ભાવસારી અને થીજનોં
 સ્વભાવ ફેઝદારી ! એટલે બન્નેને નિય કાંઈ ને કાંઈ દંતકલેશ
 રહે. તેમાં વળી સં. ૧૯૫૭ના કાંતિક માસે પૂ. દાનવિ. મ.ને
 પાલીતાણું મુકામે મુનિશ્રી પ્રેમવિજયજી નામે એક મારવાડી
 શિષ્યની પ્રાપ્તિ થઈ !

અલગ ચાતુર્માસ અને ચોગવહનની શરૂઆત

એટલે મુનિશ્રી વીરવિ. મ., સં. ૧૯૫૭માં પાઠ્ય મુકામે
 ઉપરોક્ત પ્રકારે ઉપાધ્યાય બન્યા હોવાથી લોકલજાએ તે વર્ષનું
 ચાતુર્માસ તો શુરુ મ.શ્રી સાથે પાઠ્ય પૂર્ણ કરીને પૂ. મુનિશ્રી
 દાનવિ. મ.શ્રીએ, પોતાના શિષ્ય મુનિશ્રી પ્રેમવિ. સાથે સં.
 ૧૯૫૮નું ચોમાસું વડોદરા મુકામે સ્વતંત્ર કરેલાઃ યાવતું સં.
 ૧૯૬૧ માં ખંભાત મુકામે જઈને ગણ્યિપદના ચોગોદહન પણ

स्वतंत्रपणे शङ् करी हेवा वडे समुदायनी योगोक्षण नहि करवानी प्रथालिकाने। लंग करवानी हिंभत करी!

तेऽयोश्रीनी ए वर्गेरे साहसिकताथी श्रीजैन संघमां एवी शंका प्रसरेल के—‘आ मुनिश्री दानविजयल, भूष तो झींझु-वाडा सरकारी आताना पेलीसपटेल (झाजदार) हेवाथी वर्खत जतां निज छंहे आचार्य पणु बनी जैने ‘योगोक्षणवाणो आचार्य’ तो। हुं ज हेवाथी पू. आ. श्री विजयानंदसूरिलुनी पाटने। साचा पट्ठधर आचार्य तो। हुं ज गणुउ’ एम पणु पेताने द्वेषाववा मांडे तो ना नहि!’

वडोदरा संभेलननी सङ्कलताने। यशाकलश

ऐ वर्गेरे कारणे लीधे उक्त मुनिगणुमां वैमनस्ये पुनः नोर पकडेल। आथी अत्यंत भिन्न घनेल पूज्य मुनिश्री वद्वलभ-विजयलु महाराजे सं। १६६८मां वडोदरा मुकामे स्व. पू. आ. श्री आत्मारामलु म. श्रीना समुदायना समस्त मुनिवरेनुं संभेलन, ऐ पू. आ. श्री विजयकमलसूरिलु महाराजने अध्यक्ष राखवानुं कथूलीने पणु योजेल! ते संभेलननी सर्वांगीण सङ्कलताने। यश पणु मुख्यत्वे पू. मुनिश्री वद्वलभवि. म.ने ज झाणे जतो। हेवानुं ते संभेलनना हेवालवाणी ते समयनी खूक वांचनार सुशङ्जनने आजे पणु कथूलवुं पडे तेम छे.

पू. पं. श्री दानवि. म. प्रति नङ्करतनुं मुख्य कारण

आ वस्तु पू. पं. श्री दानविजयल म.थी सहन नहि थध शक्वाथी तेऽयोश्रीऐ उक्त संभेलनना सर्वमान्य ठरावेना लंग इपे सं। १६६८मां गंधारतीर्थ मुनि रामविंने पेताना

પ્રશિષ્ય તરીકે આપખુદીથી દીક્ષા આપીને સમેલનના સમસ્ત ઠરાવોને ફોક બનાવી દીધેલ. તેઓશ્રી પ્રતિ પૂ. આત્મારામજી મ. શ્રીના આજાવતી પૂ. સમસ્ત મુનિવરોને આજે પણ નક્રત હોવાનું મુખ્ય કારણ આ છે. સિવાય આત્માર્થી સાધુઓને અંગત વૈર-ઝેર તો શું જ હોઈ શકે ?

આપસી અંતરકલેશની શરૂઆત

ત્યારથી ગ્રાવંલીને સં. ૧૯૭૮ સુધીમાં તો પૂ. પં. શ્રી દાનવિજયજી મ., ૬-૭ શિષ્ય-પ્રશિષ્યો પણ ધરાવતા થઈ ગયેલ. સં. ૧૯૭૬ માં ગુરુમ., સ્વર્ધમાંથી થવાથી સ્વતંત્ર બનેલ. પરિણ્યુભે ચોતાના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજીને ૧૯૭૬ માં ગણ્ય પણ બનાવી લઈને વધુ પગલર થયેલ. અને તે ગુરુ-શિષ્ય અનેને ચોતાની જે વ્યાખ્યાનની અનાવડત ખટકતી હતી, તે ખટક પણ પ્રશિષ્ય મુનિશ્રી રામવિજયજી, સામાન્યતયા લણી-ગળ્ણીને સમર્થી વ્યાખ્યાતા તરીકે તૈયાર થઈ ગયેલ હોવાથી દૂર થઈ જવા પામેલ ! એટલે તો પૂ. આત્મારામજી મ. શ્રીના વિશાળ મુનિગણ્યની ચોતાના પ્રતિની નક્રતની પૂ. પં. શ્રી દાનવિ. એ પરવા જ તણ દીધેલ ! આપસી અંતરકલેશની જમાવટ અહિથી થવા પામીઃ જે સહુ કોઈ સજજનને ફુઃખદ છે. એ સ્થળતું ચાતુર્માસ પણ તે મુનિશ્રીને આભારી હતું.

પૂ. પં. શ્રી દાનવિ. મ. તથા મુનિશ્રી પ્રેમવિ. મ., જૈન જગતમાં અધારિપર્યાત જે તેવા સામુદ્દરિક કલેશોત્પાદક તરીકે લેખાઈ જવાને કારણે એક ખૂણ્યાના સાધુઓ તરીકે લેખાઈ જવા પામ્યા હતા, તે મુનિશ્રી રામવિજયજી મહારાજશ્રીની અજબ

વ્યાખ્યાન શક્તિના પ્રતાપે શ્રી સંઘોમાં હવે તો આદર પણ
પામવા લાગેલ. તેઓશ્રીનું સં. ૧૯૭૬ નું રાજ્યનગર (અમદાવાદ)
'નૈન વિદ્યા શાળા'નું ચાતુર્માસ પણ તે મુનિપ્રવરને જ આલારી
દેખાયેલ.

ઓકડાનો વધ પણ તે સુનિચો જ બંધ કરાવેલ !

તે સં. ૧૯૭૬ માં વિદ્યાશાળામાં શરૂ થએલી મુનિરાજ
શ્રી રામવિ. મ. શ્રીની-શ્રોતાઓનાં હૃદયે હુચમચાવી નાખનારી
હૃદયંગમ, વેધક અને વિષયાંતરવિહેણી તલસ્પર્શી દેશનાનું
નિત્ય અહુમહુમિકાએ શ્રવણ કરવા આવી રહેલ સેંકડો લાઈ-
પહેનો માટે એ વિદ્યાશાળાનો વિશાળ ગણુતો હોલ વખત
જતાં ધણો સાંકડો થઈ પડેલ. સંખ્યાબંધ શ્રોતાઓ જગ્યાના
અલાવે નિરાશ થઈ પાછા જવા માંડેલ ! એમ થતું અટકાવવા
સારુ કાર્યવાહકોએ તે ચાતુર્માસમાં પણ માણેકચોકમાં મોટા
મોટા ભંધ મંડપો બંધાવવાવીને ઉક્ત મુનિરાજનાં વ્યાખ્યાનો
પણ તેમાંના મુખ્ય મંડપમાં જ રખાવવા પડેલ ! એ વ્યાખ્યા-
નોને શ્રવણ કરવા ઉમટેલા હળરો નૈનેતર શ્રોતાઓથી
તે વિશાળ માણેકચોક પણ ચીકાર કરાઈ જવા લાગેલ ! દેશના
દ્વારા હોટલો અને રેસ્ટોરામાંના અલક્ષ્યભક્ષણોની કારમીતાનું
શ્રવણ થતાં લોકોએ વ્યાપક પ્રમાણમાં છોડી દીધેલ હોટલો
અને રેસ્ટોરામાં લગભગ શૂન્યકાર પ્રસરેલ : ત્યાંના ભદ્રકાલીનાં
મંદિરમાં નવરાત્રિના દિવસોમાં દર વર્ષે ઓકડાનો વધ થતો
હોવાનું સાંભળીને મુનિરાજ શ્રી રામવિજયજી મ. નું દિલ દ્રવી
ઉઠેલ. એ વધ બંધ કરાવવા સારુ તેઓશ્રીએ અતિ જોરદાર

અને હૃદયદ્રાવક વ્યાખ્યાનો આપવા શરૂ કરી હિંદુ-મુસલમાન સહુ કોઈને આવળ્ણ લેવા પૂર્વક ભારે સર્જણ જુંબેશ ઉઠાવેલ. યાવત્ તે વધ સામે રોષે ભરાએલ હજારેં હિંદુ-મુસ્લીમાથી વીટણાઈને તે મુનિરાજશ્રી પોતાના ગુરુ મંત્રને સાથે લઈને તે મંદિરના પૂજારી પાસે પણ ગચ્છેલ. અને અંતે સામૂહિકબળ અને કળ દ્વારા તે વધ બંધ પણ કરાવેલ ! (આ વાતને સં. ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલ ‘મહાપંથનો યાત્રી’ નામની ખૂકના લેખકે તે ખૂકના પૃ. ૮૬-૮૭ ઉપર આ. શ્રી પ્રેમવિજયજી મંત્રને નામે ચડાવી દીખી છે તે, તે વર્ગમાં રહેલ કૃતભૂતાની પરા-કાષાનું પ્રતીક છે.) તેવા તે સમર્થ વ્યાખ્યાતા મુનિશ્રી રામ-વિજયજી મંત્રીને પોતાના વ્યાખ્યાનોના પ્રલાવે સં. ૧૯૮૦ થી ૧૯૮૫ સુધીમાં તો ૧૪ શિષ્યોની સંપર્દા પણ પ્રાપ્ત થયેલ. આ વખતે તેઓશ્રી શાસનના ઉગતા સ્વર્યની ઉપમાને પણ વરેલ.

એ ભય તો દ્વાર થયેલ.

પોતાના સમુદ્દરાયનો એ ઉત્કર્ષકાળ જોઈને પૂ. પં. શ્રી દાનવિજયજી મહારાજે, સં. ૧૯૭૮ થી જોગવાળા આચાર્યશ્રીના હાથે આચાર્ય થવાની હીલચાલ શરૂ કરેલ; પરંતુ તેઓશ્રીની વડી દીક્ષા પ્રાય: છ એક વર્ષ બાદ પણ અજોગીના હાથે થયેલ હોવાથી તેમ જ તેઓશ્રીનું-તે પઢીના ઉત્તરાધ્યયનસૂત્રથી પ્રાર-ભીને આચારાંગ-કદ્વયસૂત્ર-મહાનિરિથ યાવત્ સમવાયાંગસૂત્રનું ચોગોક્ષહન પણ શાંકારીલ હોવાથી શ્રી સંઘમાના જોગવાળા વિધમાન-‘પૂ. આ. શ્રી સિદ્ધિસૂરિજી મં, પૂ. આ. શ્રી વિજય-નેમિસૂરિજી મં, વાવડીવાળા પૂ. આ. શ્રી વિજયકમતસૂરિજી

મ૦ તથા પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મ૦ વરે' આચાર્યો-
માંના એક પણ આચાર્યો' તેઓશ્રીની તે હીલયાલને મચક જ
આપેલ નહિ ! આથી પૂર્વે જણાયું છે તે મુજબ તેઓશ્રી
પ્રતિ નક્કરત ધરાવતા પૂ. આત્મારામજી મ૦શ્રીના આજાવર્તી
સમસ્ત મુનિવરોનાં દિલમાંનો વખત જતાં પૂ. આ. શ્રી કમલ-
સૂરિજી મ૦શ્રીનાં સ્થાને કહાય તેઓશ્રી જ ગોઠવાઈ જવાનો
લય તરતને માટે તો દુર થવા પામેલ.

પદવી પ્રસંગે વડિલોને આમંત્રણનો નિષેધ !

એ હિસાબે પ્રલુ શાસનના સમસ્ત યોગવંત આચાર્ય
ભગવંતોએ પૂ. પં. શ્રી દાનવિં મ૦ને આચાર્યપદ અંગે મચક
નહિ આપવાથી નિરૂપાય બનેલા તેઓશ્રીએ, સં. ૧૯૫૭માં
પૂ. મુનિશ્રી વલલભવિં મહારાજે પદૃધર બનાવેલા અને તે
સં. ૧૯૮૦માં છાણી મુકામે ચાતુર્માસ વિરાજેલા પૂ. અચોગી
આ. શ્રી કમલસૂરિજી મ૦શ્રીના હાથે આચાર્ય થવાની હીલયાલ
આદરેલ ! ઉક્ત પૂ. આ. શ્રીની સરલતાનો ધાર્યો લાલ ઉડાવવા
સારુ તેઓશ્રીને પ્રથમ તો તેઓશ્રીના શિષ્ય પૂ. મુનિશ્રી લભિધવિં
મ૦ને શ્રી ભગવતીલુના જોગ કરાવવાની નિજની ભાવના હોવાનું
છાણી મુકામે જણ્ણાવેલ ! છાણીથી પૂ. આ. શ્રીએ પણ તેમની
તે ભાવના પૂર્ણ કરવા સારુ તેમને છાણી આવવાનું જણ્ણાવેલ !
આથી ખુશ થયેલા પૂ. પં. શ્રી દાનવિં મ૦ પણ તે સં.
૧૯૮૦માં જ રાજનગરથી તાખડતોખ વિહાર કરી છાણી પદારેલ
અને તે ચાતુર્માસ પણ ત્યાં પૂ. આ. શ્રીની સાથે કરીને તે વર્ષે ત્યાં
પૂ. મુનિશ્રી લભિધવિં મ૦ને શ્રી ભગવતીસૂત્રના યોગમાં પ્રવેશ

કરાવેલ. તે દરમ્યાન પૂ. પં. શ્રી દાનવિભોગીએ, ભલા મુનિશ્રી લભિધવિભોગીને ‘આપણે બંને ચોગોદ્ધાહી ગણ્યાધિએ અને પૂજ્ય પ્રવર્તિકશ્રી વગેરે વડિલો, દાદાગુરુજી આચરિત અચોગી-પણ્ણાના આદરવાળા ગણ્યાય; તે વાત તેઓને આજથી ઝણ્ય જ ન હોધ શકે. આ સ્થિતિમાં તમારી પદવી પ્રસંગે જો તેઓ અહિ પદ્ધારે તો તેઓથી પદવીનો પ્રસંગ પણ સહન નહિ થાય: અને તેથી ઉપધાનની માળ તથા તમારી પદવીનો લબ્ધ પ્રસંગ ડહેણાધ જવાનો સંભવ અરો.’ ઈત્યાદિ પ્રકારે ઈષ્ટ-પિષ્ટં સમજવીને તેમની મારકૃત પૂ. આ. શ્રી કમલસૂરિજી ભોગીને ‘પદવી પ્રસંગે તેઓશ્રીને તો આમંત્રણ જ નહિ આપત્તાનું’ સમજવી લીધેલ! એ સાથે માળનો દિન આવતા સુધીમાં તેમના દ્વારા માળના દિવસે થવાના પંન્યાસપદ સાથે પોતાને બંનેને આચાર્યપદપ્રદાન કરવાનું પણ સમજવી હેવામાં આવેલ.

છાણીની પદવીએ પહેલાં પદુધર કરો.

આ ગડમથલની બાતમી પાઠણસ્થિત પૂ. પ્રવર્તિકજી ભોગીને તથા પૂ. હંસવિજયજી ભોગીને પ્રાસ થતાં તેઓ ચમક્યા. છાણીની તે પ્રચ્છન્ન ગુરુતેગોની ઇલાંત તૈયારીમાં તેઓશ્રીના સમુદ્દરાયવત્તસલહૃદ્યમાં મુનિશ્રી વલલભવિભોગીને તો ગુરુ-પાઠ પરંપરામાંથી જ ઉઘેડી નાખવાની બદ્ધવૃત્તિનો લાસ થયો! આથી પૂ. પં. શ્રી દાનવિભોગીની વડિલ ગણ્યાતા પૂ. મુનિશ્રી વલલભવિભોગી પર સંઘોનું દબાણ લાવીને પણ તેમને પૂ. આત્મારામજી ભોગીના પદુધર તરીકે સ્થાપવાની તેઓને તમજા જાગી. અને એ સાથે જ તેઓશ્રીએ, પંન્યાસ તથા ગુજરાતના

मुख्य मुख्य शहेरे। वगेरेना संघोने लाहोरस्थित पू. मुनिश्री वल्लभविजयल म०श्रीने ३२४ पाडीने पण सः १६८१ना माग-शर शुहि पंचमीनी सवारे ७॥ वागे पू. विजयानंहसूरिल म०श्रीना पट्ठधर तरीके स्थापित करवानी आज्ञा ३२भावी हीधी !

प्रथम पट्ठधर तरीके स्थापना.

उठा प्रकारे पू. प्रवर्त्तकश्री आहि ऊअर्गेना पत्रे। अने तारे। सर्व ४३री स्थगना संघो अने समुदायना मुनिवरे। उपर ३री वणेल. आथी पंजाब तो हर्षपुलकित घनी जवा पामेल ! पत्रे। भणताने वेंत शुक्र आज्ञानुसार प्रभावशाणी गृहस्थोचे लाहोर पडेंची जध पू. मुनिश्री वल्लभविल म०श्रीने स्वगंत दादागुरु पू. विजयानंहसूरिल म०श्रीनी एमने ४ चेताना पट्ठधर घनाववानी महेंच्छाने अनिच्छायेय ३३ ऐसाडवानी ३२४ पाडी. जेतजेतामां ए वात सर्वत्र प्रसरी. परिणामे पहप्रहान अंगेना पूर्वोक्ता नियतहिने लाहोर मुकामे हेश-हेशना एकठा थयेला हजारे भानवेनी भेहनीना लारे हर्षेह्वास वच्ये श्री संघे सवारना ७॥ वागे पू. मुनिश्री वल्लभविल म० श्रीने पू. विजयानंहसूरिल म०ना प्रथम पट्ठधर आचार्य तरीके स्थापित करेल. तेच्योश्री तरक्थी छपायेल ‘पट्ठधर’नी घूकने छेडेनो। पू. आ. श्री कमलसूरिल घूहनो। पत्र पण तेम॒ ज कडे छे.

मारे। पट्ठधर तो। मारे। लक्ष्मिविजय ४ !

आ भाज्जु छाणी मुकामे पू. आ. श्री कमलसूरिल म०श्रीनी निश्रामां उपाधानतप शङ् करावायेल अने तेनी भाणनो। हिवस सः १६८१ना मागशर शुहि ५ ए४ पढवीनो। हिन मुकरर

કરેલ. અને તે પ્રસંગે પ્રસિદ્ધ થયેલ કંકોત્તી વળેરેમાં માલા-રાપણુ મહોત્સવને જ પદ્પ્રદાન અંગેનો મહોત્સવ દેખાવવાનું રાખેલ. પદ્પ્રદાન હિન નજીક આવતા સુધીમાં પૂર્વ સંકેત અને મસલતોનાં ઇલ ઇપે પૂ. આ. મ૦શ્રીથી પૂ. પં. શ્રી દાનવિંમ૦ તથા પૂ. સુનિશ્રી લભિધવિં મ૦શ્રીને આચાર્ય બનાવવાનું પુનઃ નક્કી કરાવી લીધેલ ! આમ છતાં પદ્પ્રદાન પ્રસંગે પૂ. આ. શ્રી કમલસૂરિલુ મહારાજે જણ્ણાવેલ-પૂ. પં. શ્રી દાનવિજયજી મ૦ને તેમના ગુરુ ઉપા૦ શ્રી વીરવિં મ૦ના પદ્ધદર અને પોતાના શિષ્ય સુનિશ્રી લભિધવિં મ૦ને પોતાના પદ્ધદર બનાવવાની-ચુક્તિચુક્તા વાત, પૂ. પં. શ્રી દાનવિં મ૦ને રૂચેલ નહિ. આથી તેઓશ્રીએ પોતાને ઉપા૦ શ્રી વીરવિં મ૦ને બદલે તેઓશ્રીના જ પદ્ધદર બનાવવાની દલીલ કરેલ ! પૂ. આ. શ્રીએ તે દલીલને અયુક્ત જણ્ણાવવાથી ‘તો મારે આચાર્ય બનવું નથી’ ઈચ્છાદિ કહી પૂ. પં. શ્રીએ તે બાખત કેટલોંક વખત ઉચ્ચારવી પણ બંધ કરેલ. આથી શ્રાવકેને પ્રસંગ બગડી જવાનું લાસવાથી તેઓએ વચ્ચમાં પડી હાલ તો બંનેને આચાર્ય જ બનાવવાનું ઠરાવેલાં અને તે જ વખતે ‘તેમાં પણ મારો પદ્ધદર તો મારો શિષ્ય લભિધવિજય જ ગણ્ણાય’ એમ પૂ. આ. શ્રીએ ખલફ્રોડ સ્પષ્ટ કહેલ. એ સ્થિતિમાં નિયત હિને શ્રીસંધ વચ્ચે પૂજ્ય આ. મ૦શ્રીના હસ્તે તેઓ બંનેય પંન્યાસો આચાર્ય બનેલ. અને તેમાં પૂ. પં. શ્રી દાનવિં મ૦ને વડિલ આચાર્ય તરીકે દેખાવાયેલ.

અમે ચોટીલાથી તા. ૨૦-૬-૬૬'ની પ્રસિદ્ધ કરેલ પત્રિકા,

प्रस्तुत पीडिकांगत समस्त लभाणुना निष्कर्षङ्गप होएने ते पत्रिका
पणु अन्न रज्जु करवी जडी छे. आ रही ते पत्रिका:-

पट्टधर अंगे खुलासे।

ता. २०-४-६६ चौटीला.

“तमारा तरक्ष्यी गत वैशाख शुहि त्रीने प्रसिद्ध थयेल
'प्रस्तावनातिभिर लास्कर' नामनी घूळमां पू. आ. श्री
विजयकमलसूरिलु म०ने बहले पू. आ. श्री विजयवल्लभसूरिलु
म०श्रीने आ० श्री विजयानंदसूरिलु म०श्रीना 'पट्टधर' केम
लेखाव्या ? अने आ० श्री विजयदानसूरिलु म०श्रीने बहले
आ० श्री विजयलज्जितसूरिलु म०श्रीने आ० श्री विजयकमल-
सूरिलु म०श्रीना 'पट्टधर' केम लेखाव्या ?” एम अनेक
सुश व्यक्तिओने थती शंकानुं नीचे मुज्ज्ञ समाधान अपाय होके-

पू. आ. श्री विजयकमलसूरिलु म०, पू. आ. श्री विजया-
नंदसूरिलु म०श्रीना पट्टधर होवानी अने आ. श्री विजयदान-
सूरिलु म०, आ. श्री विजयकमलसूरिलु म०ना पट्टधर होवानी
तमारी मान्यता, केटलाक स्वमहत्वाकंक्षी अने परतेजेदेवी
अेवा स्वार्थ साधुओाए साधु अने श्रावकेना परिषणना तोरमां
तेवा प्रकारना वर्षी सुधी झेलावेला भ्रामक प्रयारने आलारी
संखवे छे. कारणु के-

वि. सं. १६८८मां प्रसिद्ध थयेल आ. श्री दानसूरिलु म०
विरचित 'विविध प्रक्षोत्तर' भाग पहेलाना मुख भागे तेओ-
श्रीओ आ. श्री. कमलसूरिलु म०ना झेटामां आ० म० श्री
कमलसूरिलु म०ने आ० म० श्री आत्मारामलु 'विजयानंद-
सूरिलु' म०ना 'पट्टधर' नहि; परंतु 'पट्टप्रकावक' ४

લેખાવેલ છે. એટલું જ નહિ; પરંતુ તે આ૦ શ્રી વિજયકમલ-
સૂરિલુ મ૦ના ખુદ શિષ્ય આ૦ મ૦ શ્રી વિજયલભિધસૂરિલુએ
પણ વિ. સં. ૧૯૬૧માં પ્રસિદ્ધ કરેલ ‘શ્રી કમલલભિધમહો-
દ્યકાવ્ય’ના મુખ લાગે આપેલા તેઓશ્રીના ફોટોમાં તેઓ-
શ્રીને આ૦ શ્રી વિજયાનંદસૂરિલુ મ૦ના ‘પદૃપ્રલાવક’ જ
લેખાંયા છે. તે વગેરે હકીકત જોતાં હું જ નહિ; પરંતુ આ૦
મ૦ શ્રી વિજયદાનસૂરિલુ તથા આ૦ મ૦ શ્રી લભિધસૂરિલુ મ૦
પણ આ. શ્રી વિજયવલલભસૂરિલુ મ. શ્રી જ આ૦ મ૦
વિજયાનંદસૂરિલુ મ૦ના ‘પદૃધર’ હોવાની માન્યતાવાળા
ઠરે છે. આ૦ શ્રી કમલસૂરિલુ મ૦શ્રી તો આ૦ શ્રી વિજય-
નંદસૂરિલુ મ૦ની પાટે પ્રથમ આચાર્ય જ ગણ્યાય છે! (પદૃધર
અને પદૃપ્રલાવક શાખાએ અર્થથી સમાન હોવા છતાં વ્યવહારમાં
નાયકે પોતાની પાટે જે કોઈને સ્થાપેલ હોય તે તેમના પદૃધર
કહેવાય છે. આથી જ આ૦ શ્રી પ્રેમસૂરિલુએ પોતાના પદૃધર
શ્રી રામચંદ્રસૂરિલુને બદલીને તેમના શિષ્ય શ્રી યશોહેવસૂરિલુને
પોતાના પદૃધર બનાવેલ તે વખતે તેઓશ્રીને ‘પદૃપ્રલાવક’
નહિ પણ ‘પદૃધર’ જ જાહેર કરવાનું ચોંચ માનેલ.)

અને એજ પ્રમાણે આ૦ શ્રી વિજયદાનસૂરિલુ મ૦ પણ
આ૦ મ૦ શ્રી કમલસૂરિલુના ‘પદૃધર’ નહિ; પરંતુ ‘પદૃપ્રલા-
વક’ જ હોઈને ‘પદૃધર’ તો આ૦ મ૦ શ્રી વિજયલભિધસૂરિલુ
(જ હોવાનું તેઓ)એ છપાવેલ ‘કમલલભિધમહોદ્યકાવ્ય’
ગત પોતાના જીવનચરિત્રમાંના શ્લોક ૧૨૪થી ૧૩૬ દ્વારા તો સિદ્ધ
છે જ, પરંતુ (તેઓ સં. ૧૯૬૩ થી તેના નવા તિથિમતમાં જે

કખૂલાતથી જોડાયેલ તે કખૂલાત મુજબ) સંવત् ૧૯૮૫ માં પ્રસિદ્ધ થયેલ ‘વિવિધ પ્રક્ષોત્તર’ ભાગ ધીજની પ્રશાસ્ત્રમાં આ૧૦ શ્રી વિજયપ્રેમસૂરિજી આહિએ, પૂરો આ૧૦ માં શ્રી દાનસૂરિજી માં શ્રીને આ૧૦ માં શ્રી વિજયકમલસૂરિજી માના ‘પદૃપ્રલાવક’ તરીકેય લેખાવવા બંધ કરવા પડેલ હોવાથી (અર્થાત् તેમને ઘઢલે તેમના ગુરુમાને જ વિજયકમલસૂરિજીના ‘પદૃપ્રલાવક’ લેખાવવા પડેલ હોવાથી) વિશેષ સિદ્ધ છે. (આનો અર્થ, શ્રી પ્રેમસૂરો આદિને હાથેય ‘શ્રી લભિધસૂરિ આ૧૦ શ્રી કમલસૂરિજીના પદૃધર અને પૂરો આ૧૦ શ્રી દાનસૂરિજી ઉઠો શ્રી વીરવિંદો માના પદૃધર’ એમ નક્કી થયું) આથી આ૧૦ શ્રી વિજયલભિધસૂરિજી અનન્ય પદૃધર હોવાની (અમે પ્રસ્તાવના તિમિર લાસ્કરમાં લખેલી) વાત પણ સાચી છે.

આ પત્રિકામાંના લખાણુની ઉપરનું સમસ્ત લખાણ મધ્યસ્થ ભાવે લક્ષ્યપૂર્વક વાંચવાથી સમજુ આત્માઓને ‘પ્રસ્તુત પત્રિકા તે સમસ્ત લખાણુના સારદ્વે જ છે’ એમ સ્પષ્ટ સમજશે.

મુનિપ્રવર શ્રી રામવિંદો હાથે થયેલ-
‘સકલાગમરહસ્યવેદી’ વિશેષણુનો પ્રારંભ,
અને હજારો ઝોટાએ દ્વારા પ્રચાર.

પૂરો પંઠો શ્રી દાનવિંદો માં, સંવત્ ૧૯૮૧માં છાણી મુકામે પૂરો અનેગી આચાર્યશ્રીના હાથે પણ એ પ્રકારે આચાર્ય ભનવાથી રોખાન્વિત બનેલા તેઓશ્રી, તે સંવત્ ૧૯૮૧નું ચાતુર્માસ (૧૯૮૮માં પ્રસિદ્ધ થયેલ ‘સંક્રમકરણ’ ભાગ ધીજની પ્રસ્તા-

વનાના પૂરો કૃતથી કલમાની આ અંગેની સંઘળી થીના આઠ શ્રી દાન-પ્રેમ-રામ-જાયુરો આહિએ લગભગ ઉપજલી કાઢેલી છે.) પૂરો આઠ શ્રી. કમલસૂરિજી સાથે લેણીઓની કરીને અને તેમાં પણ પૂરો કમલસૂરિજીના પરમલક્ત (ગોધાવાળા) શિષ્ય મુનિશ્રી નરેન્દ્રવિજયજી (કે જેએ આ નૂતન આઠ શ્રીના પ્રતાપે એકલા થઈ જવા પામી સુરત પાસેના માંગરોળ મુકામે નિરાધાર સ્થિતિમાં કાલધર્મ પામેલ !)ની સાથે કલેશ કરવા પૂર્વક આ. શ્રી કમલ-સૂરિજી મ૦નું દિલિહુઃખાવીને સંચાર કરવામાં આચાર્ય-પદ્ધતિના પરમોપકારી આચાર્યશ્રીથી કાયમના આંતરિક કટૂના સ્વરૂપે પોતાના સમસ્ત (પચીશોક) શિષ્ય-પ્રશિષ્યાદિ સહિત અલગા થઈ-વિહાર કરી ગયેલ અને તે સંવંત્ર ૧૬૮૨નું ચાતુર્માસ, તેઓશ્રીએ પોતાના વિશાળ પરિવાર સહિત અમહાવાહ મુકામે તેઓશ્રીથી જુહુ કરેલ. આમ તો પૂરો આઠ શ્રી દાન-સૂરિજી મ૦, ચારિત્રનું પાલન સ્વયમબ્રિ યથાશક્તિ સુંદર કરવામાં અને શિષ્ય-પ્રશિષ્યાદિને પણ સુંદર કરાવવામાં ધણ્ણા સંભળ અને કડકપરિચર્યાવંત હતાઃ તેમાં પણ ભાવમુનિઓનું સંયમ તો પોતાની પ્રકૃતિનું સંયમન કરવા પૂર્વક દ્વારા કરવામાં એક્ઝા હતાઃ માત્ર ઉક્ત પ્રકારે સ્વભાવે ઉભ્ર-મહત્વાકાંક્ષા અને સ્વતંત્ર હતા. તેઓનું એ ગ્રાન્થનું ભાગ્ય ઉચ્ચયજીવન જોઈને અમહાવાહના એધિક ધર્મપ્રેમી પ્રજાજ્ઞાનોનો ધર્મ પ્રતિનોં આદર વૃદ્ધિંગત થએલ.

આ સ્ત્રોમાં પ્રખર વ્યાખ્યાતા મુનિશ્રી રામવિજયજી મ૦શ્રીની હંમેશાં ચાલુ રહેલ ધારાખ્રદૈરાયવાહિની દેશનાના પ્રતાપે એ જૈનપુરીમાંના ડેટલાક સુખી ધરના પુણ્યત્માઓ પણ

ભવવૈરાગ્ય પામી ઉક્ત મુનિશ્રીના શિષ્ય તરીકે કેમે 'ઇ' એક સંખ્યામાં દીક્ષિત બનેલ. આથી મુનિરાજ શ્રી રામવિં મ૦, શ્રી સંઘોમાં સર્વત્ર પ્રલાવકમુનિ તરીકે લેખાવા માંડેલ. આ દરમ્યાન ત્યાં તેઓશ્રીથી આકર્ષણેલ આ. શ્રી મેધસૂરિલુમ૦ની રૂ. ૧૬૦૦૦)ની સહાય મળી જવાથી તેઓશ્રીએ ધૃષ્ટ માન્યતા-ઓના પ્રચારાર્થે અમહાવાદમાં પોતાનું 'વીરશાસન' નામનું છાપું ઉલ્લું કરેલ. તે પત્રમાં તેઓએ મુખ્યને પૂ. આ. શ્રી દાનસૂરિલુ મ૦શ્રીને પ્રસન્ન રાખવા સારુ તેઓશ્રીના પ્રશ્નોત્તરો તો ખાસ છાપવાનું રાખીને તેઓને 'સક્તાગમરહસ્યવેદી'ના કદિપત ઉપનામથી બિરુદ્ધાવવાનું પણ શરૂ કરેલ. (જે કે-તે ઉપનામ, પૂ. આ. શ્રીએ તો પોતાના 'વિવિધપ્રશ્નોત્તર' ભાગ પહેલા (સં. ૧૬૮૮) સુધી પોતાને માટે અનુચ્છિત જ માનેલ છે.) અને એ સાથે પ્રલુશાસનની સેવાના આકર્ષક એઠા તળે મુખ્યત્વે તેઓશ્રીના વડિલો અને સમુદ્ધાયની પ્રશસ્તિ વિસ્તારથી વર્ણવવાનું રાખેલ. તેમાં પણ વડિલોને મહાન् ટાઈટલોવાળા લેખાવવાથી જ પોતે મહાન્ લેખાવાના ધ્યેયને અનુસરીને એ મહાચકોર પ્રખરવક્તા મુનિશ્રીએ બીજુ બાળુથી એ જ અમહાવાદમાં પોતાના 'સ્વો પૂઠ આઠ આત્મારામજી મ૦, પૂઠ કમતસૂરિલુમ૦, પૂઠ ઉઠ શ્રીવીરવિં મ૦ તથા પૂઠ આઠ શ્રી દાનસૂરિલુમ૦' વગેરે વડિલોને ગમી જય તેવાં આકર્ષક વિશેષણો લગાડીને ફરેકના ૭x૧૦ની સાઈઝના શ્રી કદરના (જડા આર્ટ્પેપર ઉપર) પાંચ-પાંચહજાર ફ્રેટાએ છપાવી ગામે-ગામ પ્રચારવા શરૂ કરી દીધેલ ! (જેમાંના વધેલા ફ્રેટાએ પૂઠ દાનસૂરિના 'વિવિધપ્રશ્નોત્તર'ના એ ભાગમાં તેમજ 'સંકુમકરણુ' વગેરેમાં પણ મોખરે ગોડવાએલ છે.)

શ્રીસંગોમાં એ વિરહ તો હદ્દરથી લેખાયેલ

સંભૂતિના તે અમદાવાદના ચાતુર્માસમાં પૂર્ણ આં શ્રી દાનસૂરિજી મંદ્રાને, સુરત જીવાનમાં આં શ્રી લભિધસૂરિજી આદિ એ-ત્રણું સાધુ સાથે જ રહી જવા પામેલ પૂર્ણ આં શ્રી કમલસૂરિજીમં, બુહારી મુકામે બિમાર હોવાના સમાચાર મળેલાં તે ચાતુર્માસ પૂર્ણ થયે તેઓશ્રીએ, તે જીવાન અને ઉપકારી આં મં શ્રીની સેવામાં પાંચેક સાધુઓનેય (મોકલવાનો માત્ર હેખાવ કરવા પૂર્વીક) મોકલવાનું મોકુડ રાખીને લ્યાંથી સીધો ખંલાત લણ્ણી વિહાર લંબાવેલ ! ત્યાં દ દીક્ષા થવાનો લાલ પ્રચારાયેલ; પરંતુ તે લાલ પણ પછીથી ખંલાત આવી પહોંચેલ મુનિશ્રી રામવિં મહારાજે આપેલી જેરહાર વૈરાગ્યવાહિની હેશનાના શ્રવણ પછી જ થયો હતો, અને ત્યાંની ‘ઝૈનશાળા’ના આગેવાનોને વશ કરીને તેઓ પરનો પૂર્ણ આં શ્રી નેમિસૂરિજી મંદ્રાને વર્ષો જુનો કબજે પણ તે મુનિશ્રીના પ્રતાપે જ પોતે હસ્તગત કરી શકેલ. આ સંનેહોમાં પૂર્ણ આં શ્રી દાનસૂરિજીને તો બુહારીથી વિહાર કરી પૂર્ણ આં શ્રી કમલસૂરિજી પધારેલ ગામ જીવાલપુર જવાને બહલે ખંલાત ઉપરી જવાની જરૂર જ કચાં હતી ? છતાં ખંલાત ઉપરી ગચ્છેલ ! અને તેવામાં તો તેઓશ્રીને પૂર્ણ આં શ્રી કમલસૂરિજીમં, મહાવદ્ધિ દના રોજ (નવસારી પાસેના) તે જીવાલપુર મુકામે કાળધર્મ પાભ્યા હોવાના પણ સમાચાર મળેલ ! એટલે તો પૂર્ણ દાનસૂરિજીમંશ્રીને તે સહૃગત આં શ્રીનો એ વિરહ તો શ્રી સંગોમાં તેમનાથી તેઓ જુહા પડચા લારનો જ લેખાવા પામેલ ! વડિલો પ્રતિનો આ કેવો વિવેક ? કેવો અક્રિતિલાવ ?

તે તે જીવનચરિત્રના લેખકોએ બીજું વત્ત
યાદ રાખેલ જ નથી !

સં. ૧૯૬૮રથી ૨૦૧૧ સુધીમાં તેઓશ્રીના સંતાનીયાઓએ
(મુખ્યત્વે સંક્રમકરણ ભાગ ભીજાની જુટી પ્રસ્તાવનાના આધારે)
પોતાના તે તે પ્રકારના ગુણી વડિલોનાય ‘પ્રથમ પદ્ધતિ-સકલા-
ગમ રહુસ્યવેદી’ આદિ અનેક કલ્પિત અને વિચિત્ર ટાઇટલો
લગાડીને અનેક જીવનચરિત્રો અજાયણી પમાડે તેવાં ઘડી કાઢ્યાં
છે; પરંતુ તેમાં તે તે ચારિત્રણેમી ગણ્યાતા લેખકોએ જે—પોતાના
તે તે વડિલોની ઉપરોક્ત વાસ્તવિક ઘટનાઓને ધૂપાવવા ઉપ-
રાંત પૂર્વધર કાદીન મહામુનિઓના ગુણોને પોતાના તે તે વડિ-
લોના ગુણો તરીકે વર્ણવીને પોતાના વડિલે ને લાડુતી શાફિક
અદંકારોના સાથીયા પૂરવાપૂર્વક પૂર્વના મહાપુરુષો જેવા મહાનુ-
લેખાવવા દ્વારા અશ્રદ્ધેયડૃપક આપેલ છે: અને તેમ કરવા વડે
તે તે લેખકોએ જે—‘પોતાના વડિલોને વર્ત્માનકાલીન અન્ય-
સમુદ્ધાયના સર્વ આગાર્યો કરતાં બચાતકારે જ ભારે શ્રેષ્ઠ લેખાવવા
યતન કરેલ છે’ તે યતન તો તે તે લેખક મુનિઓમાં રહેલ દિશિ-
રાગના પ્રતીકર્ષય છે. કારણ કે—જે ભીનાઓ, સં. ૧૯૮૭ના
‘સંક્રમકરણ’ના ઘેલા ભાગની પ્રસ્તાવના સુધી નથી તે તે
ભીનાઓ, તે સં. ૧૯૮૮ના ભીજ ભાગની પ્રસ્તાવનામાં સં.
૧૯૮૮માં પોતાના વડિલોના હાથે કલ્પિતપણે જ દાખલ થયેલ
હોવાનું તેઓ પણ જણે જ છે.

એ પ્રયાસ વડિલોના ગુણોનો લોપક પણ ગણ્ય

ત તે વડિલોના તે તે સંતાનીયાઓએ તેઓશ્રીનાં તેવાં

અસત્ય જીવનચરિત્રા, સં' ૧૯૬૮રથી સં' ૨૦૧૧ સુધીમાં તો જુદા જુદા પ્રકારેય માલ ભૂકીને લખ્યાં છે અને તેની હળવેની સંખ્યામાં બૂકે છપાવીને તેઓએ પ્રચારાર્થે શ્રીસંઘામાં પ્રાયઃ સર્વત્ર મફત પણ મોકલી આપેલ છે ! તે કહેવાતા સુવિહિતોનો જ્ઞાનદ્રવ્યનો પણ કહેવાતો સહૃપચોગ એ પ્રકારનો છે ! તેવાં ભાત ભાતનાં જીવનચરિત્રામાં તે તે લેખકોએ પોતાના તે તે વડિલોના છતાશુણોને સીકૃતપૂર્વક છપાવીને અછતા શુણોને આળેખેલ હોવાથી તે લેખકોનો તે પ્રયાસ, તે તે વડિલોમાં પણ જે પ્રભુશાસનની ધગશ અને ચારિત્રશીલતાદિ વાસ્તવિક આત્મશુણોનો અળકાઈ હતો, તે અળકાટનો તો ભાવિ શ્રીસંઘને ભાસ જ નહિ થવા હેવાડુપ પણ ગણ્યાય.

‘પદ્ધતિ’ નક્કી કરવા માટે આ પીડિકા નથી.

પ્રસ્તુત પદ્ધતિ અંગેની ચર્ચા, પૂઠ આત્મારામજીમંદ્રશીના સંપ્રદાયનો વિષય હોએને તે ચર્ચામાં ઉપરોક્ત પ્રકારે મારે ઉત્તરવું તે શુક્તિશુક્ત નથી; પરંતુ પૂઠ આત્મારામજીમંદ્રશીના પદ્ધતિ અને સમયધર્મી ગણ્યાતા પૂઠ આઠ શ્રી વિજયવલ્લભસ્તુરિલુમં પણ શાસનપક્ષની જે—‘અસજજાય-અહણ-સૂતક અને બારપર્વી વર્ગેરેની આચરણામાં સંમત છે તે આચરણાને આ નવો વર્ગ, પોતાને પૂઠ શ્રી આત્મારામજીમંની પાટે મનાવીને ખોટી લેખાવવામાં કેટલા સાચા હોઈ શકે ?’ તે વસ્તુ શ્રી શાસનપ્રેમી સંઘના ઘ્યાલ પર લાવવાના શુલ ઉદેશથી જ તેઓશીનો આ ઘરગત્યુ વિષય પણ એ પ્રકારે મારે વિશાદ અને તલસ્પશીં પદ્ધતિએ ઉપર રજુ કરવો આવશ્યક બનેલ છે. જે વાંચી વાંચકે સમજ શકે કે—‘જેઓ પોતાના સમુદ્ધાયના વાસ્તવિક પદ્ધતિને

પણ પદ્ધત નહિ લેખાવા હેવા સાર્થ અનેક ઐટાં લખાણો અને કુતકો કરી શકે છે તેઓ અન્ય સમુદ્દરાયની વાસ્તવિક હકીકતોને તો હકીકતદ્વારે નહિ જ સમજવા હેવા સાર્થ અનેક ઐટાં લખાણો કરે તેમાં આચર્યાં શું ?' ઇતિ શમ્.



'નિજમતિ'ને 'જિનમતિ' લેખાવવાનાં કંપરાં ફ્રેનોનો સાક્ષાત્કાર.

સંઠ ૧૯૮૮ થી ૧૯૮૯ના ગાળાની વાત છે કે—“શ્રી શ્રમણ-સંઘમાંના પૂરો આર્થ શ્રી વિજયવલલભસૂરિજીમો માટે શ્રી શાસન-પ્રેમી જૈનસંઘોમાં સુધારક અને સમયધર્મી આચાર્ય તરીકેની વ્યાપક છાપ હતી. તેનું મુખ્ય કારણ તેઓ શ્રીનું ‘જૈનયુવકેને જૈનધર્મની કેળવણી આપવા પર વધુ લાર આપવા કરતાં પાશ્ચાત્ય કેળવણી આપવા—અપાવવા પર વધુ લક્ષ આપવું’ એ ધ્યેય હતું. આથી તેઓ શ્રી, આ હેશ—કાલાનુસાર શ્રાવકશૈત્રનો ઉદ્ઘાર સામાયિક-પ્રતેકમણ્ણાદિ કરતાં વિધાલયો—કેલેજો—ઐર્ડિંગો અને વ્યાચામશાળાએ દ્વારા સહેલાઈથી થવાનું જણાવતા. એ માટે તેઓ સુપનનું હેવદ્રોય ગણ્ણાતું દ્રોય, સાધારણુમાં લેવરાવતા અને ઉપધાનાદિ ધર્મનુષ્ઠાનોના સદ્ગુરૂયયને ‘ધૂમાડો’ કહેતા ! આથી ધર્મપ્રેમજૈનોનાં દ્વિલમાંથી તેઓ પ્રતિની જૈન આચાર્ય તરીકેની શ્રદ્ધાન પાયા હુચ-મચી ઉઠેલ. આમ છતાં તે વખતથી જ ‘આણું ધર્મમો’ સૂત્રને વાત—વાતમાં આગળ કરવાની હિમત ધરાવતા થેમેલા પૂરો આર્થ શ્રી દાનસૂરિજીમો, (તે વખતે તો લગભગ ૪૦ રેટલા સાધુનો વિશાળ સમુદ્દર અને મુનિ

શ્રી રામવિંભેવા પ્રખરવક્તા પણ ધરાવતા થયા હોવા છતાં) તે પૂર્ણ વિજયવલ્લભસૂરિલુમ્ભોશ્રીના તે તે વિચારે અને વાણીને જહેર વિરોધ કરવાની હિંમત કરી શકતા નહિ. સંંઠ ૧૬૮૪માં મુખ્ય ગોડીલુમાં ચાતુર્માસ રહેલ તેઓ શ્રીના જોડીયા આંઠ શ્રી લાલભસૂરિલુમ્ભો પણ એ સામે જહેર વિરોધ ઉઠાવવાની હિંમત કરી શકેલ નહિ ! એ તો પૂર્ણ આગમોદ્ધારકશ્રી મહારાજ એક જ કે— તે વખતે તેઓ શ્રીએ એ સામે અમદાવાદથી ‘આદિતકેનું કર્ત્તાંય’ બ્યૂકદ્વારા ‘ઝડપ જાવ’ની મજબૂત લાલખતી ધરી દૃઢને સર્વ સ્થાનના શાસનપ્રેમી જૈનસંઘાને આરાધનાના માર્ગનાં સ્થિર તેમજ સતેજ બનાવી દીધેલ !

તે કાળો તેઓ પ્રતિનો અમારે પ્રખલ અનુરાગ

‘પૂર્ણ આગમોદ્ધારકશ્રીએ ધરી દીધેલ એ લાલખતીના પ્રકાશમાં પોતાને જેઈતું એ જગ્યાર જ્ઞાનખલી પૂર્ણ આગમોદ્ધારકશ્રીનું પીડિયળ તો છૂપાયેલું ર છે’ એમ તે પૂર્ણ આગમોદ્ધારકશ્રીની શાસનરક્ષા અંગેની અનેક વખતની અસ્થિલિત કર્ત્તાંય પરાયણુતાના અનુભવી પૂર્ણ નાંઠ શ્રી દાનસૂરિલુમ્ભો સમજતા હોવાથી એ પછી તો તેઓ શ્રી પણ પૂર્ણ આ. શ્રી વલ્લભસૂરિલુમ્ભોશ્રીના તે તે વિચારે, વાણી અને વર્ત્તનો સામે મુનિશ્રી રામવિંભો દ્વારા કેમે સખત વિાધ પણ જહેર કરાવવાની હિંમત કરી શકેલ. આ જેઈ શાસનપ્રેમી જૈનસંઘાએ બંને આચાર્યાને કપરાકાળે શાસનનું રક્ષણું કનાર તરીકે હૃદ્ય-કમલમાં અબ્રસ્થાન આપેલ. તે માન જેઈને પૂર્ણ આંઠ શ્રી વલ્લભસૂરિલુમ્ભોને માનનારા મુખ્ય હુવકોએ ‘મુખ્ય

जैनसंघ'ना नामे पत्रिका प्रसिद्ध करीने 'मुंबद्ध मांगरोण जैनसभा पायधुनी'ना विशाण होलमां परमाणुंह कुंवरल्लना प्रमुखपण्यातणे जैनोनी जैनसभा योज्य. केमां एकठा थयेला सातसोऽक जैनोनी इथर्ते पत्रिकाना लभाणु मुज्य 'आ० श्री आनंदसागरसूरिल अने मुनिश्री रामविजयल जैनसाधु ज नथी.' एम सर्वानुभते ठराव करवानुं राखेलः [ते सलामां सुश्रावक लगुलाई हालालाई (हाल पू० पं० श्रीलक्ष्मंकरविंभ०) ना नेतृत्वतणे १६ धर्मप्रेमीओ साथे लध-ते सलानी झुरशी-ओनी सामसामी पहेळी सीटोमां सलाना टाईम अगाउथी ज गोडवाई जधने] आ लेखके ज ते सलाना प्रमुखनो सज्जड विरोध उठावेल. के-जेना परिणामे ते सुधारकेाओ, करवा धारेल प्रस्तुत ठराव पडतो भूझी वेरविभेरपणे लव लहने नासी छूट्युं पडेल. ए पछीर्थी प्रबुशासनना ते बंने शासनरक्षक महात्माओने जैन ज नहि लेखाववानी बदमुरादने मुंबद्धना ते ते सुधारकेाओ सहाने माटे समेटी लेवी पडेल ! ते ते महात्माओ प्रतिनो ते काणे अमारै अनुराग तेवो प्रबण हुतो.

आचार्यश्रीने अमारा नामे श्रीरामविंचे ज लांडेल हे.

मुंबद्ध गोडील्लम०ना उपाश्रय अने पाठशाळामां कियाकांड तथा धार्मिक अव्यास करनार्दं अमारै— 'श्रीनवपूर्व आराधक सभाज'ना संस्थापक श्रीयुत चीमनलालबाई पटवा (चंद्रसागरसूरिल)ना नेतृत्वतणेनुं साडेक धर्मप्रेमीलाईओनुं मंडण, पू० आगमोङ्कारक आचार्यमहाराजश्रीनुं परमलक्तमंडण हुतुं. आथी मुनिश्री रामविजयलुओ उपर जण्यांया प्रभाणे

જ્યારથી તેઓશ્રીના સૂરમાં સૂર પૂરાવવા મંડળો ત્યારથી અમારું તે મંડળ તેઓશ્રીનું પણ અનુરાગી બનેલ. અને પૂરું આરું શ્રી વલલભસૂરિલુમ૦નું સં. ૧૯૮૫નું ચાતુર્માસ મુંબઈ ગોડિલુમાં નક્કી થવાથી તેઓ સામે મંડળના અમે સત્તર લાઈએઓએ સુરત જઈ પૂરું આરું શ્રી દાનસૂરિલુમ૦ને વિનિતિ કરી તે ચાતુર્માસ મુંબઈ લાલભાગમાં મુનિશ્રી રામવિ.મ૦નું ગોડવેલ. તેઓશ્રીનાં તે વખતનાં ‘એકલવિહારી મુનિશ્રી પ્રતિ પણ સદ્ગ્રાવ-દર્શક’ રોચક વ્યાખ્યાનોનાં શ્રવણથી અમારો તેઓશ્રી પ્રતિનો અનુરાગ ગાઠ બનેલ

કેમે અમોને દઠરાગી બન્યા જોઈ (માનવું થાય છે કે-પૂ. આ. શ્રી દાનસૂરિલુમ૦ની ખાનગી પ્રેરણાથી) મુનિશ્રી રામ-વિજયલુ મહારાજે પોતાનાં વ્યાખ્યાનોનું પાસું બદલેલ અને તેમાં પૂરું આરું શ્રી વલલભસૂરિલુમ૦શ્રીના વિચાર અને વાણીને આડકતરી રીતે શાસનના ખુલ્લા અને અસદ્યદ્રોહી તરીકે ભારે સીકૃતભરી રીતે વર્ણવવા શરૂ કરેલ. આથી આગલી પાછલી હુક્કીકતોના ખ્યાલ વિનાના અમોને પૂરું આરું શ્રી વલલભસૂરિલુ મ૦શ્રી ઉપર ભારે દ્વેષ પ્રકટેલ. અમારી આ સ્થિતિનો લાલ લઇ તેઓએ ‘પદૃધર કોણું?’ ની ચર્ચા ઉપડેલ, તે અંગેની લગ-ભગ પોતે તૈયાર કરેલી એક ખૂક પણું છપાવેલ, અને ‘એક સ્વર્પનો સ્ફોટ’ નામની પ્રગટ કરાવેલી બીજી ખૂકમાં તો તેઓએ અમોને પૂછ્યા વિના જ અમારા નામે પૂરું આરું શ્રી વલલભસૂરિલુને અનેક ભૂંડા ઉપનામોથી પણ લાંડેલ ! (જુઓ અમારી સં. ૧૯૯૨ની ‘દિશા ફેરવો’ નામની ખૂકના પૂરું ૨૪-૨૫)

પૂ. આ. શ્રીએ આપેલ ઐકચતાની ખાત્રી.

સં.૦ ૧૯૮૬નું ચાતુર્માસ પણ મુખ્ય તે જ સ્થળે કરીને
તેઓશ્રીએ, સં.૦ ૧૯૮૫માં આ લેખકને તંત્રી અનાવીને કાઢેલ
'નૈન પ્રવચન' છાપાને ધણા આહકો અનાવવાહિ વડે સલર
કરેલ. સં.૦ ૧૯૮૫નું તે આખું વર્ષ તેઓશ્રીએ શાસનપ્રેમી
માત્રને રૂચી જય તેવાં અસહનાં ખંડન અને સહનાં મંડનપૂર્ણ
વ્યાખ્યાનો આપીને પૂ.૦ આગમોદ્વારક આ.૦ મ૦શ્રીના પણ કેટ-
લાક ચૂસ્ત અનુરાગી નૈનોને નિજના વધુ પડતા અનુરાગી
અનાવી દીઘેલ. પછી તો તેઓએ તે પછીનાં વ્યાખ્યાનોમાં
પોતાના પ્રચારનું સમર્થન નહિ કરનારા શાસનપ્રેમી પૂ.૦ આ.૦
શ્રી નેમિસૂરિલુમ૦શ્રીની અને પોતાના પ્રચારનું—આગલું પાછલું
સંલાળીને—સમર્થન કરનારા પૂ.૦ આગમોદ્વારક આ.૦ મ૦શ્રીની
પણ પ્રવૃત્તિ તેમજ નિવૃત્તિ અંગે કવચિત કવચિત માર્મિક
ટીકાએ કરવાનું ચાલુ કરી દીઘેલ !

આ વસ્તુ જોઈને ચમકેલા અમોને “તે મુનિ પ્રતિ શાસન-
લક્ષ્ણે બદલે સ્વમહત્વાકાંક્ષીપણુંની શંકા જવા સાથે વખત
જતાં શાસનના સહુ પૂ.૦ આચાર્યાહિ મુનિલગવંતો કરતાં
પોતાને જ શ્રેષ્ઠ શાસનલક્ષ્ણ મનાવવા મથે તો ના નહિ,” એમ
પણ શંકા ગયેલ. કો એમ બને તો આખું પ્રલુશાસન જ ડોળાઇ
જવા પામીને ગામે ગામના શ્રીસંઘેમાં કલેશને દાવાનલ લભૂકી
ઉઠે ! જે લલલલાએ પણ ઉપશમાવવો કઠીન બની જય. મુનિ
શ્રી રામવિ.૦મ૦શ્રીનાં ઉપરોક્ત વલણુથી પ્રલુશાસનની તેવી
સંભવિત સ્થિતિ ઉલ્લી થવા ન પામે એ સારુ અમોને તેઓ-

શ્રીનાં તે વલણુ ઉપર અતિપરિચિત પૂઠ આઠ શ્રી દાનસૂરિજીમ૦
 શ્રીના હાથે કડક અંકુશ મૂડાવવાની જરૂર જણાયેલ. બાદ
 એજ શુભાશયથી આ લેખકે; સંઠ ૧૯૮૭ના કાઠ્યો ૩૦ તના રોજ
 -પૂઠ ગુરુમ૦શ્રી ચંદ્રસાગરજીમ૦શ્રીના શિષ્ય તરીકે-તે પૂઠ આઠ
 શ્રીના હાથે જ મુંબદ્ધ દીક્ષા અહણુ કરીને અને તેઠલો વખત
 તેઓશ્રીની સાથે જ રહેવાનું રાખેલ. બાદ ખાનગીમાં પૂઠ આઠ
 મ૦શ્રી સાથે અનેક વખત થયેદી ઘણું લાલાલાલની વાતોને
 અંતે તેઓશ્રીએ પ્રસન્નચિંતા હિલથી જણાવેલ કે-“શાસન
 પરના આકારણુ અંગેની શ્રી નેમિસૂરિજીની ઉપેક્ષા તો
 ટકેરપાત્ર છે જ; પરંતુ સાગરજીમની પ્રતૃતિ બદલ
 પણ ટકેર કરાય તે રામવૈની ભૂલ છે; હું તેને તેમ
 કરતો જરૂર રોકીશા: વર્ત્માન કાલે સાગરજી મંજેવો
 ક્ષયોપશમ કોનો છે? અમોને પણ ગંલીર સૂત્રાથેનો
 સર્વમાન્ય ઉકેલ તો આજે તેમનાથી જ આમ હોઈને
 સાગરજી અને અમો એક જ છીએ અને રહેવાના,
 એમ આત્મી રાખવી.” તેઓશ્રીએ આપેલ તે ખાત્રીથી આ
 લેખકે લારે સંતોષ બનુલવેલ, અને તે સંઠ ૧૯૮૭નું ચાતુ-
 ર્માસ તેઓશ્રીની આજાથી વીલા-પારલા કરેલ.

પૂઠ દાનસૂરિજીમની પ્રચારથી થયેલો ઐદ.

‘આસો શુદ્ધ ૧૦થી ચતુર્થી વત અને ઉપધાનની માત્રાંપણુ-
 ની નાણુ મંડાય છે, અને આરવનની નાણુ તો તે પહેલાં પણ
 મંડાતી જણાતી હોવાથી આસો શુદ્ધ ૧૦થી દીક્ષા-વડીદીક્ષાદિ
 અંગેની નાણુ તો ખુશીથી મંડાય’ એવી શાસ્ત્રીય સાધાર સમજને

તેમજ ચોમાસામાં પણ અપાયેલી અનેક હીક્ષાએના દષ્ટાંતોને આધારે પૂરો આગમોદ્ધારક આ૦ મ૦શ્રીએ, તે સં.૦ ૧૬૮૭ના આસો શુહિ ૧૦ના હિને એક ખાલમુખુને અમદાવાદ-વિદ્યાશાળામાં હીક્ષા આપવાનું રાખેલ. એ સામે મુંબઈ-લાલબાગથી પૂરો આ૦ શ્રી દાનસૂરિજી મહારાજે, ‘ચોમાસામાં હીક્ષા ન અપાય’ એ શબ્દોથી અંગત શ્રાવકોમાં પ્રચાર કરવા માંડેલ અને તે પ્રચાર અમદાવાદ ચંગમેન્સ જૈન સોસાયટીવાળાએને પણ પહેંચાડેલ! તે લાઇએચે, પૂરો આગમોદ્ધારકશ્રીને હીક્ષાના આગલા હિવસે મળીને—“આપશ્રી જે કરતા હો તે સાધાર જ હોયઃ છતાં વિજ્ઞસંતોષીએ આ હીક્ષામાં ચોમાસાના ઝહાને દખલ ઉલ્લિ કરે તેવે સંભવ હોવાથી આપશ્રીને વિનંતિ છે કે-કાલને બદલે ચોમાસું ઉત્તરેજ હીક્ષા આપવાનું રાખવા કૂપા કરો.” સરલ-હૃદયી પૂરો આગમોદ્ધારકશ્રીએ પણ તેઓની તે વિનંતિ સ્વીકારીને તેમ રાખવા કહેલ.

બીજે હિવસે તે જ લાઇએચે આવીને પૂજ્યશ્રીને વળી— ‘સારું થયું કે-આપશ્રીએ આજની હીક્ષા ખંધ રાખી; નહિતર એ સામે અમો જ વાંધો ઉડાવવાના હતા’ એ પ્રમાણે કહ્યું! એટલે પૂજ્યશ્રીએ તેઓના હીક્ષાપ્રેમનું તરત જ મૂલ્યાંકન કરીને તેઓને—‘જે એમ જ હતું તો તે હીક્ષા અહિ આવતીકાલે આપવાની છે.’ એમ સ્પષ્ટ જણાવવાથી તેઓ ખિજ્જવદને ઉઠીને ચાહ્યા ગયેલ અને પૂજ્યશ્રીએ આસો શુહિ ૧૧ના હિને તે સુસુકુને હીક્ષા આપેલ: એ સમાચાર મુંબઈ પૂરો આ૦ શ્રી દાનસૂરિજી મ૦ને મગતાં તેઓશ્રીએ, ‘ચોમાસામાં હીક્ષા અપાય જ નહિ:

છતાં તેમણે આપી ! હું ન આપું' એમ લક્ષોમાં વધુ જેરથી પ્રચારવા માંડેલ ! આ હકીકત, વીલા-પારવા મુકામે મને જાણવા મળતાં લારે ઐહ થયેલ.

આમાં આપશ્રીએ આપેલ ખાત્રી કચાં રહી ?

ચાતુર્માસ પૂર્ણ થયે વીલા-પાર્વતીથી વિહાર કરી કાર્તિક-વહી એકમે પૂર્ણ આર્થ મંદ્ર શ્રીની સેવામાં મુંખું આવેલ. તેઓ-શ્રીને વિધિપૂર્વક બારમાસી ખામણા કરી મેં શાંતિથી અને વિનંતિઝે કહેલ કે—“ આપશ્રીએ મને ‘સાગરજીમંના જેવો ક્ષોપશમ વર્ત્તમાનમાં કેાઢનો પણ નહિ હોઠને અમારે પણ સૂક્ષ્મ અર્થો જાણુવાનું સ્થાન તેઓ જ હોવાથી સાગરજી મહારાજ અને અમે એક જ છીએ અને એક જ રહેવાના ’ ઈત્યાદિ પ્રકારે ખાત્રી આપી હતી, છતાં પૂર્ણ સાગરજી મહારાજે આસો શુદ્ધ ૧૧ના રોજ અમહાવાહ આપેલ દીક્ષા બદલ આપશ્રીએ શ્રાવકેામાં ‘ચોમાસામાં દીક્ષા તે આપે, હું ન આપું’ એમ પ્રચાર્યું, તે આપના મનમાં ‘સાગરજી મંદ તો ભાત્ર આગમો જાણેલા છે; પરંતુ નેનાં રહસ્યોનો જાણ હું છુ’ એમ બું હોય તો જ બને ને ? અને જે તેમ હોય તો પણ આપશ્રી દ્વારા થયેલા એ પ્રચારમાં આપે મને આપેલ તે ખાત્રી કચાં રહી ? ”

સુરત જઈ આ વાતનું ઉપશમન કરીશ.

મારી તે દર્દીલરી વાતને સહજ પણ ઉશ્કેરાટ વિના-સાંભળીને તેઓશ્રીએ મને તદ્દન સરલભાવે જાણુવેલ કે—“સાગરજી ! મેં તો સર્વ આગમો પૂરા વાંચ્યા પણ નથી, તો તેનું રહસ્ય તો જાણું જ કચાંથી ? કે-જેથી મારા મનમાં તેવું બેનું

હોય ? બાકી હવે તો તમે સંસ્કૃત પણ ભણ્યા હોવાથી જૂએ આ—અમદાવાદથી શ્રી સિદ્ધસૂરિજીમહારાજે મોકલેલા—ચોમાસામાં દીક્ષા અપાય નહિ, એમ જણાવનારા પાડો વાંચ્યાઃ હું તો તે પાડોના આધારે એમ બોલેલ છું. બાકી મારે સાગરજીમોટ્ઠે લેશ પણ જુદાઈ નથી.” જવાખમાં મેં કહેલ કે—‘સાહેબ ! મારે પાડો જેવાના હોય નહિ, બાકી જે આપશ્નીને જુદાઈ નથી તો તે પાડો આપે ઐકયતા ખાતર પૂર્ણ સાગરજીમોટ્ઠીને મોકલી આપવા ઘટતા હતા; પરંતુ આમ શ્રાવકોમાં પ્રચાર કરવો ઘટતો નહોતો.’ તે બદલ તેઓએ કહેલ કે—‘તમારી એ વાત ઠીક છે અને એ હિસાએ ઉતાવળ થઈ ગણ્યાય.’ એ સાંલળીને મેં કહેલ કે—‘સાહેબ ! આ વાત હવેથી પ્રચારવાની બંધ કરશો. અને હું અહિંથી વિહાર કર્યા બાદ સુરત જઈ પૂર્ણ સાગરજીમોટ્ઠીને મળીને આ વાતનું ઉપશમન કરી નાખીશ’ એ સાંલળી તેઓ ખુશી થયેલ.

માન્યતાએ કંબૂદ્યા પછી પણ ‘તે’ ના ‘તે’ જ રહેલ !

બાદ તે સંવત् ૧૯૮૮માં મુંબઈથી વિહાર થયેલ, તેમાં ઘાટકોપર આવતાં વળી પાછા પૂર્ણ દાનસૂરિજી મહારાજે શ્રી શંખેશ્વરતીર્થી પૂર્ણ આગમોદ્ધારકશ્રીએ, ‘ગલાઈમ’ પાડના આધારે જન્મથી છ વર્ષ રાાં માસ અને એક દિવસ પૂર્ણ થયેલ એક બાલમુમક્ષુ (મુનિશ્રી અલયસાગરજી)ને આપેલ દીક્ષાને પણ અપલયવી શરૂ કરેલાં છતાં તે વાતને પણ (ઉપશમાવી જ હેવાના સદાશયથી) પીઠ જઈને આ લેખક, ચાર સાધુયુક્ત વિહાર કરી ૫૦ પૂર્ણ આગમોદ્ધારક આંત મોટી નિશ્ચામાં

સુરતસ્થિત સ્વસમુહાયમાં મળી ગયેલ. તેવામાં મુંબદ્ધિ આવી રહેલ પૂરો આઠ શ્રી દાનસૂરિલુ માટે પણ અમોસૌ સાધુના સ્વાગત સહિત શ્રી જંખૂવિં આદિ પરિવાર સાથે સુરત પથારેલ, અને પૂજયશ્રીથી કરી લીધેલ વિવાહોપશમનના ચોગે નેમુભાડની વાડીના ઉપાશ્રયની પાછળની ધર્મશાળામાં (માળ ઉપર પૂરો આગમોદ્ધારકશ્રી હોવાથી) નીચે શાંતિપૂર્વક ઉતરેલ. છતાં પૂ. આગમોદ્ધારકશ્રીને મળીને મતલેહો સમજુ લેવાનો તેઓ-શ્રીએ એ દિવસ સુધી કશો જ પ્રયાસ કર્યો નહિ ! આથી ત્રીજે દિવસે આ લેખકેજ નીચે તેઓશ્રીને મળી ૧૧ બજે શ્રી જંખૂવિં સહિત ઉપર લાવીને પૂરો આગમોદ્ધારકશ્રીની સાથે તે તે મતલેહો ચર્ચી લેવાની કરજ પાડેલ. મુખ્યત્વે ચોમાસાની દીક્ષા અને ગર્ભાધિમની દીક્ષા અંગે પૂરો આગમોદ્ધારકશ્રીએ, શ્રી જંખૂવિં (પૂ. દાનસૂરીએ તો મૌન જ પકડેલ.) ને હોઢેક કલાક સુધી સમાધાનો આપેલ. જોચરી બાદ બપોરે ઉપાશ્રયના ઉપરના હોલમાં પ્રાય: અઢીથી પાંચ સુધી ચર્ચા ચાલેલ. પરિણામે તેઓ-શ્રીની માન્યતા જોટી હોવા રૂપે જાહેર થવાનો ટાઈમ આવ્યો જોઈને તેઓશ્રી તે જ દિવસે સાંજે છ વાગે સસમુહાય વડાચૌટાના ઉપાશ્રયે વિહાર કરી ગયેલ. બાદ ચોથે દિવસે પ્રાય: તાં વાગે વડાચૌટાથી તેઓશ્રીએ, પૂરો આગમોદ્ધારકશ્રીને, અમીચંદ જોવિંદાનુ, નેમચંદ નાથા અને મગન રણછોડ' મળી સુરતના ત્રણુ આગેવાનો સાથે ખાસ કહેવરાવેલ કે- “આપની જે જે પ્રદૃપણુંએ છે તે અમોને માન્ય છે અને આવતી કાલે જ વ્યાખ્યાન પાટેથી હું પોતે જાહેર કરું એવી ભારી ભાવના છે; પરંતુ આપની છચ્છા

હોય તો જીંખુંવં વ્યાખ્યાનમાં તે પ્રમાણે જાહેર કરે. ”
આ સાંલળી પ્રસન્ન થયેલ પૂર્ણ આગમોદ્ધારકશ્રીએ તેઓને તરત જ
જણ્ણાવી દીધેલ કે—‘તેમ હોય જ નહિ ! તેઓની લાજ તે મારી
છે ! આટલું કખૂલ કર્યું તે જ બસ છે.’ (જુઓ—આજથી ૩૦
વર્ષ પૂર્વે છપાએલ ‘ દિશા ફેરવો ’ નામની ખૂકનાં પૃ. ૬-૭)
એ પછી તેઓશ્રી વડાચૌટાથી ચૂપ-ચાપ વિહાર કરી ગયેલ;
છતાં ફૂર ગયા બાદ વળી પાછા ગ્રાયઃ સર્વત્ર ‘ અમારી માન્યતા
સાચી છે ’ એમ બોલવા અને પ્રચારવા લાગેલ ! આથી ‘ તેઓ-
શ્રીની આ કઈ જાતની પ્રમાણિકતા ! ’ એમ આશ્ર્ય થયેલ.

ઝોટા અર્થકાર ડરવા છતાં ઝોટા અર્થે છોડચા નહિ !

તે પ્રચારની અસત્યતાને સમજુજ્જનોના ઘણાલ પર લાવવા
સારુ પૂર્ણ આગમોદ્ધારકશ્રીએ સં ૦ ૧૯૮૮ માં સુંખ્રિ લાલ-
બાગથી ‘ દીક્ષાની જગ્યા વય ’ સંજક ખૂક પ્રસિદ્ધ કરેલ.
તે વાંચી નિજની સ્ખલનાએ સુધારી શાંત થઈ જવાને ખફલે
તેઓશ્રીએ, ચોતાની માન્યતાને અસત્ય લેખાવનારા શાસ્કીય
પાડોવાળી તે ખૂકમાંનાં લખાણુને ચેનકેનાપિ અસત્ય લેખાવવા
ચોતાના પ્રશિષ્ય પં. શ્રી રામવિજયલુને છુટો દોર આપેલ.
ભાવિ પરિણામ વિચાર્ય વિના તેમણે પણ ચોતાના ‘વીરશાસન’
તથા ‘જૈન પ્રવચન’ છાપામાં એ અંગે ફાવે તેમ ફેંકાફેંક કરા-
વવા માંડેલ ! પરિણામે બંને સમુદ્દરાયની ઐક્યતા, અનૈક્યતાનાં
સ્વરૂપે પ્રસાર પામી ! જે કલ્યાણકાનીજનોને ભારે હુઃખદ
નીવડેલ; પરંતુ તે હુઃખ, કલેશાપશમનનો ઉપાય નહોતો.

આ વસ્તુ વિચારીને તે કલેશાપશમનના નક્કર ઉપાયરૂપે

પૂરો આગમોદ્ધારકશ્રીએ, નિજના સૈદ્ધાંતિક ‘સિદ્ધચક્ર’ પત્રમાં તેઓના અસદુ પ્રચારને અસદૃદ્ધે જણાવનારી શાખસિદ્ધ અને તે પણ સંક્ષેપમાં જ સત્ય દર્શાવનારી સમાલોચના શરૂ કરી દેવાનું રાખેલ ! પરિણામે તેઓશ્રીને પોતાના પૂરોક્ત મંત્રોમાં મીયાલાઈની ટાંગના દિશાંતે પોતાના પત્રોમાં ઉટપટાંગ કરીને લોચા વાળવાની કાંદિશિક સ્થિતિમાં પણ મૂકાઈ જવું પડેલ ! તેઓશ્રીને એ લોચા, પોતે કરેલી અને પ્રચારેલી—“ દીક્ષાની પરીક્ષા—ઉંટડીનું ફૂધ અભક્ષ્ય—પ્રલુની કરણી અને કથની લિઙ્ગ—આણું એ જ ધર્મ—વચનવિશ્વાસે પુરુષવિશ્વાસ નહિ—ઉપવાસા-દિનાં પચ્ચાઝુણું નવકારશી પાણુહારથી કરાય—નયસાર આમ-ચિત્તકને બદલે રાની હુતો—ગુરુતત્ત્વ વિનિશ્ચયના ‘અત એવાષ્મ-ચારિત્રે સિદ્ધેરાવશ્યકત્વાત્’ પાડના કરેલા ઐટા અર્થને યેન-કેનાપિ સાચો લેખાવતા રહેવાની પર્વતિ તેમ જ (દ્રોયલોકપ્રકાશ સર્જ ઉના શ્રોંક ઉપદ્ધની સાક્ષીમાં અપાએલ શ્રી સંઅહણી તેમજ પ્રવચનસારોદ્ધારવૃત્તિના પાડોના આધારે તે લોક પ્રકાશકારે ‘અત્ર ચ પૂર્વકોટ્યા નવવર્ષોનત્વં, કિચિનન્યુનનવવર્ષોનત્વં, કિચિ-ત્સમધિકાષ્ટવર્ષોનત્વં ઇતિ ત્રયં મિથો યથા ન વિરુધ્યતે તથા બહુશુતેભ્યો ભાવનીયમ’ એમ લખવા પૂર્વક જણાવેલા) દીક્ષાના ‘ગલ્બાઈમ—જાન્માટ’ એ ત્રણ પ્રકારને એ પ્રકાર તરીકે લેખાવવાની, વગેરે ” શાખવિરુદ્ધ પ્રરૂપણા બદલ વાળવા પડેલા છતાં ઐટા અર્થો છોડયા નહિ !

શિષ્યોએ તો ઐટા અર્થો પોતાના ગુરુના નામેય
ચઢાવી દીધા !

‘ગલ્બાઈમ’ એટલે ગલ્બાથી આઠમું વર્ષ=ગલ્બાના સવા નવ

માસ, જન્મ પછી દ વર્ષ પોણા ત્રણ માસ થયે સાત વર્ષ પૂરાં થાય અને તે ઉપર એક દિવસ થયે સતે આડમું વર્ષ ગણાય છે. દીક્ષાના આ ભત સુજખ એ હજર વર્ષ પૂર્વે થએલા ‘શ્રી નિર્વાણુકલિકા’ નામના પ્રૌઢ ત્રથરતના કર્તા ધુરધર આચાર્ય ભગવંત શ્રી પાદલિસસૂરીશ્વરજી થઠની દીક્ષા થએલ હેવાનું દાધાંત પણ મોળુદ છે. સં ૦ ૧૬૬૨માં છપાએલ ‘દિશા ફેરવો’ ભા ૧ ના પૃ ૦ ૫ ઉપરના લખાણ સુજખ સં ૦ ૧૬૬૦ માં (રાજનગર સુનિ સંમેલન પહેલાં) છાણી સુકામે પં ૦ રામવિ ૦ મ૦ સહિત પૂરી દાનસૂરિજીએ, ‘ગલાંદિભ’ના તે અર્થને ગલાંથી આડ પૂરા કહેવા વડે જન્માણ જન્મથી આડમા)ના અર્થમાં જેડી દેવાની કરેલી ભૂતને પૂરી આગમોદ્ધારક આ ૦ મ૦શ્રી પાસે પુનરપિ કખૂલ કરવી પડી હતી: આમ છતાં તેઓશ્રીએ તે ‘ગલાંદિભ’નો પહેલાં કરેલો ઐટો અર્થ ૧ ગાયે રાખેલ ! તેઓશ્રીના પદ્ધધર શ્રી પ્રેમસૂરિજી-તેમના (ઝરીથી માનેલા) પદ્ધધર શ્રી રામચંદ્રસૂરિજી અને (પોતાના ગુરુ પ્રેમસૂરિજીના હાથે ‘મહાપંથનો યાત્રી’ નામની ઘૂકમાં અપાએલ છ પાંખડીના વિચિત્ર કમલવાળા ફોટામાં એક નંબર ઉતરી જવા પાએલ) શ્રી જંખૂવિ ૦ની ત્રિપુરીએ તો ‘ગલાંદિભ’ના તે ઐટો અર્થને પૂરી આ ૦ શ્રી દાનસૂરિજી વિરચિત ‘વિવિધ પ્રક્ષોત્તર’ લાગ થીજને અંતે ગાળાગાળીથી પણ સાચો કૈખાવવા [પોતાના એ કહેવાતા પરમપુરુષ (દાનસૂરિજી)ને નામે ખપાવવા સાર્ન] ૧૭૬મો કુટ પ્રક્ષોત્તર ઉપજની કાઢીને પોતાના તે કૈખાવતા પરમગુરુને નામે ખપાવવાનું શ્રી સંધની

વંચના કરવાનાં કઠોર પાપ પણ કરેલ છે. (કે-જે પાપ; તે પ્રશ્નોત્તરમાં શ્રી દાનસૂરિલુની હ્યાતિ પણીની 'તિથિની ક્ષય-વૃદ્ધિમાં પૂર્વ' પૂર્વતર તિથિની ક્ષયવૃદ્ધિની દાખલ થઈ જવા પામેલી વાતથી સિદ્ધ છે.)

એકલા 'જન્માષ' વાળા શાસ્ત્રદોહી ગણાય છે.

ઉપરોક્ત સ્પષ્ટીકરણું માં દીક્ષાની જગન્ય વય અંગે 'ગર્ભ-ઇમ-જન્માષમ અને જન્માષ' એમ ત્રણું પક્ષો હોવાનું મન-સ્વીપણું નહિ; પરંતુ 'બૃહત્સંબહણી-દોકપ્રકાશ' વગેરે શાસ્ત્રોના આધારે જણાવેલ છે. એટલે કે-'ગર્ભથી આડમે વર્ષે=જન્મથી ૬ વર્ષ' રા॥ મહિના અને એક દિવસે, જન્મથી સાત વર્ષ અને એક દિવસે તથા જન્મથી આડ વર્ષ 'પૂરા થયે' એમ જગન્ય વચ્ચની દીક્ષા અંગે ત્રણું પક્ષો મનસ્વી નથી; પરંતુ શાસ્ત્રોક્ત છે, એમ ઉપર સ્પષ્ટ સાધાર જણાયું છે.

દીક્ષાની જગન્ય વય અંગેના તે શાસ્ત્રોક્ત ત્રણું પક્ષો (વચ્ચનો) માંનું 'જન્માષ' એ એક જ વચ્ચન પકડીને પ્રથમના 'ગર્ભ-ઇમ અને જન્માષમ' એ બંને વચ્ચનોને મિશ્ર કરવાનું લૌકિક-નીતિને અનુસરનારા આ નવા નિજમતિએા, પૂર્વધર નિશીથ-ચૂણ્ણિકારની પણ પૂર્વના આચાર્યોના "આદેસેણ વા ગબમહુ-મહ્સ દિક્ષા=ગર્ભથી આડમા વર્ષે એટલે કે-જન્મથી ૬ વર્ષ રા॥ માસ અને એક દિવસે દીક્ષા," એ તથા બીજ પણ તે વચ્ચને પુષ્ટ આપનારા અનેક શાસ્ત્રપાઠો ઉપર સં ૦ ૧૬૮૮થી અધ્યાપિપથેંતના ઉપ વર્ષ સુધી પગ મૂકીને (જન્માષ પક્ષની સાથે શાસ્ત્રીય તે આદ્ય એ પક્ષાનેથ અનુસરનારા) પૂરો આગમો-

જ્ઞારક આઠ મં શ્રી પ્રતિ ઉપર પ્રમાણે નિંધજનોચિત ગલીય અને ગલીયતર પણ હુમલા, પોતાની ‘જન્મથી ઈ વર્ષ’ પૂરા થયે જ દીક્ષા થઈ શકે’ એ એકપક્ષીય માન્યતાને પ્રલુશ્રી જિનેશ્વર ભગવંતની માન્યતા તરીકે ઠસાવવા સાર્થક કરી રહ્યા છે તે તેઓના સરાસર ભવાલિનંદીપણું જ સૂચક છે.

ગલોષીમપક્ષે એવા પણ શાખીય નિયમો છે કે—‘(૧)—જધન્ય વયનો દીક્ષિત દીક્ષા બાદ એક વર્ષે કેવલજ્ઞાન અને મોક્ષ પણ પામે (૨)—અતુતર વિમાનનું જધન્ય અંતર કંઈક અધિક આડ વર્ષનું હોય અને (૩)—મોક્ષગમનનું જધન્ય આયુષ્ય પણ કંઈક અધિક આડ વર્ષનું હોય.’

એ બ્રહ્મેય શાખીય નિયમોમાંના અંતિમ એ નિયમો, ગલોષીમ (જન્મથી ૬૧ વર્ષાંથી) પક્ષને તથા જન્માષ્ટમ (જન્મથી સાત વર્ષ અને એક દિવસવાળા) પક્ષને ‘શ્રી બૃહત્સંગ્રહણીની ટીકા-માંનો, ‘કિંचિત્તસમધિક વર્ષાષ્ટકા દૂર્ધ્વમુત્પાદિત કેવલજ્ઞાનસ્થ=કાંઈક અધિક આડ વર્ષે ઉપાજિત કેવલજ્ઞાનની’ એ જે સાર્થ પાડ છે તે પાડ નિતરાં સંગત છે. જ્યારે જન્મથી આડ વર્ષ પૂરા થયા બાદ એક દિવસે દીક્ષાવાળા જન્માષ્ટ પક્ષને બીતફુલ સંગત નથી. કારણું કે—તે પક્ષને હિસાએ તો દીક્ષાના એક વર્ષ પર્યાય આડ દર્શાવે વર્ષે એનુલે કે—નવ વર્ષને એક દિવસે કેવલજ્ઞાન થવા જાય છે.

દરેક વાતમાં શાખને આધારે જ ચાલવાની બુમો મારનારા એ નિજમતિઓ, ગલોષીમ અને જન્માષ્ટમની પણ દીક્ષા, એ પ્રકારના શાખીય ત્રણ નિયમો અને શાખપાઠીઓ સિદ્ધ

હોવાનું જાણુતા હોવા છતાં જગન્ય વચ્ચની દીક્ષા અંગેના તે ‘ગર્ભાષ્ટમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ’ એ શાસ્ત્રોકૃત ત્રણું પક્ષો-માંના આદિમ એ પક્ષોને તો મિશ્ર કરી દ્ધને વસ્તુતઃ એક ‘જન્માષ્ટ’ પક્ષને જ માનવાના હુરાશ્રદ્ધવશાતું ઉડાવી જ હેછે ! એ જેતાં તેચોની એ ‘શાસ્ત્રોના આધારે જ ચાલવાની ખૂબને વિદ્ધાનોએ શ્રી સંઘની છેતરપીઠી રૂપે જ ગણુવી રહેછે. કારણું કે—‘શાસ્ત્રોના એક ક્રાવતા વચ્ચને માને અને એ જ શાસ્ત્રોના (મનસ્વીપણે જ ‘ગર્ભાષ્ટી અને જન્માષ્ટી આડ’ અર્થું કરીને) એ વચ્ચનોને ન માને તે તો ખુલ્લોં શાસ્ત્રદ્રોહ ગણ્યાય હે.’

સં ૦ ૧૯૯૫માં પૂરો પં ૦ (હાલ આઠ) શ્રી ધર્મવિજયજી ગણિના વિક્ષાન શિષ્ય મુનિશ્રી યશોવિજયજીએ પ્રસિદ્ધ કરેલ ‘સાનુવાદ બૃહત્સંગ્રહણી’ અંથના પૂરો પૈઠ૦ ઉપરની ગાથા ૩૧૧ના વિવરણની સ્કૂટનોટમાં પણ—“લોકપ્રકાશકારે ભતાવેલા ‘ગર્ભાષ્ટમ-જન્માષ્ટમ અને જન્માષ્ટ એ’ ત્રણું લિખ લિખ કર્થનો મુજબ ગર્ભાષ્ટમ (જન્મથી દા વર્ષ) ની દીક્ષા સિદ્ધ થશે, તેથી (દીક્ષા બાદ વર્ષે કાલધર્મ પામનારને) અનુત્તરનું જગન્ય અંતર અને મોક્ષગમન માટેનું જગન્ય આચુષ્ય પણું ઢીક રીતે મળી આવશે.” એ મુજબ સ્પષ્ટાર્થું જણુવેલ હોવા છતાં અને શાસનપક્ષના—“તમે પક્ષ-ઉલ એકલા ‘જન્માષ્ટ’ મતથી અનુત્તરના શાસ્ત્રોકૃત જગન્ય અંતર તેમજ મોક્ષગમન અંગેના જગન્ય આચુષ્યનો તો મેળ જ આતો નથી, તેનું કેમ ?” એ મૌલિક અને સૈદ્ધાતિક પ્રશ્નનું સમાધાન તો આજે ઉપ વર્ષ થયા છતાં તે નિજમતિઓએ મારેલા ‘શ્રી સંધ કૌશલયાધાર’ના લેખાદ્ધિના માનસરોવરમાં ઝાલતા

अने कडेवाता सिद्धांतमहोऽधि य आपी शकेल ज नहि होवा
छतां आ नृतनो ते अदल लाज्वाने अद्वेश्रीसंघमां पोताने ज
शास्त्रानुसारी अने सुविहित ओणभावता रहीने शासन पक्षना
पूज्य मुनिगण्यने पोतानी ‘प्रत्यज्यायोगादि विधि संग्रह’
नी लबाड प्रस्तावनादिमां गालुने तुच्छ ओणभाववानी अयो-
ग्यता दाखवी शके छे ! ते पंचम कालनो प्रभाव ज मानवो रहे छे.

औक्यता अपती नहि होवानुं थथेलुं हुःअ

आथी विद्वानोमां तेच्चेश्री निजमतिने ज जिनमतिमां
अपावनार तरीके पण्य पंकाचेल. ‘सिद्ध्यकु’नी ए टयुकडी ज
वेखावाती समालोचना पण्य ते असत्य प्रचारनुं ए इल खतावी
आपवा समर्थ हुती, अम ए पछी तो ते वर्गने लान पण्य
आवेल; परंतु पछी शुं उपाय ? एटहुं अङ्ग के-ए पछीथी
तेच्चेश्रीए ‘क्लैनप्रवयन’ गत ‘जिज्ञासा अने तृभिं’ना
लभाण्यमां पू० आगमेऽक्षारकश्री सामे कटुवाणी व्यवहार पर
काखु भूक्षेल.

तेवामां वणी कमलांगे सं० १६८६ना पण्य॑पण्यनुं क१५-
वांयन, अहणुनी असञ्जाय ‘टाणी शकाय तो टाणवी’ ए
शास्त्र वयनने निजमतिमां योलुने ते अहणुनी असञ्जायमां
पण्य वांयन करी पुनः निजमतिने जिनमति वेखाववा मांडेल !

सं० १६६०ना राजनगर मुनि संभेलनमां पण्य तेच्चेश्रीए,
पं० श्री रामविं० भ० द्वारा किञ्चाप्योरोदर्शक वाणीना पत्थरा
नांखवा मांडेल ! परिखामे पू० आ० श्री नंदनसूरिजु भहाराने,
‘ए रामविजय ! तभारा सिवाय संभेलननुं काम

પડયું નહિ રહેઃ સંમેલનનું કામ સંમેલન કરશો જ' એમ પડકાર પૂર્વક ડારેલ, ત્યારે જ સંમેલનનાં કાર્યને યદ્રાતદ્રા રીત્યા ડેણવાની વલણુને ઠંડી પાડેલ ! તે વખતે શ્રી હેતમુનિજી સામે બોલવામાં તો 'અમારે અને શ્રી વલ્લભસૂરિજીને કાંઈજ વાંધી નથી' એમ (તેઓ સાથે ઘણુંએ અંગારા જરતા વૈમનસ્યો તો જગળહેર પણ હોવા છતાં) સાડા ચારસો મુનિગણુ વચ્ચે એધડક જુહું બોલેલ ! (જૂચો સં૦ ૧૯૬૨ની 'દિશા ફેરવો' ખૂક ભાગ પહેલો પૃષ્ઠ ૧૮) એ વગેરે કડવા પ્રસંગોના અનુભવ ખાદ શ્રી સંઘમાં તેઓશ્રી, શ્રી સમસ્ત શ્રમણ સંઘની ઇથરૂં તે વિખ્યાત સંમેલનને ય તોડી પાડવાની વૃત્તિવાળા તેમજ અસ્ત્યવાદી પણ લેખાઈ જવા પામેલ !

તે સંમેલન સર્વાનુમતે સઝલ નીવડયા પછી પણ તે સંમેલનના ઠરાવોને નિર્ભાલ લેખાવવા સારુ અમદાવાહ-વિધાશાળામાં શ્રી સિદ્ધિસૂર-લખિધસૂર-ક્ષમાલદ્ર(સૂર)-લદ્રસૂર-કનકસૂર તેમજ પંઠ શ્રી લક્ષ્મિવિંઠ મં આદિ સહિત સવાસો જેટલા પોતાના પ્રશંસક સાધુઓનું ત્રણ દ્વિવસ સંમેલન યોળુને પોતે ઘડાવેલા પ્રાયઃ ૨૨ જેટલા ઔત્સર્ગિક ઠરાવોને સર્વાનુમતે ખાસ કરાવી લેવા સારુ તેઓશ્રીએ ત્રણ દ્વિવસ બચો઱ે રાખી પુસ્તકી સતત પ્રયાસો કરેલા. (કે-જે) પ્રયાસોને તે એકદમાં પણ ત્રણેય દ્વિવસ હાજર રહેલા આ લેખકે તેઓશ્રીને કરેલા એક જ પ્રશ્નમાં તેઓશ્રીએ સર્વાંગ અને સદાને માટે સમેટી લેવા પડેલ !) તેઓશ્રીની તેવી કારમી વલણ જેતાં તેઓશ્રીને

શ્રી સંધની ઐક્યતા ખપતી જ નહિ હેવાનું લાગ્યું અને તે ભારે હુઃખદ હતું.

તેમના જેવા ચારિબ્યવંતને એ જરાય શોભનીય નહોતું.

સં૦ ૧૯૮૧ની ચૈત્રી શાક્ષતી એણીની અસનજાયમાં શ્રી રાધનપુર મુકામે તેઓશ્રીએ શુદ્ધ ચૌદ્દશો પોતાના શિષ્ય પ્રશિષ્યને આચાર્ય-ઉપાધ્યાયપદવી આપવા અંગેનાં કાલઅહેણ લેવાનું શાસ્ત્ર અને પરંપરા વિરુદ્ધ પગલું ભરેલ, તેનો એદ દર્શાવવાને બદલે પોતાના શિષ્ય-પ્રશિષ્યો દ્વારા ‘જૈન પ્રવચન’ છાપામાં શાસનપક્ષ સામે આગમના રહસ્યના જાણુ તો તેઓ પોતે જ હેવા રૂપે ‘અહુ’ની કડક પણ ડાંગ ઉછાળીને તે નિજ મતિને જિનમતિ લેખાવેલ ! તેઓશ્રીના આ હરેક વલણમાં તેઓશ્રીનો આશય મુખ્યત્વે એ જાણુએલ કે—‘વર્ત્માનકાલે સહુ કરતાં હું જ સચ્ચારિત્રપાત્ર અને સમસ્ત શાસ્ત્રોનાં રહસ્યોનો જાણુ હતો, એમ ભાવિ જૈન આલમ જાણો.’ જે મહત્વાકાંક્ષીપણું તેવા ચારિત્રવંત મહાત્મા માટે જરાય શોભનીય લાગતું નહોતું.

એ ગ્રકારે ગ્રલુશાસનમાં નિજનું શાસન ચલાવવાનાં

તાત્કાલિક પણુ કંકુ ફળો !

૧-રાધનપુર આચાર્ય બન્યા કે તરત શ્રી પ્રેમસૂરિજીએ શુરુથી જુદ્દા પડી તે સં૦ ૧૯૮૧નું ચાતુર્માસ પાઠણ મુકામે સ્વતંત્ર કરેલ !

૨-પોતે જેઓને પોતાના સમુદ્દ્રાયના અભગણ્ય લેખાવતા

હતા, તે બંને—આ૦ શ્રી પ્રેમસૂરિલુ મ૦ તથા ઉપા૦ શ્રી રામવિ૦
મ૦, ૧૯૬૨ના પોષ માસે પોતાને (નિકટ મૃત્યુદર્શનીક વૃદ્ધા-
વસ્થાને નજરે જોવા છતાં પણ) જે—તે ૬-૭ સાધુ સાથે ઝીજુવાડા.
મુકામે મૂકીને ઉધાપન મહેત્સવને જ્હાને ખંલાત લણી વિહાર
કરી જવા રૂપે તેઓશ્રીથી સસમુદ્દાય જુદા પડી ગયેલ ! [પાટડી
ગામે ધ્વનિદંડની પ્રતિષ્ઠા અંગેના અને ખંલાત મુકામે ઉધા-
પન અંગેના મહેત્સવની એક સાથે વિનંતિ હતી અને ગત
ચાતુર્માસ, ઉપા૦શ્રી રામવિ૦એ રાધનપુર મુકામે તેઓશ્રીની
સાથે તેમજ આ૦ શ્રી પ્રેમસૂરિલુએ પાટણ જુહુ કરેલ હોઢને
ખંલાત મુકામે ઓચ્છવ નિમિતે આ૦ શ્રી પ્રેમસૂરિલુમ૦, અને
પાટડી મુકામે ઓચ્છવ નિમિતે વૃદ્ધ અને ગ્લાન એવા પૂ૦ આ૦
શ્રી દાનસૂરિલુમ૦ શ્રીની સાથે ઉ૦ શ્રી રામવિ૦મ૦ ૪૪ શકે
તેમ હતું : છતાં તેઓ બંને મુખ્યો, પૂ૦ આ૦શ્રીને તેવી વૃદ્ધ
અને ગ્લાનાવસ્થામાં પણ એ પ્રકારે જે—તે અને જૂજ સાધુ સાથે
ઝીજુવાડે છોડીને વિશાલ સમુદ્દાય સહ ખંલાત લણી ઉપડી
ગયેલ !] કે—જે વિયોગ તેઓને સદાનો નીવડેલ ! (આ નવી-
નોચે ચેપરો અને જીવનચરિત્રામાં દર્શાવાતા પોતાના તે પરમ-
ગુરુ પ્રતિની તેઓચે કૈખાવાતી પોતાની પરમગુરુલભક્તિનું
ઉધાડું સ્વરૂપ આ છે.)

૩—એ વૃદ્ધ અને ગ્લાનાવસ્થામાં પણ પાટડી પ્રતિષ્ઠા અંગેની
એ પ્રકારે માથે આવી પડેલી ફરજ બનવવા સાડે પૂ૦ આ૦
શ્રી દાનસૂરિલુમ૦ને ઝીજુવાડાથી તેર માઈલ દૂર પાટડી તરફ
વિહાર કરવામાં એ માઈલ તો કણે પસાર થયેલ. અત્યંત નથ-
ળાઈને લીધે માર્ગમાં નિરાધારપણે પડી જવાનું તથા ૦૧ કલાક-

ઐલાનપણે પડયા રહેવાનું પણ બનેલ ! આ સ્થિતિમાં સાથે સુજાણુ વૈયાવચ્ચકાર હોત તો કાંધકેય રાહત મળત ! મૂર્છિઓ ઉત્તર્યા ખાદ પણ એ વૃદ્ધ અને ગ્રાન મહાત્માની સાથે ધૂઢાનું કૂલવર્તી કોણુ ? આ સ્થિતિમાં અનેક શારીરિક કષ્ટો અને આંતરિક સંતાપોના ભાજન અનીને એ વૃદ્ધ મહાત્મા, ચાર દિવસે (નહિ ગુજરાતનું કે નહિં આલાવાડનું એવા નાનાશા) ‘પાટડી’ ગામે ચોખ વહિ ખારસે પડતા—આથડતા મુશ્ટીબતે પહેંચેલ ! ભાગ્યથોડો આમપ્રવેશની તિથિ પણ અંધારી ખારશ ! કે—જે ખાર જ વગાડે ! ખરેખર કર્મની ગતિ ગહુન છે!!!

તે તે પ્રકારે ચોમેરથી પરિતાપિત એવા તે વૃદ્ધ મહાત્માની તથિઅત મહાશુદ્ધ રની સાંજે એકદમ ખગડેલ, હતા તે શ્વાસે જોર પકડેલ અને એ સાથે જ લક્વાના પેદા થયેલા વ્યાધિએ તો ઘોડા વેગે જોર પકડવા માડેલ ! પરિણામે સાંજના પ્રતિકુમણુગત ‘લુસે બિસે સાંડુ’ સ્તુતિનો તો અતિ કષ્ટોય એક અક્ષર પણ નહિ હોલી શકેલ ! (તેવી અવાચક સ્થિતિ પછી પણ તેઓશ્રીના લુવનચરિત્રોમાં જે તેઓશ્રીએ—‘મારી....જિ....દ્યા....સખ....લ....નાૠ’ યાવત ‘હું....સર્વ....કોઈને....ખમાવું....છું’ એ વગેરે તૂટ્યા અને અસ્પષ્ટ શાખ્દોમાં ફરમાંયું હોવાની લખાએલી વાતોને તો ‘તેઓ અંતિમ સમયે સમાધિમાં જ હતા’ એમ પ્રચારવા સાર્દ લખવાના વ્યવહારદ્વારા જ ગણુવી રહે.) પછી તો લગભગ પરાધીનાવસ્થામાં સ્ટાઠ ટાઈમ હો પછી સુજાણુ નિર્યા-મકેની ગેરહાજરીમાં અને થામ્યજનોની હાજરીમાં તેઓશ્રીનો મૂંઝાતો આત્મા, પોતાની પડછંદ કાયાનો એકાએક ત્યાગ કરીને દેવદોક સીધાવેલ ! તેઓશ્રીનું તેવા નિર્ણય સંથોડો અને

સ્થાનમાંયે તે પ્રકારનું મૃત્યુ ‘નહિ ગુજરાતમાં—નહિ આલાવાડમાં અને નહિ સમીપે જ રહેલ જનમભૂમિ ઝીજુચાડામાં પણ’ થએલ જોઈને શાખાજનોએ તેને તથાપ્રકારના કોઈ કર્મસંકેતઢ્યે માનેલ અને અણુસમજુજનોએ ‘પાધડીનો વળ છેડે’ના દ્યાંત સાથે ચોનેલાં:

[એ મહાત્માના વેલાએ તાજેતરમાં મુનિ નિત્યાનંદ વિઠોના નામે એક નિર્માણ બૂક પ્રકટ કરેલ છે ! તે બૂકને તેણે નામ તો ‘શ્રી શાખેશ્વર પાર્શ્વનાથ’ અને ‘વિવેકદર્શાન’ એવું પવિત્ર આપેલ છે; પરંતુ તે બૂકની અંદર છૂપાવેલી-ગલીયતર લખાણવાળી-પૃષ્ઠ ૧૨ થી ૬૪નાં એક ‘પ્રસ્તાવના તિમિર તરણિય’ની બૂકનું કામ ઘણું અપવિત્ર કરેલ છે. આથી જ તેવાં ગંદા લખાણને છાપી આપવાની પાલીતાણા બહાદુરસિંહજી પ્રીન્ટિંગ પ્રેસવાળાએ તે કડવા વેલાના ડોડીબડાને સ્પષ્ટ ના જણાવી દીધેલાં: તેમ છતાંય તે ગંદા લખાણને તે વિષવેલાએ ‘સર્વોદય મુદ્રણાલય-સાહિત્ય’માં બૂકડ્યે છપાવીને પૂર્વોક્તા પવિત્ર નામની બૂકમાં પાલીતાણા પ્રેસ માલિકના ખ્યાલમાં ન આવે તે રીતે છૂપાવવી પડેલ છે ! આશય એ છે કે—‘અમૃતના કુંપાના નામે તે ગંદીના ગાડવાનેય અમૃતના તુંબડામાં ખપાવવો.’ (ચોતાને ચોતે સુવિહિત લેખાવનારા એ આપણા સુવિહિત (૧) લાઇઓની સુવિહિતતા આ છે.]

તેમણે તે બૂકમાંના ગલીય અને અર્દીલ લખાણને રૂપક આપેલ છે, મેં ગતવષે પ્રસિદ્ધ કરેલ ‘પ્રસ્તાવના તિમિર-ભાસુકર’ નામની (સાહિત્યપ્રેમી પૃષ્ઠ મુનિરાજ શ્રી પુષ્પવિજયજી

મ૦ આહિ અનેક વિદ્ધાનોના હાથે ટંકશાળીપણુંની છાપ પામેલી) પ્રમાણિક અને શાસ્ત્રાનુસારી ખૂકના ખંડનનું; પરંતુ તેમાં તે વેલોા, શ્રી નિત્યાનંદ વિઠોના હાથે મારી તે ખૂકમાંના કોઈ એક પણ નિરૂપણનું પ્રમાણિક ખંડન કરાવી શકેલ નથી, એ વગેરે હકીકત આગળ જતાં સ્પષ્ટ કરાશે. હાલ તો ઉપર સુધીના લખાણું દ્વારા વાંચેકો, તે વેલાની—“તે ગંદી ખૂકના પૂરો ૧૬૮૮ બીજ પેરાના—‘પૂરો શ્રી આત્મારામજી તે પૂરો આરો શ્રી વિજયાનંદ-સૂરિજીઓ’થી માંડીને પૂરો ૨૪ના ચોથા પેરામાંની—‘તેમણે પોતાની ભૈણે જ તુછો ઉઠાવીને જેમ તેમ લખી નાંખ્યું છે.’ ત્યાં સુધીની ‘પદૃધર’ અંગેની વાતોને તથા પૂરો ૨૭ના ઘેલા પેરામાંની ‘પોતાના દીક્ષાગુરુ પૂરો આરો શ્રી વિજયદાનસૂરિધરજી’ થી માંડીને પેરા બીજાની ‘શ્રીમાન્ સાગરાનંદસૂરિજીના કાન લાલેરી વિરુદ્ધ ઉશ્કેરવામાં વાજ્યો ! જુઓ તેમની આ ખાનદાની ?’ ત્યાં સુધીની મારી દીક્ષા અંગેની વાતોને તેમજ પૂરો ૪૮ના બીજ પેરાની સંભોલ સુરત વડાચૌટાના ઉપાશ્રયેથી માંડીને પૂરો ૪૮ના ઘેલા પેરાની ‘એવી કોઈ બીજા બની જ નથી’ એ અંતિમ પંક્તિ પર્યાતની (સંભોલ ૧૬૮૮માં સુરતમાં ખનેલ ભૂલ સ્વીકારના હકીકતદર્શ પ્રસંગનો અપત્તાપ કરનારી) વાતોને જ સાવમૂળ જુડી તરીકે સમજ લેવામાં સંતોષ માને.”

૪-એ જ સંભોલ ૧૬૮૮ના વૈઠ શુરૂ દિનાના દિને મુંબદી ખાતે ઉપારો શ્રી રામવિઠોમંદોને આચાર્યપદ પ્રદાન કરવાના પ્રસંગે જ તેમના તેર સાધુઓએ તે પદપ્રદાન સામે સખત વિરોધ ઉઠાવેલ અને તે વિરોધને ઉપશમાવવા સારુ તેઓશ્રીને (લાલભાગ મેડી પરની લાકડાના રૂમમાં ઠવણીથી) પ્રથમ ઝરી દીક્ષા અપાયા.

પછી જ નીચે મંડપમાં શ્રી ગ્રેમસૂરિએ આચાર્યપદ આપી શકેલ !

૫-તે વખતે આચાર્ય અનવા ઉજમાળ થયેલ શ્રી જંધૂ વિ૦ ને તો વડિલોની વિવિધ કરામતોના લોગ અની આચાર્યપહને ખદ્દે ઉપાધ્યાય પહમાં જ સંતોષ માનવાની સ્થિતિના ભાજન અનવું પડેલ !

૬-એ જ વર્ષના શ્રાવણ માસે તે આચાર્ય અનેલા શ્રી રામ-ચંદ્રસૂરિજીના હાથે શ્રીસંઘની શાસનમાન્ય બારપર્વીની (સાથે સાથે સૂતક અને અહુણુની અસજાયની પણ) અવિચિન્હની આચ-રણાને લોપવાનું=શાસનની અવિચિન્હની આચરણાને ઉત્થાપવાનું દ્વાર પાપોપાજ્ઞન થવા પામેલ !

૭-આથી સં૦ ૧૯૬૬ઉમાં તો શ્રીસંઘમાં દેશોદેશ-ગામો-ગામ અને ધરે ધરમાં કલેશને દાવાનલ ભલ્ભૂકી ઉડતાં તેઓશ્રીને ગુજરાત જેવો ચિરપરિચિત દેશ છોડીને ત્રણ વર્ષ સુધી અપ-રિચિત એવા દક્ષિણ દેશમાં ખર્ચી જવું પડેલ અને ત્યાં પણ પૂનાસ્થિત ગુરુની એથે જીવન ધડકતે હૃદયે જીવવું પડેલ !

૮-એ અરસામાં પ્રથમ મુખ્ય ખાતે પોતે તૈયાર કરેલા પ્રાયઃ ૧૭ શિષ્યોને (પૂના ખાતે રક્ષણાર્થી રહેલા તેમના ગુરુ શ્રી ગ્રેમસૂરિજીએ પોતાના કરી લેવાથી) પોતે ગુમાવવા પડેલ !

૯-સં૦ ૧૯૬૬૫ મહા શુદ્ધ સાતમે શ્રી ગ્રેમસૂરિજીએ, પોતાના હુક્કદાર શિષ્ય ઉ૦ શ્રી જંધૂવિ૦ની ઉપેક્ષા કરીને જરાય હુક્કદાર નહિ એવા (અન્ય ગુરુના શિષ્ય મુનિશ્રી અમી વિ૦મ૦ના શિષ્ય) ઉપા૦ શ્રી ક્ષમાલદ્રવિ૦મ૦ને આચાર્યપદ આપી ઢેવાનું અનેલ ! એટલું જ નહિ; પરંતુ પોતાના તે શિષ્ય ઉપા૦

જંખૂવિંને બદલે પોતાના પદ્માલંકાર પણ તે ક્ષમાલક્ષ્મિરિલુને
જ બનાવવાનું સૂઝેલ ! (પોતાના ગુરુની એ નીતિએ પોતાને
શ્રી કમલસૂરિલુની પાઠના ચાથે નંબરથી ખસેડીને પાંચમે નંબરે
ધકેલી દીઘેલ હોવાથી શ્રી જંખૂવિંને તે પ્રસંગે કેટલું હુઃખ
થયું હોય તે સમજુ લેવાનું અત્ર વાચકો પર છોડીએ છીએ.)
'આં શ્રી પ્રેમસૂરિલુની આ મુત્સદીગીરિએ, મુનિશ્રી અમીવિં
મંની તો છતા શિષ્યોએ પાઠ જ બંધ કરી દીધી !' એમ
પણ એ બનાવથી લેખાવા પામેલ !

૧૦-વળુદ્દાર માહિતી સુજખ-પોતાના તે ઘોર અપમાનથી
રાખે લરાએલ ઉંઠ શ્રી જંખૂવિંએ તો તેજ સં ૦ ૧૯૬૫ માં
પાલીતાણું લણ્ણી કરેલ વિહારમાં આવેલ અમરેલી મુકામે
શ્રાવક સંધના હાથે પણ આચાર્યપદવી લેવાની તૈયારી કરેલ-
તે સંખંધીની કંડોત્ત્રી પણ છપાઈ ગયેલ; પરંતુ પાછળથી
કેાઈ અકળકારણે તેમને તે સધળી જ તૈયારીને એકાએક સમેટી
લઈ પાલીતાણું લેળા થઈ જવું પડેલ !

૧૧-૧૯૬૬ ના વર્ષે તે ઉંઠ જંખૂવિંને તિથિચર્ચા ખાખ-
તમાં શાસનપક્ષના મજખૂત હાથે પાલીતાણુથી આદપર સુધીમાં
(પાલીતાણુથી અંધારી સવારે શીહેલ લણ્ણી નાસી છૂટવા
જોવો) કઠોર અને હુઃખ પરાજ્ય થવાને લીધે જૈનશાસનની
જે દિગંતોથાપી જ્વલંત જ્યુપતાકા ફરકેલ તેની તો તેમણે
પોતાના 'જૈનશાસનની જ્યુપતાકા' નામના લુચનચરિત્રના
ભાગ ધીનના પૃંઠ ૮૮-૮૯ માં નોંધજ નહિ લેવામાં પોતાને
પ્રતધારી માનવા-મનાવવા રહેલ.

૧૨-સં૦ ૧૯૬૭માં શ્રી રામચંદ્રસૂરિજીના લગભગ ૬૦ જેટલા શિષ્ય-પ્રશિષ્યો, તેમની આજા છોડી દઈને શ્રી પ્રેમ-સૂરિજીની આજામાં ચાલ્યા ગેલે !

૧૩-તે વર્ષથી તે વેલાને જલી પ્રચાર દ્વારા સૂતકને નહિ માનવાનો નિજમત સ્થાપવા સારુ શાસનમાન્ય જિનમતિ આચરણાને જેરશોરથી ઉથલાવવાનું અને અહણુની અસજાયમાં દેરાસરો તથા શ્રુત પણ એધડક અલડાવવાનું શાસનમાદિન્ય-કારી અપકૃત્ય જેરથી આદરલું સૂજેલ !

૧૪-તે વર્ષો આ૦ શ્રી રામચંદ્રસૂરિ, પોતાના નૂતન મતના પ્રચાર અથે દક્ષિણમાંથી ધડકટે હૃદયે મુંખઈ આવેલ; પરંતુ ત્યાં પણ શાસનપક્ષ સામે ચાતુર્માસિલર પોતાની માન્યતાને પોતાના રાગીજનોમાંય ઐલ્યા વિના ત્યાંથી ચાતુર્માસ ઉત્થે ગુપચૂપ પાલીતાણું ભણી વિહાર કરી જવાની સ્થિતિમાં મૂકાએલ !

૧૫-સં૦ ૧૯૬૮માં પાલીતાણે પણ શાસનપક્ષના ૧૭ સમુદ્ધાયે સંગઢન કરીને તેઓને ૫૦ આગમોદ્વારકશ્રી સાથે ચર્ચા કરવાની ઇરજ પાડતાં તેઓને ચર્ચામાં જોડાવું પડેલ ! અને તેમાંથી ‘તમારે પ્રશ્નો કરવાના નહિ’ એમ અયુક્ત બોલી ખસી જવા પ્રયત્ન કરેલ છતાં ક્રવેલ નહિ એટલે છેવટે સ્વમત ખાતર વૈઘને ઝોડીને કૈનાગમ-શાસ્કો વળેરેને શાસ્કાલાસ લેખાવવાનું કારમું કલંક વહેરલું પડેલ !

૧૬-પાલીતાણે આગમ મહિરનો ૧૬ દિવસનો લભ્યતર પ્રતિષ્ઠામહેત્સવ જોયા પછી તે મહેત્સવ કરતાં પણ સારો મહેત્સવ ઉજવી એ મહેત્સવને નથળો લેખાવવા સારુ પાલી-

તાણુથી રાજકોટ આવીને કરાવેલા મોટા એચ્છવમાં તો અચાનક ઉડેલી આગે અંજનશાલાકાવાળા પ્રતિમાળાએ સહિતને મંડપ-મેરુની રચના વગેરે બધું જ સળગાવી હેવાથી જૈનજગતમાં સર્વત્ર અપશુકનીયાળ કેખાવું પડેલ !

૧૭-સંં ૧૯૯૬ થી ૨૦૦૦ સુધીમાં તો શાસનપક્ષે તેમણે વૈધને ફોડેલ હોવાની સાબિતી આપનારી તેમની નામ-ઠામ વિનાની હુસ્તલિભિત ચિઠ્પીએ વગેરે ચેપરોમાં પૂનાના ગવર્નરી અક્ષર નિષ્ણુતના અલિપ્રાય સહિત પ્રસિદ્ધ પણ કરી હેવાથી તેમને અને તેમના કલિપત તિથિ મતને માનનારા તેમના સમસ્ત પક્ષકારોને શ્રી સંઘોમાં સર્વત્ર કાજળશા સુએ નીચું જોઈને જ ઇરવાની કાંદિશિક સ્થિતિમાં મૂકાઈ જવું પડેલ !

૧૮-તે અરસામાં અમદાવાદનાં શાનમંહિર અને પૌષ્ઠ્રશાલાના મકાનની હિવાલની અંદર કરાવેલ સુંદર ગોખલામાં પૂરુષ દુર્લભ મૂર્તિની પ્રતિષ્ઠા અંગેના ચોનેલા આડાં બરીય ચાલુ મહોત્સવમાં જ શુરુ-શિષ્ય વચ્ચે કંઈ ન વિસરાય તેવો કલેશ થવા પામેલ, તે મહોત્સવને પણ એ હિવસ ઠેલો સમેટાવી લેવો પડેલ અને છેવટે શુરુમહારાજશ્રીના હાથે તે નવાતિથિમતકર્ષકે સમુદ્ધાય બહાર પણ થઈ જવા પામી અમદાવાદ છોડવું પડેલ !

૧૯-સંં ૨૦૦૧માં ‘શેઠશ્રી કસ્તુરલાલાઈના મોલાને ધક્કો લગાડનારા કાવા-દાવા-છલ-પ્રપંચાહિથી વૈધને ફોડીને નિષ્ણુંય મેળવેલ છે’ એમ સાધાર સત્ય જણાવનારા શાસનપક્ષીય શ્રદ્ધાલુઓને મૂંઝવવા સારુ તેમણે લક્ષ્મીચંદ હીરળ દ્વારા સાત નામાં-

કિંત વ્યક્તિઓ ઉપર મુંબઈ હાઇકોર્ટમાં કરાવેલા વીસ-વીસ હજારના દાવાઓ અંગે સંં ૨૦૦૩માં મુંબઈ હાઇકોર્ટમાં આ લેખકે સાતેય કલ્યાણુકામી વ્યક્તિઓના સાક્ષી તરીકે છમાસ પર્યાંત ચાલેલી ૨૩ મુદ્દતવાળી છ-છ કલાક પર્યાંત આપેલ જુખાનીમાં પ્રાય: ૩૦૦ એકઝિથીટ=પૂરાવાઓ સાબિત કરી આપવા પૂર્વક આપેલી અસ્થિલિત, સચોટ અને સર્વાંગ લંડન જુખાનીને લીધે કેસને અંતે સાવમૂળ જુડી ઠરવાને પ્રસંગ આંદોલાની લારે પોતે ઉલા કરેલા તે વાદીના એરીસ્ટર દ્વારા-તેને ધણો ખર્ચ થઈ ગયો હોવાને બહાને-તેની ગરીબાઈ હેખાડવા વડે-રા. પાંચ હજાર અપાવરાવીને કેસની માંડવાળ કરાવવી પડેલ !

અને તે માંડવાળને અંતે નામદાર લગવતી જડઝ સાહેબે પ્રતિવાદીઓને ‘પર્વતિથિનિર્ણય’ નામના અંથની બીજી આવૃત્તિમાં તે અંથમાંના માત્ર લક્ષ્મીચંદ હીરલુના એ પત્રો છાપવા નહિઃ’ એટલી જ સૂચના કરેલ. અર્થાત्—“તે પુસ્તકની બીજી આવૃત્તિમાં પણ શ્રી રામચંદ્રસૂરિલુની-તેમણે વૈધને ફેંડેલ હોવાની સાબિતી આપનારી-નામડામ વિનાની ગોલમાલ સૂચક ચીહ્નાઓ અને તેમના અન્યાન્ય લક્ષ્મોના તાર-પત્રો વગેરે તો પ્રસિદ્ધ કરી શકો છો.” એ જ ફેંસલો આપેલ હોવાનું જણીને તો શ્રી રામચંદ્રસૂરિલુ અને તેમના ગુર્વાદિ સમસ્ત પક્ષકારોના હોશ-કોશ ઉડી જવા પામેલ !

૨૦-ખાદ સંં ૨૦૦૨ થી ૨૦૧૫ સુધીમાં તો તે નિજમતિને જિનમતિમાં ખપાવવાના રસિકવર્ગને તે અવળાઈના ઇલર્પે નાના-માટા કુદરતી અને આપસી ધણ્ણા ઇટકાઓ સહન કરવા

પડेल, તેમાં પણ સૌથી મહાન ઇટકો તો—‘ શ્રી અમદાવાદ હઠી-ભાઈની વાડીના દેરાસરળુમાં સ્વ૦ શ્રી સિદ્ધિસ્તુંના સ્વર્ગવાસ નિમિત્તે શ્રી ગ્રેમસ્ટુરિઝની નિશામાં ઉજવવાને ગોઠવાએલ ૧૦૮ છોડનું તથા સેંકડો પ્રાચીન કીંમતી પ્રતો—પુસ્તકો તેમજ સાધુ અંગેના હજરેની કિંમતના ઉપકરણો વગેરેનું આખું ચે લંઘતર ઉજમણું ઉજવાયા વિના જ અચાનક ચોમેરથી એકી સાથે ભબૂકી ઉઠેલી લયંકર આગથી જેતનેતામાં પ્રાય: અર્ધા જ કલાકમાં આમૂલ્યચૂલ સણગી જવા પામીને સાવ લસ્યભૂત બની જવા પામેલ !’ તે પડેલ ! અને તેથી તો તેઓ ગામો ગામના શ્રી સંઘમાં ખુઅ જ અપશુકનીયાળ લેખાએલ ! એ પ્રકારે નિજ-મતિને જિનમતિ લેખાવવાનાં તે વર્ગને આ લવે પણ તેવાં અનેક કંદુકણો લોગવવા પડેલ છે તો પરલવનાં ઇણોનું તો લેખું જ શું ?

તેવા તે વર્ગે તાજેતરમાં ‘વિવેકદર્શન’ દ્વારે ગ્રસિદ્ધ

કરેલા—‘પ્રસ્તાવના તિમિર તરણિ’ નું નિરસન.

(૧)—ઉપરોક્તા ૨૦ હકીકતોમાંની ૧૯મી કલમની હકીકત, તે વર્ગે, તાજેતરની ‘પ્રસ્તાવના તિમિર તરણિ’ ખૂકના [પૃ૦ ૩૦ના ઘેલા પેરાની—“ આટલી ખાબતો તો હીવા જેવી સિદ્ધ થઈચૂકી છે કે—” એ અંતિમ પંક્તિથી માંડીને પૃ૦ ૩૧ની—‘કોટે’ અપાવેલ ખર્ચ મૂકી છેવો પડેલ ’ વગેરે. (જુઓ તા. ૨૦-૭-૪૬ મુંબઈથી પ્રગટ થાયેલી પત્રિકા.) ” એ અંતિમ પંક્તિએ પદ્યે-તના] કરાવેલા સમસ્ત લખાણુને વાચકોએ જુંગભિંશિત, જુઠી તેમજ ઉપજની કાઢેલ વાતો તરીકે ઓળખી લેવા જણાવાય છે કે—‘ખર્ચ મૂકી છેવો પડેલ ’ એ અંગે સત્ય હકીકત એમ

હતી કે—“ તે બદનક્ષી કેસ અંગેની આ લેખકની ચાલુ જુખાની-માંથી છાવતી પંક્તિએ પકડીને ચાલુ કેસે તે વર્ગના વાહી લક્ષ્મીચંદ હીરળએ કોઈને ‘કોઈની મેં (હંસસાગરે) બદનક્ષી કરી છે’ એમ જણાવીને મારા પર (કેસમાંથી) કેસ ઉલ્લો કરેલ તે કેસ, વચ્ચેજ ચાલી જતાં કોઈ વાહીના તે કેસને ખર્ચસહિત કાઢી નાખીને તે વાહી લક્ષ્મીચંદ હીરળપર મારે બજાવવાની રૂ. ૧૫૦૦)ની ડીઓ કરેલ; પરંતુ તેવી ડીઓ બજાવવાને મુનિધર્મ ના કહેતો હોવાથી મેં તે ડીઓ જતી કરેલ.” એ સત્યવાતને અત્ર તેના નામધારી મુનિ નિત્યાનંદવિં દ્વારા હવે રજુ કરાવાએલ તે પંદરવર્ષ પહેલાંની ગલીયતર પત્રિકામાં તે વખતે નવા વર્ગે જ તેલું અસત્ય રૂપક આપેલ, એમ હવે તેની એ ‘તરણી’ ઘૂકમાંતે વર્ગે, મુનિ નિત્યાનંદવિં હસ્તક તે પત્રિકાના પણ કરેલ સ્વીકારથી નષ્ટી થાય છે. વાંચકો ઓળખી રાએ તે વર્ગની એ રોદડ ગોડડ સુવિહિતતાને.

[સં.૦ ૨૦૦૬માં શ્રી પ્રેમસૂરિ, રામચંદ્રસૂરિ આદિ ૬૦ ડાણા અને અમો પણ પાલીતાણા જ હતા, ત્યારે તો શ્રી રામચંદ્રસૂરિલુ, નવા તિથિમત બદલ કશું જ બોલી શકેલ નહિ; પરંતુ ત્યાંથી સં.૦ ૨૦૦૭માં વિહાર કરી શાસનપક્ષના ભયરહિતના અમદાવાદ મુકામે પહેલાંચી જઈ ત્યાં જાહેર સભાએ પણ યોળુને તેઓએ પ્રાચીન પ્રણાલિકાનું છાયેઓક ખંડન કરવા લાગી જવા પૂર્વક ચોતાના મતનું બહુ બહુ પ્રકારે મંડન કરવા માંડેલ ! આ ભીના જાણીને આ લેખકે પાલીતાણાથી તેઓશ્રીને ‘ત્યાં રોકાએલ છું, એમ જણાવો એટલે ચર્ચા માટે હું ત્યાં આવું છું’

એમ ચેલેંજ આપતાં તેનો જવાબ આપ્યા વિના જ તેઓએ અમદાવાહથી તરત જ ખસી જવામાં ડહાપણુ માનેલ ! તેથી નિરૂપાય બનેલ આ લેખકને એક તેમના તિથિમતનું નિરસન કરનારી તેમજ બીજુ સંહેશ પત્રમાં છપાએલાં તેમનાં વ્યાખ્યાનોમાંની ઉત્સૂત્ર પ્રદર્શણાએનું ઉદ્ઘાટન કરનારી, એમ ‘નવામતનું સચોટ અને સરલ નિરસન’ તથા ‘જૈનાચાર્યનાં ઉત્સૂત્રોની હારમાળા’ એ નામની એ સાધાર અને સચોટ ખૂક તાખડતોબ પ્રસિદ્ધ કરવી પડેલ. તે વાંચીને તે આપો વર્ગ, નિરૂત્તર અની જવાની પીડાથી બહુ ઉર્કેરાએલ.]

એ પત્રિકા શું છે ?

પરિણામે-નિજમતિને જિનમતિ લેખાવવામાં રસિક એવા તે વર્ગે, અનંતાનુભંધીના ગણ્યાય તેવા કોષે ચઢીને એક ‘દિવાલી અંક-સિદ્ધચક્કનો વધારે’ એ યોગસ શીર્ષકવાળું એક દ્રોમ્ય પ્રમાણુ ગલીચતર લખાણુ પતિતના હાથે લખાવી તથા ‘હીરાચંદ ગોરધનદાસ’ના યોગસ નામે (જાણુવા મુજબ) અમદાવાદ છપાવીને તેમજ તેને મથાળે તેની કિંમત રૂ. ૫ છપાવીને શ્રી સંધમાં અનેક ગામે પોતાના શિષ્ય એજન્ટો દ્વારા ઘર્તા સ્થલોએ અને ઘર્તા વ્યક્તિએને હાથોહાથ પણ પહેંચાડેલ. તે તે વર્ગમાંના કેટલાકોને તો આખાદ ઘર્તા લગલાભંધ ગાળોથી ભરેલ તે ગલીચતર પત્રિકાનો એક જથ્યો, તે વર્ષે પાલીતાણા વીરબાધ પાઠશાળાના મેડા પર સ્થિત શ્રી જબૂજુના એક શિષ્ય એજન્ટ ચિદાનંદવિં ઉપર પણ આવેલ. તે એજન્ટ એ ગલીચ પત્રિકાને પ્રચારી રહેલ હોવાની (ગોધા-

વાળી ધર્મશાળા સ્થિત) અમોને ગંધ આવતાં આ લેખકે અમ-
રેલીના એક પ્રસિદ્ધ શ્રાવક મારફત તે પત્રિકાની એક નકલ તે
સાધ્વાલાસની પાસેથી મંગાવેલ. બદ્લામાં તે એજન્ટ મુનિ(?)એ
'પાંચ રૂપીઓ કિંમત છે' એમ જણુવવાથી તે વાધાધારી
એજન્ટને તે શ્રાવકે પાંચ રૂપીયા આપીને પણ એ પત્રિકા
અમોને પહોંચતી કરેલ, તે જ એ ગંધા-ગોલંઘાળુંએ નીપ-
નાવેલ એ ગંધી પત્રિકા છે-જેમાંના એક વાહિયાત લખાણને
તે વગે, તેની તે 'તરણિ'માં નિત્ય કૂડ આળપ્રિયાનંદવિંના
હાથે ઉતારો અપાએલ છે !

[આ નીચે જણુવાશે તે ખીજ નંબરની વાતમાં તે
કહેવાતા મુનિ નિત્યાનંદવિંમાં તે કહેવાતા 'દીવાલી અંક'
ને તે 'અંકની પત્રિકા' કહેવામાંચ ખીજું મહાત્રત રહે છે !
એવા તે અષોધમૂલ, એવા તે વ્રત અને મુનિવેષ ધારી અને
તેવા હોવાને કીધે જ નિજના ભાવિ હિતાહિતના પણ લાન
વિનાના તે દિશિરાગી ભાઇબંધે, (નવાતિથિમત અંગે રચેલા
સર્વ પુસ્તકેના લખાણમાં સર્વદિક્ષશતશઃ જૂઠા ઠરેલા) મિથ્યાડ-
ભરી આગદ્રષ કુશુરના સીતમને ભૂલી જઈને તથા તે કહેવાતી
પત્રિકામાંની-દગ્લાબંધ ગાળાગાળીથી લરેલી અનેક વાતોમાંની-
પણ મારા અંગેની એક જ અસહૂ આશેપક વાતને પકડીને-]

(૨)-તે 'પ્રસ્તાવનાતિમિરતરણિ' સંશક ઘૂકના પૃંઠ ૧૪ ના
ખીજ પેરામાં જે—“એક લેખકે સંઠ ૨૦૦૭માં લખેલ દીવાળી
અંકની એક પત્રિકા મારા વાંચવામાં આવી. તેમાં તેમને
(હંસસાંનો) પૂર્વ પરિચય × × × ×”થી માંડીને પૃંઠ ૧૫ ના

બીજ પેરાની—“ મને શાંકા હતી કે—‘ આ લખાણુ સત્ય હશે કે કેમ ? પરંતુ શ્રી હંસસાગરજીની કષાયી અને તેવી તોકાની પ્રકૃતિ કાયમ રહેલી જેતાં શાંકાને સ્થાન રહેતું નથી.’ ” એ ત્રણુ પંક્તિપ્રમાણુ લખાણુ રણુ કરેલ છે તે, તે પત્રિકામાંના (પણ સુધારેલા) ઉતારા રૂપે રણુ કરીને તે કહેવાતી ‘ હીવાળી અંકની પત્રિકા ’ની આજે ૧૬ વર્ષો—‘ તે પત્રિકાનો લખનાર-છપાવ-નાર અને પ્રચારનાર તે વર્ગ જ છે ’ એમ કખૂલાતદર્શક સ્વીકૃતિ રૂપે છે ! આ વાત શાસનપક્ષને જેમ ઓછા આનંદનો વિષય નથી તેમ તે કહેવાતી પત્રિકામાં પ્રલુશાસનના સાધુ આદિ ચારેય વિદ્યમાન અંગોને (કોઈ-વાધરી કે ડેડ-લાંગી પણ કોઈને ન આપે તેવી) ભૂંડામાંભૂંડી અને તે પણ ઠગલા-બંધ ગાળોથી ભિથ્યાત્મીપણે ભાડનાર પણ તે વિષવેલો જ હતો, એમ એમના જ એ અક્ષલશૂન્ય અને તુંડમિજાળુ સાધવા-ભાસ શિષ્યના હાથે સાબિત થઈ જવા પામેલ હોવાથી તે આખાયે વેલાને આપણા ટોકોતર સમાજમાં આળવિકાર્થી પણ આળવન કાજળશા મુખે જ કરવું પડશો, તે ઓછા હુઃખનો વિષય નથી.

તે વિષવેલાએ, તે કહેવાતા ‘ હિવાળી અંક ’નાં ગંદાતિ-ગંદા લખાણુમાંના તે ઉતારાની પૂર્વે એ નિત્યાનંદવિંના હાથે ‘ તે અંકની એક પત્રિકા ’ એમ લખાવીને તો તે બીચારા મુનિધર્મના અજ્ઞાનમુનિને વિદ્ધાનોની દાખિએ ખરેખર મૂર્ખ-શિરામણુ પણ ઠરાવેલ છે ! કારણુ કે—“ તે જે હીવાળીનો અંક હોય તો તે અંક કોઈ ચેપરનો હોવો જોઈએ; પરંતુ તેવું તે

અંકમાં જણાવેલ નથી. એટલે કે-તે કોઈ ચેપરનો અંક નથી તેમજ (કોઈ પણ ચેપરના અંકની જેમ) અંકને કોઈ પત્રિકા હોતી નહિ હોવાથી તે અંકને અપાચેલું ‘દીવાળી અંકની પત્રિકા’ એ નામ પણ ન હોઈ શકે, એ પણ એ અજાનાની સમજ નથી, એમ સમજુભનો સહજ સમજ ધરાવતા હોય છે.”

તે વર્ગો આને મળતી એક ષોગસ પત્રિકા, તેમણે પી. એલ. વૈધ જેડે સં. ૧૯૯૬માં કરેલ ગરખડની સાભિતી આપ. નારતાર અને ચિહ્નાઓને આ લેખકે, તે વર્ષના આસોનાસના ‘શાસનસુધાકર’ પત્રમાં પ્રસિદ્ધ કરેલ, ખારે પણ રાષ્ટ્રે ભરાઈને છપાવેલ અને ગુમપણે સર્વત્ર પ્રચારેલી હતી, જેનો તલાજ શ્રીસંઘે ૧૬ આગેવાનોની સહીએ સાથે જડભાતોડ કરેલ વિરોધ અનેક ચેપરોમાં પણ મોકલી આપતાં તે વર્ગ ઉધાઈ જવા પામેલ. (જુએ ‘શાસનસુધાકર’ વર્ષ ૩ નો તા. ૨૦-૧૧-૪૩નો નધારો.) એવી તો તે વર્ગો, ‘સાગરપોલ પત્રિકા-સત્યપ્રકાશ પત્રિકા’ વર્ગેરે અનેક ષોગસ પત્રિકાએ, શ્રી સંધમાં પ્રચારેલ છે ! ‘પોતાને પોતે સર્વત્ર શાસનપ્રેમી, શાસ્ત્રાનુસારી અને સુવિહિત કહેવડાવનારા તે વર્ગનું શાસન-શાસ્ત્ર અને સુવિહિત-પણું આ છે’ એમ તે વર્ગો ૧૬ વર્ષો સ્વીકારેલ તે ‘દીવાળી અંક’ના લયંકર હાખલાથી તો શ્રીસંઘે હવે નિશ્ચયે સમજ રાખો.

(૩)-તે બૂકના પૃષ્ઠ ૧૫ના પેરા ત્રીજથી પેજ ૧૬ ના પહેલા પેરાનો ત્રીજી પંક્તિ સુધીની ‘પ્રદર્શનાયોગાદિવિધિસંઘડની × × × મારી પ્રસ્તાવનામાં અનો યથોચિત પ્રતીકાર કર્યો હતો.’ પર્યાતની વાતનું તો મારી ગતવર્ષની ‘પ્રસ્તાવના તિમર-

ભાસ્કર' નામની બૂકમાં સાધાર તેમજ આમૂલ્યવુલ પ્રામાણિક નિરસન કરેલ હોવાનું તે લેખક જણે છે, છતાં તેમણે તે નિરસનને એ રીતે મારીમથડીને ડાળેલ છે, તે મારી એ બૂક વાંચીને લેખકના અંતરમાં-તે વર્ગના ખુલ્લાં પડી જવા પામેલ જૂડાણું-ઓને અંગે-પ્રગટેલ રોધાનલનું પ્રતીક છે. તે પછીની એ લેખકની 'એની સામે જે જીવાબ આપવો હોત તો × × × એ ખતાવી આપે છે કે-અગડાપ્રિય કોણું છે?' એ વાત તો મારી 'પ્રસ્તાવનાતિમિર ભાસ્કર' બૂકમાં મુખ્યત્વે મેં તે નવા વર્ગના હૃદાત અને બીજાહૃદાત અસત્ય પ્રરૂપકોને ઉદ્દેશીને જણાવેલી હકીકતરૂપ વાતોનો તે વર્ગના વડિલ આઠ શ્રી પ્રેમસૂરિજીને ખદ્દે (તેઓના ખચાવ રૂપે) લેખકે જવાબ આપવા પ્રયત્ન કરેલ હોવાથી તે લેખકના તે ન્યાયે એ લેખકને જ અગડાપ્રિય લેખાવનારી છે.

(૪)-૫૦ ૧૬ના થીજ પેરામાં લેખકે કરેલા—“શ્રી હંસ-સાગરજીએ કાઢેલી ચોપડીનું નામ × × × તેથી જ આનું નામ મેં પ્રસ્તાવનાતિમિરતરણું રાખ્યું છે.” એ લખાણુમાં તે લેખકે ઘટાવેલો ન્યાય તો તે લેખક જે ૫૦ વિજ્યાનંદસૂરિજીમ૦ કૃત ‘અજ્ઞાનતિમિરભાસ્કર’ નામના પુસ્તકના તે નામને ઘટાવે તો તેણે તે નામમાંનો પ્રથમ શાખદ ‘અજ્ઞાન’ લઈને તેણે તે ‘અજ્ઞાનતિમિરભાસ્કર’ને જ ‘અજ્ઞાન’ તરીકે લેખાવવો પડે તેમ હોવાથી તે ન્યાય બેહુદો ઠરતો હોઈને-લેખકની જડખુદ્ધિના માપકરૂપ છે. વાસ્તવિક રીતે તો તે લેખકે પોતાની તે બૂકને મારી જ બૂકનું નામ આપેલ હોઈને તેની યોગવિધિની પ્રસ્તાવ-

નાને તેણે પણ અંધારું જ લેખાવવા વડે મારા સ્થાપેલ તે નામ પર સત્યની મહોર છાપ મારેલ છે.

(૫)-૫૦ ૧૬ ના પેરા ત્રીજની ‘શ્રીમાન હંસસાગરજીએ મારા લખાણુને’થી માંડીને ૫૦ ૧૭ ના પહેલા પેરા સુધીની વાતને જવાબ, મારી પ્રસ્તાવનાતિમિરલાસ્કર ઘૂકમાં “તે વર્ગે જ ૫૦ આઠ શ્રી દાનસૂરિલુમ૦ના ‘વિવિધ પ્રશ્નોત્તર’ના પહેલા ભાગમાં લખેલ પ્રસ્તાવનાને બીજા ભાગમાં પણ લાંઘેલ હોવાનો હવાદો” આપીને પણ સ્પષ્ટ કરી આપેલ હોવાનું જાણવા છતાં લેખકે, તે વાતને અહિં કદંગી રીતે ચીતરેલ છે તે લેખકનું માનસ આત્મલક્ષી નહિ હોવાના પ્રતીકર્દ્દપ છે.

(૬)-૫૦ ૧૭ ના પેરા ત્રીજથી ૫૦ ૧૬ના બીજ પેરા સુધીમાં લેખકે જે—“(અ) પૂજ્યશ્રી આત્મારામજી મહારાજશ્રીની કૃતિ સર્વત્ર સુંદર વ્યાપેલ હોઇને વિલાયતી સરકારે છપાવેલ પોણું એ મણુનું ‘ત્રદ્ગ્રવેદસંહિતા’ પુસ્તક અહિના ગવર્નર માર્કેટ તેઓશ્રીને મોકલીને તેઓશ્રીનું બહુમાન કરેલ, (આ)-ચિકાંગોની સર્વધર્મ પરિષહના આમંત્રણુથી વીરચંદ રાધવજીને તેઓશ્રીએ ચીકાંગો મોકલેલ, (ઇ)-તેઓશ્રીનું સં ૦ ૧૯૪૫નું ચાતુર્માસ પાલીતાણું થતાં ૩૫૦૦૦ માણસોની મેદની વચ્ચે સૂરિપદ અપાયેલ, (ઝ)-આ સ્પષ્ટ હીવા જેવી બીજાને પણ અશુલકર્મના ઉદ્યે હંસસાગરજી તેમની ચોપડીમાં ઉંધી ચીતરે છે, (ડ)- પ્રતભ્રષ્ટતાના કારણે સમુદ્રાય બડાર કરેલા અને રેલવિહારી થયેલા શાંતિવિજયે દ્રેષાંધપળે (સૂરિપદ વખતે) બસો માણસ હોવાનું લખ્યું છે, (તથા) (ક)-હંસસાગરજીએ તેવા પુરુષના શુણ ગાવાને

બहुદે અંતરની કાલિમાને ઠાલવવાનો નિંઘ્યુ પ્રયત્ન કરેલ છે.” એ પ્રમાણે છ વાત કરીને, નિજમતિને કેવી રીતે જિનમતિમાં અપાવવાની ચેષ્ટા ધડી કાઢી છે, અને તે ‘છ’ એ વાત કેવી અસત્ય તથા શાસનને ભાવિ હાનિપ્રદ છે? તે, વાચકો એ ‘છ’થે વાતને આનીચે અપાતા નંખરવાર ખુલાસા કારા તપાસે.

લેખકની તે વાતો નીચે પ્રમાણે બનાવ્યી પણું છે.

(અ)—વિલાયતી સરકારે તેઓશ્રીને જૈની નહિ; પરંતુ વૈદિકતું તેવું ભારે પુસ્તક મોકલેલ, તે તેઓના ખહુમાનરૂપે ન્હોતું મોકલેલ; પરંતુ ‘આત્માનંદ શતાખ્ચિદ અંથ’ના ગૂર્જરાવિલાગ પૂરો ૧૨૩ પરના લખાણુ મુજબ તેઓશ્રીએ, મુનિશ્રી વલ્લભવિંમોશ્રીના હાથે શ્રાવક પર તા. ૧૩-૧૦-૧૮૮૮ના રોજ પત્ર લખાવીને વેચાતું મંગાવેલ; ત્યારે તેણે તે લેટ મોકલખું પડેલ, અને તે પણ તેઓશ્રીને સર્વધર્મપરિપદાદિ લણી દોરી શાસનના મૂળમાર્ગસ્થિત તમામ મુનિવર્ગ પ્રતિ અનાદરવંત કર્યા બાદ પાંચાંત્યો પ્રતિ આદરવંત અનાવવાની કુનેહડૃપે લેટ મોકલેલ હતું.

(બા)—મને ખ્યાલ છે ત્યાં સુધી—વીરચંદ્લાઈને તેઓશ્રીએ ચીકાંગો મોકલેલ હોવાનું તો પૂરો આઠ શ્રી વલ્લભસૂરિલુ મ૦ અને તેમના પક્ષકારોનું કહેવું છે. સામાપ્લે—પૂરો આઠ શ્રી દાનસૂરિલુમ૦શ્રી આદિનું તો ‘વીરચંદ્લાઈને ચીકાંગો પૂરો આત્મારામજી મહારાજે મોકલેલ નથી; પરંતુ પોતે ગચેલ છે’ એમ કહેવું છે. આમ છતાં આ સામાપ્ક્ષના ગણ્યાતા લેખકે—‘તેમને તેઓશ્રીએ ચીકાંગો મોકલેલ છે’ એમ લખ્યું તે પોતાના તે વડ-

દાદાગુરુનો એ પ્રકારે પોતાના પાલક વડિલોથી વિરુદ્ધ જઈને પણ યથ ગાવા તેવું ખોટું લખ્યું છે.

(ઇ)–તેઓશ્રીનું પાલીતાણા ચાતુર્માસ અને સૂરિપદ ૧૬૪૫ માં થવાનું લખેલ છે તે પણ ખોટું છે. તેઓશ્રીનું પાલીતાણા ચાતુર્માસ સંવત ૧૬૪૨માં અને સૂરિપદ ૧૬૪૩માં થખેલ છે. તેઓને શ્રાવકોએ ‘સૂરિ’નામ આખ્યું તે વખતે લેખકે ૩૫૦૦૦ મતુષ્યો હાજર હોવાની લખેલી વાત પણ તેઓશ્રીની ખોટી રીતે મહત્ત્વા દેખાડવા અંગેની ખોટી વાતને ખોટી માનવા છતાં સાચી મનાવવા લખેલ છે. આ જેતાં તો લેખક મુખ્યત્વે અસત્યના ઉપાસક હોવાનું જણાય છે. તે ‘સૂરિ’નામ પ્રદાન અવસરે તો હાજર પણ હતા તે તેઓશ્રીના સમર્થ વિક્રાન્તિષ્ય મુનિશ્રી શાંતિવિજયજીએ ચર્ચાચંદ્રોદયમાં કહેલી ૨૦૦ માણુસની ઉપસ્થિતિ જ ઘટિત છે. અને તે માનવાના કારણો નીચે મુજબ છે.

૧–મુનિ (આઠ)વલ્લભવિજયજીએ લખીને તથા સંંદેશ ૧૬૪૮ માં અમદાવાદ ‘વિજયપ્રવર્ત્તક’ પ્રેસમાં શ્રાવક અમરચંદ પી. પરમાર તથા લગુ ઇત્તેચંદ કારલારી હસ્તક છપાવીને પ્રગટ કરેલ ‘શ્રી વિજયાનંદસૂરિચિત્ર’ નામની નાળું બૂકના પૃષ્ઠ ૩૫ ઉપર લખેલ છે કે–‘સંદેશ ૧૬૪૪(૪૩)ના કારતક વદ પ ના દિવસે પાલીતાણામાં શેડ નરથી કેશવજીની ધર્મશાલામાં સુમારે પ હજર માણુસની વચ્ચે શ્રાવક-ક્ષણે મળીને પાંડિત શ્રી આત્મારામજીનું ‘શ્રી મદ્વિજયા-નંદસૂરિ’એ નામ સ્થાપન કર્યું’ [અત્ર વાચકોએ આ

હકીકતો ધ્યાનમાં લેવાની છે કે—“આ સૂરિનામ સ્થાપન, કોઈ કંકાત્રી પ્રસિદ્ધ કરવાહિની જાહેરાત કર્યા વિના અનોપચંહભાઈ ગોકલભાઈ આદિ શ્રાવકોની ખાનગી શુદ્ધતેગો અને સલાહોના સાંદ્રપે થએલ હોઈને મુખ્યત્વે અનુરાગી શ્રાવકોની જ હાજરીમાં થયેલ. સાધુસમુદ્દાયમાં શ્રાવકોનું તે સ્વચ્છંહી અને સાહસિક લેખ ચેલું પગલું, ગચ્છની મર્યાદા તેમજ જામાચારીનું લોપક હોવાથી તે કાર્ય સામે ‘ભાવનગરસ્થિત વડિલ પૂર્ણ વૃદ્ધિચંદળ મહારાજ, અન્યત્ર સ્થિત ગચ્છાધિરાજ પૂર્ણ મૂલચંદળ ગણિ, ગીતાર્થ્યુંગવ પૂર્ણ મુનિરાજકી અવેરસાગરજી મ૦, પૂર્ણ મણિવિ૦ હાદા, પૂર્ણ પં૦ શ્રી હ્યાવિમલજીમ૦, ડેલાવાળા પૂર્ણ પં૦ શ્રી રત્ન-વિજયજીમ૦, પૂર્ણ પં૦ શ્રી ચતુરવિ૦મ૦, લવારની પોળવાળા પૂર્ણ પં૦ શ્રી પ્રતાપવિજયજીમ૦’ વગેરે પ્રભુશાસનના મૂળમાર્ગ-સ્થિત પૂર્ણ ખડતલ મુનિરાજને સખત વિરોધ હોવાછિ કારણે તે પ્રસંગે ગુજરાત-કાઠીઆવાડાછિ પ્રદેશના યાત્રિક મનુષ્યો તો પૂર્ણિમાની યાત્રા કરી કા૦ વ૦ ૧-રના દિવસે જ પાલીતાણેથી ચાહ્યા ગચ્છેલ હોવાથી પ્રાય: કોઈક જ માણુસે હાજરી આપેલ, તેમજ તે વખતે નરશીકેશવજીની ધર્મશાળામાં ભારતી ઉચ્ચ-રાવવા તથા વડોદરાના એક ચુવાનને હીક્ષા આપવા બંધાવેલ મંડપ પણ તે હીક્ષામાં ઉઠેલ દરખારી વાંધાના કારણે ઉપયોગમાં લઈ શકાયેલ નહિ, અને તે ધર્મશાળાનો હોલ પણ આજના જેટલો વિશાળ નહોતો, એ સ્થિતિમાં તે સૂરિનામ સ્થાપન પ્રસંગે હોતમાં માણુસ કેટલું સમાય ? ”]

૨—‘શ્રીનૈનધર્મ્યકાશ’ (ભાવનગર) પુસ્તક બીજું, માર્ગશિર્ષ શુદ્ધ ૧૫ સં૦ ૧૯૪૩ અંક રના પૂર્ણ ૧૪૪ ઉપર

‘વર્ત્તમાનચર્ચા’ એ શીર્ષીકાલણે છપાએલ-‘કાર્તીક શુદ્ધિ ૧૫ ઉપર શત્રુંજ્યતીથો યાત્રા કરવાને સુમારે વીશ હજાર મનુષ્ય (તેઓ વદ પાંચમ સુધીમાં તો ખધા જ ચાલ્યા ગયા હોય) એકત્ર થયું હતું. ગુજરાત-પંજાબ-મારવાડ-ખંગાળ વળે ઘણ્ણા દેશના મનુષ્યો હતા’ (કે-જે-એને ભાવનગરસ્થિત શ્રી વૃદ્ધિ-ચંદ્રજીમં આહિને જણુ નહિં થવા દેવાની બુદ્ધિએ તે નામ સ્થાપવાનો વિચાર જ કોઈએ જણાવેલ નહિં.) ××× ‘કાર્તીક વદિ પને દિવસે ન્યાયાંસોનિધિ સુનિરાજ શ્રી આત્મા-રામજીને સૂર્યિપદ આપવા એક મોટી સભા મળી હતી’ (એટલે કે-પૂનમના યાત્રિકો ગયા બાદ તે કાર્ય માટે જ ત્યાં ખાસ રોકાએલ પૂરો આત્મારામજીમં શ્રીના અનુરાગીજનોની તે નરશી કેશવજીની ધર્મશાળાના હોલમાં એકઠી થયેલ સભાએ જ તેઓશ્રીને સૂર્યિપદ આપેલ.)

૩-સં ૧૯૫૦માં છપાએલ ‘ચર્ચાચંદ્રોદય’ ભાગ ત્રીજના પેજ ૩૦-૩૧માં લખેલ છે કે—“ સં ૧૯૪૪મેં આત્મારામજીને પાલિતાણેમેં ચૌમાસા કિયા, ઔર કાર્તીક શુક્લ પૂનમકો શત્રું-જ્યતીથોંકી યાત્રાકો (લીચો) અનેક શ્રાવક આતે હી હૈ. ઉનમેંસે હો ચાર શહેરકે રહુનેવાલોને (જે આત્મારામજીકે રાગી થે.) આત્મારામજીસે કહા, હમ આપકો આચાર્યપદવી હેના ચાહતે હૈ. આત્મારામજીને ન માલુમ કયા ! લાલ જાનકર ઈસ ખાતકો સ્વીકાર કરલિયા, ઔર મનમેં કૂલ ગયે. ઈતનાલી નહિં કહાકિ-હમારે બડે ગુરુભાઈ-ગણ્ણિજી શ્રી મૂલચંદજી મહારાજ તથા શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજસેં ઈસ ખાતમેં સલાહ ઔર આજા વેના

चाहिये. इसरे दिन श्रावकोंने शेठ-नरसिंह केशवलुकी धर्म-शालामें एक भड़ान सज्जाकर आत्मारामलुको पाट पर ऐठा हिया और कितने श्रावकोंने इकठा होकर संभाषण किया कि-आजकल भारतभूमी आचार्यपदसे छीन हो गयी है. सभकी सलाह होती तो श्री आत्मारामलु (आनंदविजयल) महाराजकों उस पदसे भूषित करें. कितनेक श्रावकोंने तर्क कियाकि-महाराज पर आचार्यपदका वासक्षेप कौन करेगा? वासक्षेप करनेवाला साधु होना चाहिये, जो महाराजसे दीक्षापदमें बड़ा होवे. आचार्यपद मिले पीछे महाराजल! गणित्यश्री मूलचंद्रल महाराजको तथा श्री वृद्धिचंद्रल महाराजकों वंदना करेंगे वानही? करेंगे तो आचार्यपदकी न्यूनता होगी और नहीं करेंगे तो पर-स्पर विशेष होगा. इस आत्मों सोच दो. कितनेक श्रावकोंने कहा सोच लिया है. जो कार्य करनेको आप दोग इकड़े हुवे है उसको करनाही मुनासब है. अस! इतनेमें लरुच और बड़ोहेके कितनेक श्रावकोंने (जो आत्मारामलुके मान्य श्रावक गिने जाते हैं) उंचे स्वरसे कह हिया कि-ओदो!—“श्री सूरी-चंद्रल महाराजकी जय”—न किसीसे वासक्षेप लिया न कुछ किया अनुष्ठान किया.” (आ सूरिनाम स्थापन वर्खते विद्वान मुनिश्री शांतिविजयलुम०श्री पालीताणे ते सभामां हाजर हता अने आ०श्री वल्लभसूरिलुम०श्रीनी दीक्षा, ए सूरिनाम स्थापन पृष्ठी एक वर्षे थअेल छे, एट्टुं वाचकोअे अन्त विशेष तरीके ध्यानमां राख्युं.)

४—‘आत्मानं द शताक्षिद द भारकथं थ’ ना गूर्जर विभा-

ગના પૃ૦ ૮૩ ઉપર શા. દેવચંદ દામજી કુંડલાકર લખે છે કે—
 ‘હિંદના સકલ સંધના પ્રતિનિધિ મંડળો તેઓશ્રીને વાસક્ષેપ
 નાખીને સૂરિનામ સ્થાપ્યું.’ (તો તે પ્રતિનિધિમંડળ કેટલા માણ-
 સોનું હોય ? એ પણ વાચકોએ વિચારવું રહે.)

(૩)—સૂરિપદ વખતે ઉપરજણાવેલા આધારોથી પણ લગ-
 ભગ ર૦૦ થી વધુ મનુષ્યોની હાજરી નહિ હોવાનું સ્પષ્ટ તરી
 આવતું હોવા છતાં—મુનિ (૧) નિત્યાનંદ વિઠ્ઠાએ, તે ખૂકમાં ચોતે
 જણાવેલી ઉપ૦૦૦ મનુષ્યોની હાજરીવાળી સ્પષ્ટ અંધારા જેવી
 બનાવઠી વાતને સ્પષ્ટ ઢીવા જેવી વાત જણાવવી અને ર૦૦
 મનુષ્ય હાજર હોવાની શ્રી શાંતિવિંદો જેવા સમર્થ વિદ્વાનની
 જાતે અનુભવેલી ખરી વાત જણાવનાર મને તે લેખકે, ‘અશુલ-
 કર્મના ઉદ્ઘે ઉંધી ચીતરનાર તરીકે ચીતરેલ છે’ એમ લખી
 નાખવું ! તે, તે લેખકના જ કોઈ ઘોર અશુલ કર્મના ઉદ્ઘે તેણે
 તે પ્રસંગે ૨૦૦ મનુષ્ય હોવાની સ્પષ્ટ ઢીવા જેવી વાતને અંધારામાં
 રાખવાનો કરેલ પ્રયાસ, મારા લખાણુથી કુટ તરીકે ખુલ્લો પડી
 જવાને અંગે તેને અઢેલા ભારી રોષને આભારી છે.

(૪)—તેવા તે લેખકે, તે સ્થળે જેને વ્રતભ્રષ્ટ હોવાને કારણે
 સમુદ્દરાય બહાર કરેલા હોવાનું જણાવેલ છે તે વાત તો—‘મુનિ
 શ્રી શાંતિવિજયજી, (કે-જેમની જ્યોતિષજ્ઞાન સંબંધીની વિદ્વતા-
 ના જેઠો પૂર્ણ આત્મારામજી મહારાજના સંધાડામાં તો અધારિ
 પર્યાત એક પણ હોવાનું જાણેલ નથી.) ‘ચ્યાર્ચિયન્ડ્રોદ્વય’
 ભાગ ત્રીજના પૃ૦ ૮૭ ઉપરના ‘એક શુણવાન ચેલેકી ઈર્ષાર્મેં
 આન કર હોખિત ઠહરાયા; પરંતુ કયા નિર્દોષી પુરુષ તેરે કહ-

નેસેં હોષવાન હો શકતા હૈ ?' એ લખાણુ મુજબ બળજબરીથી પ્રતભ્રષ્ટ કેખાવેલ જણુતા હોવાથી દ્રેષ્ટમૂલક બનાવટી ગણાય અને તેને અંગે તે શ્રેષ્ઠ વિદ્ધાનું અને સત્યપ્રિય સુનિએ જણું. વેદી ૨૦૦ મનુષ્યોની સાચી હાજરીને 'દ્રેષ્ટધ્યપણું કહેવી' કહી હેવી તે કેખકની વ્યક્તિદ્રેષ્ટપૂર્ણું બાલિશતા ગણુાય.

(ક)-કેખકે, મને તેના પુરુષોના આ બધા ગુણો ગાવાને બદલે અંતરની કાલિમાને ડાલવવાના નિધિ પ્રયત્ન કરનાર તરીકે કેખાવેલ છે, તેને તો હાલ તુરત તત્ત્વાત્ત્વના લાન વિનાના વાતૂલજનના પ્રલાય તરીકે કેખીને તે બદલ એ કેખકની હાલ તુરત તો દ્વારાપૂર્ણું દિશિએ ઉપેક્ષા કરવી ઉચિત ધારેલ છે: છતાં કેખકના જે કોઈ જવાખદાર વડિલ ધર્યાછે તો તેના વડિલ પુરુષોના આથી તો કેર્દગુણું ગાઈ બતાવવા આડી રહેતા ગુણુગાનનું તેમને ચેટપૂર પાન કરાવીને એ કેખકની જ નહિ; પરંતુ તેના નાના-મોટા સૌ નિજમતિઓની ઉમેદને આ કેખક, આવા જ પ્રશસ્ય પ્રયત્ન વડે સુખેથી પૂર્ણું કરવા લાવના ધરાવે છે. એમાં તો ભાવિ શાસનસંધને પારાવાર લાલ પણ છે

(૭)-તે બુકના પૃષ્ઠ ૨૪ પેરા ૪ની પંક્તિ ૪થી પૃષ્ઠ ૨૫ના પહેલા પેરા સુધીમાં તે કેખકે જે-'આને બદલે ખર્દું તો તેમણે એ જ જણુવવાની તસ્થી કેવાની જરૂર હતી કે-× × × × તથા તેમના ગુરુ શ્રી જવેરસાગરજીનું નામ તેઓ કચાંય લેતા નથી એનું શું કારણ છે, એ જ ખર્દું જણુવવું હતું ને ?' એમ કહેલ છે, તેનો ખુલાસો તે કેખકને જ નહિ; પરંતુ તે સમસ્ત વિષવેલાને પણ તેમના વડાદાગુરુ પૂર્ણ આરો શ્રી વિજયાનંદ-

સુરિજી મ૦ તથા તેઓશ્રીની મૂર્તિં ઉપરના લેખ આદિના દિશાંતે ઉપતથ્ય હોવા છતાં તે લેખકે તેવું લખાણુ કરેલ છે તે, તે લેખકની નિદ્દકવૃત્તિનું ધોતક છે. સિવાય જે ગીતાર્થી પુંગવના ગંભીર પ્રશ્નોના પૂર્ણ આત્મારામજી મહારાજે પણ વિનભ્રલાવે (શતાખ્ષિંદ્ર અંથમાં છપાએલ તેઓશ્રીના હસ્તલિખિત પત્રમાં છે તે) ખુલાસા આપવા ઉચિત માનેલ છે, તે વિદ્ધકર્યે પૂર્ણ મુનિરાજશ્રી જવેરસાગરજી મ૦શ્રીનું પુણ્ય નામ તેવા પરવારે-લાએ. સિવાય કોણું ન હ્યે ?

(૮)-[મારી ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ ખૂઢના પૂર્ણ ૨૦ ઉપર તે વર્ગને ઉદેશીને કરાએલા લખાણમાં મેં-‘મુનિશ્રી શાનસાગરજી તથા ઋષભદેવજીની પેઢીને બદલે પૂર્ણ આ૦ શ્રી હેવેન્ડ સા૦ મ૦ને ઉદેશીને તેણે કરેલા લખાણને શ્વાનવૃત્તિએ લખેલ કણું હોવા છતાં, પૂર્ણ ૧૨ ઉપર ‘પ્રસ્તાવનાગત વિષયો પરતવેની તે મુનિની અધ્યાધ્યમૂલતા જણાવેલ હોવા છતાં, પૂર્ણ ૨૬ ઉપર (મેં નહિ; પરંતુ) પૂર્ણ આગમોદ્ધારકશ્રીએ, પૂર્ણ સકલાગમ-રહસ્યવેદીજીને આગમ ભણ્યા વિનાના એટલે અભણુ કદ્યા હોવાનું લખેલ હોવા છતાં, ‘પૂર્ણ આત્મારામજી મ૦ના પિતા ગણેશચંદ્ર ધાડપાડુ તેમજ અહારવાટિયા હતા’ એમ (મેં નહિ; પરંતુ) સાંચો ૧૯૫૨થી પૂર્ણ આ૦ શ્રી આત્મારામજી મ૦ના જીવનચરિત્રોમાં પૂર્ણ આ૦ શ્રી વલલભસુરિજી મ૦શ્રીથી માંડીને સુરીલ-ત્રિપુરી મહારાજ-પંડિત ધીરજલાલ વગેરેએ લખેલું હોવા છતાં, પૂર્ણ ૪૪ ઉપર-‘સ્વર્ગવાસી બનેલા તે ગીતાર્થી મુનિ ઉપર પણ થુંકવાની છટાલીના ‘મુસેલિની’ના જેવી ચોણ્યતા’ એમ લખેલ હોવા છતાં] તે કલેશાનંદવિંયો, (તે-તે

અપશબ્દો મેં તેઓને કહ્યા છે, એમ હેખાડવા સારુ) તે ખૂકના પૂરો રૂપના ખીજ પેરાથી પૂરો રૂપ ના ખીજ પેરાની પંક્તિ જ સુધીમાં ‘તે વગેરે અપશબ્દોનો શબ્દકોષ મારે માટે તથા મારા પૂજ્યવર્ગ માટે ઠાકુંયો છે.’ એમ અસત્ય પ્રલપીને તે તે પરકથિત અને પર વ્યપહેશકથિત અપશબ્દોને તેણે યદ્વાતદ્વા પ્રકારે જે મારામાં ઘટાવવાની ઉન્મત્તવત ચૈષા કરેલ છે, તે લેખકમાં શુદ્ધ બુદ્ધિનો અલાવ સૂચવે છે. સિવાય શાસનપ્રાણુ સુજાજનો તો સમજે જ છે કે—“ચોતાના ભત આતર આખું પ્રલુશાસન ડાળિને છેવટ પૂનાના વૈદાઢ દ્વારા પણ શ્રી જિનોક્ત આરાધના માર્ગનું ત્રીસ ત્રીસ વર્ષથી નિકંદ્ન કાઢવા મથનાર એ ઉત્થાપક ટોળિનાં તે તે હુર્ગતિપ્રદ કાર્યો અંગેના પ્રપંચો—કાવત્રાં—લેદીપત્રો તથા ગેણી ચીટીચો વગેરે પકડી પાડવાનો પ્રલુશાસનના કોટવાળને તો અધિકાર હોય જ છે; પરંતુ તેવા પાખંડીઓનાં પાખંડી લખાણેની સામે કોઈના વતી લખાણો વગેરે કરવાનો તો વિશેષ અધિકાર હોય છે.” એ વસ્તુ સમજન્યા વિના શાસનસેવકનાં તેવાં લખાણેને તેઓ પોતાનાં વડિવો સામે થુંક ઉડાડવારુપે લેખાવે તે, તે તે વડિવોના તેવા લયંકર અપરાધોને પંખાળવાની બાલીશતા ગણ્યાય.

(૯)—પૂરો રૂપ ના ખીજ પેરાની એ ચાર પંક્તિ પછી પૂરો રૂપ ના પહેલા પેરા સુધીમાં લેખકે જે—“તેમના દાદાગુરુએ સૂર્યવિમાનના લુબોને ‘આતપ’ને બદલે ‘ઉદ્ઘોત’ નામકર્મનું પ્રતિપાદન કર્યું” અને સુકોશલની માતા મરીને જે વાધણું થઈ છે તેને શિયાલણી થઈ હોવાનું જણાવેલ હોવાથી તેમનું જ્ઞાન કુપમંડુક લખવાને બદલે તેઓ જે ખીજનું તેથું લખે છે અને

આગમવાચનામાં તેના દાદાગુરુ ઐટો અર્થ કરતા લારે તેમના સંસારી ભાઈ મુનિ મહીવિજયજી સુધારવાનું કહેતા છતાં તેઓ સુધારતા નહિ '× × × 'વિલંગીયપણું' સ્વયંવે છે, પણ ખીજનું નહિ, તે તેઓ સમજ રાખે." એ પ્રમાણે વાત લખી છે તે જે તથાસ્વરૂપે જ હોય તો તેમણે તે વાત, 'પ્રસ્તાવનાતિમિરભાસ્કર'ના લખાણેના મારોલ ખુલાસાએ આપવાની ક્રજ નહિ ખજાવનાર 'શ્રી પ્રેમસૂરિલ મ૦, તે ક્રજ ખજાવવા તૈયાર છે' એમ તેઓશ્રીના નામથી અને સહીથી શ્રી ધર્મગુમવિના પાંચ કારણુનો પણ ખુલાસો જણાવવા પૂર્વક લેખકે તેઓશ્રીના હાથે જોહેર કરાવવી. અન્યથા આલિનિવેશિક મિથ્યાત્વ અને વિલંગીયપણું એમનું જ નહિ; પરંતુ એ આખાયે વર્ગનું છે એમ તેઓની વિપરીત વાતો અને પ્રવૃત્તિએ પરથી હું જ નથી કહેતો, ખધા વિદ્ધાનો કહે છે, તેમ તે છે જ. તેવા તે વર્ગને 'આતપ' અને 'ઉદ્ઘોત'નો સુધારો સમજવા અહિ દીક્ષા લેવી રહે છે.

(૧૦)-તે લેખકે, તે ખૂંકના પુઠ રહેના પેરા ખીજમાં જે—
 "શ્રી હંસસાગરજી તેમની ચોપડીના પુઠ ૧૫માંના લખે છે કે—
 'આ પ્રયાસ કરતાં પહેલાં પુઠ આઠ શ્રી હેવેન્દ્રસાગરજી મહારાજે માલેગાંવ મોતીચંદ વીરચંદને એ પત્રોથી જણાવેલ કે—આઠ શ્રી પ્રેમસૂરિલ મ૦નો માર્કી પત્ર અથવા હિલગીરી પત્ર મોકલો.'
 આ સંબંધમાં હું પૂછું છું કે—શું આઠ શ્રી હેવેન્દ્રસાગરજીને જૈનસમાજ કે—શ્રી જૈનસંધ તરફથી સરમુખત્યારીપણું મળ્યું છે કે—તેઓ માલેગાંવ (મોઠ વીઠને) તેવું જણાવે? આવો નાદીરશાહી હુકમ મોતિલાલ ઉપર છોડવાનું કાંઈ કારણ? કલેરોટ્પાંડક

જુઢાં લખાણો, પોતે લખે તેનો, તેમણે માઝીપત્ર લખવાનો નહિ અને જેઓ તદ્દન નિરાળા છે તેમની પાસે માઝીપત્ર લખાવવું છે, અને તે પણ હૂરના ગૃહસ્થને ઓર્ડર કરીને ! આ જ બતાવી આપે છે કે—‘ચાર કોટિવાળને દંડે’ એ નીતિનું અનુસરણ તેઓ જ કરી રહેલા છે.” એ મુજબ લખાણ કરેલ છે, તે સંપૂર્ણ દાલિક છે. કારણ કે—“શ્રી પ્રેમસૂરિલુએ અમદાવાદથી તે મોતીલાલભાઈ મારકૃત ગંધાધિપતિ પૂરો આરો શ્રી માણિકય-સાગરસૂરીધરજી મારો શ્રીને પાલીતાણાથી અમદાવાદ પોતાને માર્ગદર્શન આપવા માટે યોલાવેલા હતા અને તે જ પ્રસંગે બહાર પડેલી એ લેખકની ‘પ્રવન્યાયોગાહિવિધિ સંગ્રહ’ ખૂક ગત પ્રસ્તાવનાના અસહ્ય લખાણ ખદલ ખરાય નહિં લગાડવાનું શ્રી પ્રેમસૂરિલુએ, પૂરો ધર્મસાગરજી ગણિને પાલીતાણે લાલભાઈ પરીખ સાથે કહેવરાવેલું; (લેખક, આરો શ્રી પ્રેમસૂરોને આ બાબત તદ્દન નિરાળા કહે છે તે કેટલું સત્ય છે ? તે અત્ર વાચકોએ ખાસ વિચારણાનું.) આ સ્થિતિમાં તે માર્ગદર્શન અંગેનો પત્ર વ્યવહાર શ્રી મોતીલાલભાઈએ, પ્રેમસૂરિલુની પ્રેરણાથી પૂરો આરો શ્રી દેવેન્દ્રસાગરસૂરિલુ મારો સાથે રાખેલો હતો અને તેથી જ પૂરો આરો શ્રી દેવેન્દ્રસાગરસૂરિલુ મારો શ્રીએ તે હૂરના મોતીલાલભાઈને લખેલા તે પત્રોમાં તે તે પ્રમાણે (‘અન્યથા અમારા પૂરો ગંધાધિપતિશ્રી અમદાવાદ જઈ તેમને મળી શકશે નહિં’ એમ જણાવવા) જણાયું હતું અને તે વ્યાજખી જ હતું, એમ તે લેખક પણ તે વખતે પાલીતાણે જ હોઇને જણે જ છે, છતાં તેણે તેવું ઉલદું લખેલ છે તે તેની યોગ્યતાનું સૂચક છે !”

(૧૧)-તે લેખકે, પૂરો ઉરના પહેલા પેરામાં જણાવેલી મારી ખૂકમાંની પર્વતિથિ અંગેની વાત, ‘કશ્યે પૂર્વાં’ના પ્રમાણુવાળી છે, એમ જણુવા છતાં અને તે વર્ગે ‘અહ્તતિથિલાસકર’ નામની આદ્ધારે પાસે તૈયાર કરાવેલી ખૂકજ પ્રમાણુશૂન્ય છે એમ પણ જણુવા છતાં મારી વાતને પ્રમાણુશૂન્ય અને તે આદ્ધારીયા વાતને પ્રમાણેપિત લેખાવવા પ્રયાસ કરેલ છે તે તેનું શાસનપક્ષના હાથે ડલિપત ઠરેલ તિથિમતની પણ પછ્ચડાન્ય વિસંગીયપણું છે.

(૧૨)-ખીજ પેરામાં તેણે જણાવેલ છે તે મુજબ તિથિ મારી કદ્વિપનાને આધીન હોવાનું મેં કદ્વી નહિ જણાવેલું હોવા છતાં તે લેખકે તે વાત મારા નામે ગાએલ છે, તે લેખકને ખીજું મહાત્રત તો લગભગ નહિ હોવાનું સૂચક ગણ્યાય.

(૧૩)-તે લેખકનું ત્રીજ પેરામાંનું લખાય આમૂલ્યવુલ મિથ્યાત્વી છે. નૈન જયોતિષ મુજબ વર્ષે ‘છ’ તિથિને ક્ષય, અનાદિકાલથી જ આવે છે અને તેમાં આવતી ક્ષીણુ પર્વતિથિને આરાધવા માટે ‘અભિવર્દ્ધિદ્વાસંવચ્છરે જત્થ અહિઅમાસો પડતિ’ એ આગમના પાઠ મુજબ પણ અનાદિકાલથી જ-ક્ષીણુ પર્વતિથિને પ્રથમ તો પર્વતિથિસંજા જ અપાતી આવેલ છે અને આરાધનાની વાત તો એ રીતે પર્વતિથિ હાજર કરવા પછીની છે.

(૧૪)-તે લેખકે, ચોથા પેરામાંનું—“તેઓ ધ્યાન રાખે કે—આચરણાને સિદ્ધ કરતું શાસ્ત્રવચન હોય તો શાસ્ત્રવચન કરતાં આચરણાવચન બળવાન છે.” એમ નવું જ શાસ્ત્ર ભાખ્યા બાદ (ચતુર્થીમાં પંચમીના લોગ છે, પરંતુ છઠમાં નથી માટે

‘અંદર જવું હજુ પણ કહ્યે’ એમ જાણુવનારા વ્યવસ્થા સૂચક) ‘અંતરાવિ સે કપ્પઠ’ એ શાખ વચ્ચનને સંવત્સરીના ફેરફાર વાળી આચરણાના આધાર તરીકે ટાંકી બતાવેલ છે તે,— ‘એક વચ્ચન જાલીને છાંડે ખીંદાં લૌકિકનીતિ’ વચ્ચન મુજબ પણ ખુલ્લું મિથ્યાલિનિવેશ સૂચક છે. આવું વદ્વામાં-મહોપાઠ્યાય શ્રીમદ્ યશોવિ૦મ૦ના ‘સૂત્રે લષ્ટયું પણ અન્યથા, જુહું જ ખુલ્લગુણું જાણું; સંવિજવિષુધે આચર્યું’, કાંઈ હીજે હો કાલાદિ પ્રમાણું’ એ વચ્ચનોનો તો તે લેખકે ખુલ્લોએ અપલાપ જ કરેલ છે ! હજુ કાંટાનોય ઉદ્ધાર શક્ય; પરંતુ આવાનો ઉદ્ધાર શે થાય ?

તે લેખક, પણ જે આચરી રહેલ છે તે—‘કઢે હોરો ખાંધવો-તરપણી તેમજ ઘડામાં હોરાનો ગાળીયો નાખવો-ચાલપણાના છેડા કમરે ખોસવા-ગોચરીની ઓળીને એ ગાંઠ દેવી’ એ વગેરે આચરણાને સિદ્ધ કરતાં શાખવચ્ચનો તેમણે કયાંય જોયાં-લષ્ટયાં હોય તો તે બતાવે. અને જે તે આચરણાએને સિદ્ધ કરતા શાખવચ્ચનો તે લેખક મેળવીને ન બતાવી શકે તેમ હોય તો તે પૂર્વાચરીં આચરિત ‘જુત’ આચારરૂપ આચરણાએને તે લેખક આચરવી ખંધ કરે તો જ તેની તે ધરગત્થુ આચરણાની વ્યાખ્યા અંગે તે લાઈખંધ સાચા ઠરે. લેખક જે સત્ય માર્ગની સાચી શ્રક્ષા ધરાવતા ન હોય તો—અને તેને અંગે જ તેઓ જે તેવા ગોળા ગણડાવતા હોય તો તો કાંઈ કહેલું રહેતું નથી.

વર્ત્માનમાં પ્રથમ ઉત્તરાધ્યયનના અને પછી આચારાંગના ચોગોદ્રહનની પ્રવર્ત્તી આચરણા બદ્દલ પણ કોઈ શાખવચ્ચન નહિ હોવા છતાં કે લેખક એ આચરણાને જ ખળવાન માનીને

અતુસરી રહેલ છે તે લેખક, આમ ‘આચરણા માટે શાસ્ત્રવચન હોય તો તે આચરણા બળવાનું’ એમ તેમના વડિલોની વચ્ચે પણ ઐકામ ઉત્સૂત્ર વસ્તી શકે છે ! ત્યારે તો આ૦ શ્રી પ્રેમસૂરિલુએ તેનો છેવટ પર્યાયછેદ તો કરવો જ ધનો. શાસ્ત્રવચન એ ઉત્સર્ગ માર્ગ છે, અને તથાપ્રકારના હેશકાલ આદિ કારણું જ્યારે શાસ્ત્રવચન નિર્દિશિત ઉત્સર્ગમાર્ગ મુજબ મુક્તિમાર્ગ વહન ન થઈ શકતો હોય ત્યારે (આગમ આદિ પાંચ વ્યવહારમાંથી આજે મુખ્ય ગણુંતા ‘જીત’ વ્યવહાર મુજબ) અશાઠ ગીતાર્થીના વચને મુક્તિમાર્ગ વહન થાય તે આચરણા=અપવાહ માર્ગ છે. એ અપવાહ માર્ગ, એ પ્રકારે શાસ્ત્રવચનથી જે કાર્ય નહોતું થતું એ કાર્ય કરવા સમર્થ હોવાથી જ શાસ્ત્રવચન કરતાં બળવાન ગણુંય છે. તેવી તે સર્વતત્ત્વ સ્વતત્ત્વ ગણુંતી આચરણાને તેવી નિજમતિ કલ્પના વડે અપલખનાર તે લેખક, દીક્ષાથી પતિત લેખકની તુલ્ય પણ કેમ ન ગણુંય ?

(૧૫)-૫૦ ઉત્તના ધીજ પેરામાં તેવા તે લેખકે ‘ક્ષયે પૂર્વી’ ના મારા-સર્વ પૂર્વિયાર્થી માન્ય-સત્ય અર્થને તત્ત્વતરંગિણી આદિને એઠો આલિનિવેશિકપણે જ અસત્ય કહી નાખેલ છે. પર્વક્ષય-વૃદ્ધિ વખતે ક્ષીણુ કે વૃદ્ધતિથિની આરાધના પૂર્વ કે ઉત્તર દિવસમાં એક સરખી રીતે લેવાનો અર્થ તો સં૦ ૧૯૬૫થી તે નવા વર્ગો ઉપનલી કાઢેલ છે. શ્રી તત્ત્વતરંગિણીમાંતો ‘પર્વક્ષય-વૃદ્ધિ વખતે પૂર્વની કે ઉત્તરની તિથિને પર્વતિથિ કરવી.’ એમ જ અર્થ કહેલ છે. તેમાં નવા વર્ગના કલ્પેલા તે ‘આરાધના’ તથા ‘દિવસ’ શાખની ગંધ પણ નથી. જુઓ—શ્રી ‘તત્ત્વતરંગિણી’ ગાથા ચોથીનો પૂર્વિદ્ધિલોક અને તેની ટીકા, તથા ગાથા ૧૭નો ઉત્ત-

રાષ્ટ્રશ્રીલોક અને તેની ટીકાઃ તે વર્ગો જેનું લખાણુ માન્ય કરેલ છે તે પૂનાના-નામના ગુમાવેલ-વૈચે પણ તેનાં લખાણુમાં કથે પૂર્વાંનો અર્થ તો—‘અષ્ટમીના ક્ષયે સાતમને ફોક કરીને સાતમનાં સ્થાને અષ્ટમી કરવી.’ એમ જ કરેલ છે; પરંતુ આ નવીનોની જેમ ‘ક્ષીણુપર્વ’ની આરાધના પૂર્વ દિવસમાં કરવી’ એવો અર્થ તો કરેલ જ નથી. તિથિ વગર આરાધના કોણી? અને પર્વારાધકોને દિવસની શું કિમત? આ હિસાબે પ્રલુશાસનમાં-લૌકિક પંચાંગમાંની પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ વખતે તેને આરાધનામાં એક અને ઉદ્ઘાત તરીકે સંસ્કાર આપવાડ્યે એકને બદલે બીજી તિથિઓની ક્ષય-વૃદ્ધિ શાસનની આદિથી મનાતી આવેલ છે, અને તે મુજબ આરાધનાના પંચાંગમાં ફેરફાર કરાય છે. આ વાતને દેખકે દીલથી જ અસત્ય કહેલ હોય તો સંં ૧૯૬૨ સુધી તો એજ પ્રમાણે કરનાર અને વર્ત્તનાર તેમના દરેક જ વિધમાન વડિલોને તેમણે જે આપવું ચોગ્ય ઠરે તે પ્રાયશ્ક્રિત દેવાની ફરજ પાડવી જોઈએ, અને ‘તેમ કયું’ છે’ એમ જહેર કરવું જોઈએ. અને તે પછી તેવા અસત્યાચરણીના પોતે શિષ્ય થવા પામ્યા તેનું પોતે પણ આવતું પ્રાયશ્ક્રિત જહેર રીતે લઈને શુદ્ધ થવું જોઈએ: અથવા તો હવે સમર્થ વિક્રાન તરીકે સ્વીકારેલા પૂર્ણ આગમપ્રલાકરણના શિષ્ય બની શેષ જીવનને આરાધક ભાવમાં સ્થાપવું જોઈએ.

(૧૬)—[સંં ૦ ૨૦૧૪ના અમદાવાદ મુનિસ્પેલનમાં—‘આચરણા તો કોઈને કોઈ પ્રકારે મતલેહોવાળી હોઈને મારો મત શાખ પ્રમાણે સાચો છે’ એ ભાવનું પ્રાય: ૬ કે ૧૦ દિવસ સુધી વારંવાર એલાયે રાખનાર આઠ શ્રી રામચંદ્રસૂરિજીને ઉદ્દેશીને આ

લેખકે ઉલા થઈ શ્રી શ્રમણુસંધ વચ્ચે બાપોકાર જણાવેલ કે— “તેવું એલવામાં તેઓ ગોટા છે. તેઓ પાસે તેમના મતને સાચો લેખાવે તેવો એક પણ શાસ્ત્રપાડ નથી: આમ છતાં તેઓએ પોતાના મતની પુષ્ટિ કરનારા લખાણોમાં જે જે શાસ્ત્રપાડો ટાંકેલા જેવામાં આવે છે તે પાડો, તેઓએ પૂર્વાપરના સંબંધદર્શક વચ્ચેનો કાપીને અર્દ્ધા-પર્દ્ધા ટાંકેલા હોય છે અને તે તે અર્દ્ધા પાડોના પણ અર્થો તો તેઓએ લગભગ જુદા કરેલા હોય છે.” છતાં તે અદલ તો તેઓએ કરો જ ભયાવ નહિ કરેલ હોવાની થીના સાડી-ત્રણસો મુનિવરોને પ્રત્યક્ષ હોવાથી] લેખકે પૃ૦ ૩૭ના પેરા ત્રીજા અને ચોથામાં જણાવેલી (અવેરી કેશવલાલભાઈના અપમાન સિવાયની) સમસ્ત વાત સહંતર અસત્ય છે. અવેરી કેશવલાલભાઈનું અપમાન પણ તે આચાર્યશ્રીએ શ્રી કીર્તિવિંદ્ર દ્વારા કરાવેલી ઉશ્કેરણીને દીઘે સંમેલન વીખાઈ જવા પામ્યાને અંગે રોખાનિત બનેલા એક મુનિના હાથે કાકતાલીયન્યાયે જ થઈ જવા પામેલ. તે લેખકે તે લખાણોમાં તેવા કપોલકલિપતમતી-ઓને મારે નામે શાસનપ્રેમી અને શાસ્ત્રાનુસારી તરીકે ચોળાખાવવાની ખાલચેષ્ટા કરેલ છે, તેતો તેની પ્રત્યક્ષ ખળતાનું સૂચક છે.

(૧૭)—પૃ૦ ૩૪ના પહેલા-થીજા પેરામાં લેખકને પૂ૦ આગમોદ્ધારક આ૦શ્રી અંગે નૈનપત્રે સને ૧૬૭૫માં જે રીતે ચોળખાવેલ છે, તે હવે યથાર્થ અને મીઠું લાગ્યું છે, તે જેતાં માનવું જ રહે કે-તે અરસામાં તે પત્રમાં પૂ૦ આ૦ શ્રી દાનસૂરિજી મ૦, શ્રી રામ(ચંદ્ર)વિંદ્ર મ૦ વગેરે માટે તો કાનમાંથી કીડા ખરે તેવું ચે જે ધાણું-ધાણું અને ધણી વાર પણ લખાયું છે તે સધળું ચે લખાણ પણ લેખકને હવે અત્યંત યથાર્થ અને

અમૃત જેવું મીહું લાગી રહ્યું હોય. આ ઉપરથી લેખકનું ગુણાણું પણ નક્કી થઇ શકે છે.

(૧૮)-તે પૂછના ત્રીજા પેરામાં લેખકે, મારી ખૂકમાંની (કૌંસ સિવાયની) જણાવેલી મારી વાત વિદ્યમાન સમસ્ત શાસન-પ્રેમીઓને સ્વીકાર્ય હોવાની બળતરામાં સને ૧૯૩૩ ની ‘આનંદ-સાગર મુખ ચેપેટિકા’ નામની પ્રતિસ્પદ્ધી એવા અન્ય ગચ્છીય વક્તિની ચોપડીને આગલ કરીને પૂછ ઉપર (તે વખતે તે ચોપડીના લેખકે જેને જેને જે તે જ્હાને આગમોદ્ધારક લેખાવવાની પ્રક્રિયાનું ચેષ્ટા કરેલ છે) તે લખાણું ત૪ વર્ષ બાદ નવામતિના આ ચેલકાએ પણ ઉતારાડું સ્વીકૃતિ આપી ! એ જેતાં લેખકને પૂછ આગમોદ્ધારક આચાર્ય મં શ્રીને ખદ્દે હું વે તો તેવા જ તે દરેક સાચા આગમોદ્ધારક ભાસ્યા હોય તો તેમણે હું વે અચોગી આચાર્ય શ્રીના હાથે આચાર્ય ઘનેલ પુરુષના ગુરુગમ વિહેણુા વેલાનું શરણ તળુને છેવટે તેવા આગમોદ્ધારકમાંના પણ કોઈ એક આગમોદ્ધારકનું શરણ લેવું સલાહભયું છે. કારણ કે—એ વેલા કરતાં તો તેઓ સો દરજને સારા ગણ્યાય.

(૧૯)-પૂછ ઉપર ના ત્રીજા પેરામાં લેખકે, તે ખૂકમાંના સ્વીકારેલ—‘આનંદસાગરજીને કયા સંઘે આગમોદ્ધારક પદવી આપી તે કોઈને ખબર નથી, કે પછી તેમણે પોતે જ લઈ લીધી છે ? ’ એ પ્રશ્ન, લેખકનું પ્રગટ આલિનિવેશિક મિથ્યાત્વ સૂચ્યવે છે. કારણ કે—“લેખકના વડિલોની ‘સંજ્ઞમ્બસંરક્ષક, આગમરહુસ્ય વેદી, સિદ્ધાંત મહેદધિ, વ્યાખ્યાન વાચસ્પતિ, આગમપ્રજ્ઞ’ વગેરે

પદ્ધતીએ તેઓને કથા સંઘે આપી તે જ કોઈને ખબર નથી, એમ પોતે જણે છે અને આગમના જગપ્રસિદ્ધ અખંડ અલ્યાસી—અનેક આગમવાચનાદાતાશ્રીને તો (સં.૦ ૧૬૮૮ના ‘આગમોદ્ધારક’ પુસ્તકના પૂ.૦ ૩૬૬-૭૦ પરના લખાણુ મુજબ) સુરત મુકામે સં.૦ ૧૬૭૬માં પૂ.૦ આ.૦ શ્રી વિજયકમલસ્થો મ૦શ્રીના પવિત્ર હુસ્તે થએલ તેઓશ્રીની આચાર્ય પદ્ધતીની સાથે જ તે ‘આગમોદ્ધારક’ પદ્ધતી શ્રી સુરત ચતુર્વિધ સંઘે આપેલ છે.” એ વાત પણ પોતે જણે છે છતાં તેવું જુહું લખે છે !

એ ઉપરાંત લેખકે, તે ઉપમા પૃષ્ઠના ચોથા પેરામાં તે ખૂકમાંની વાતને ‘તેના લેખકે આગમોદ્ધારકશ્રીને પુસ્તકો વેચનાર-મિથ્યાલિમાની વગેરે પણ ધાણું ધાણું લખ્યું છે’ એ પ્રમાણે ગોઠવીને સ્વીકૃતિ આપેલ છે, તે બદલ તો હવે પછીની ચોપડીમાં લેખકે જ—“તેવા તેઓશ્રી તો હતા જ નહિ; પરંતુ અમો નવીનોમાં જ તેવા તો ‘હું અને મારા ગુર્વાહિ’ અનેક હોવાથી વાચકોએ તે ખૂકના ‘આનંદસાગરમુખચેટિકા’ નામને સ્થાને ‘નૂતન વર્ગમુખચેટિકા’ નામ સ્થાપીને તે બંને વિશેષણો સહિતની તે ખૂકમાંની સધળી જ આશેપાતમક બીનાએ અમારે અંગે જ સમજવી” એમ લખી દોષમુક્તા થવું રહે છે.

(૨૦)—પૂ.૦ ૩૬૮ના ઘેલા પેરાગત લખાણો ખુલાસો ઉપર અપાઇ ગયો છે. બીજા પેરાથી પૂ.૦ ૩૭૮ના ઘેલા પેરાના લખાણુ દ્વારા લેખકે—“(૧)—આગમોદ્ધારકશ્રીનાં સંશોધનો આધાર રાખી શકાય તેવાં નથી, (૨)—તેમણે છપાવેલ નંદીસૂત્રના આધારે નંદી-સૂત્ર શાધેલ નથી અને (૩)—પંડિત હરગોવનદાસે ‘પાઈઅસફ-

મહણણુંબા'નાં નિવેદન પૂરો રમાં આગમોદ્ધારકશ્રીને નિઃસંકોચય-
પણે અજ્ઞાન સંશોધકેાની હરોળમાં મૂક્યા છે." એ ત્રણું વાતને
ચુક્તારૂપે સ્વીકૃતિ આપી છે, તો તે ભાષતને ચુક્ત મનાવવા સારું
તેમણે હવે પછીથી—“(૧)—પૂરો આગમોદ્ધારકશ્રીનાં સંશોધનોને
સાચાં માર્નાને કોઈપણ ચર્ચા-મુદ્રણું પ્રસંગે તે આખાયે વર્ગો
તો તેના પર આધાર રાખીને નહિં જ પ્રવર્ત્તવાનું, (૨)—પૂરો
દાનસૂરિજીએ નંદીસૂત્ર, પૂરો આગમોદ્ધારકશ્રીએ છપાવેલ નંહિ.
સૂત્રને સન્મુખ રાખીને જ શોધેલું હોવાનું સપ્રમાણું જહેર થાય
તો પણું નહિં જ કખૂલવાનું અને (૩)—પૂરો આગમોદ્ધારક આ૦
મ૦ કરતાં પણું ટોચના સંશોધક તરીકે તે પંચ૦ હરગોવન-
દાસને જ માનીને તેના શોધેલા જ આગમો પર આધાર રાખ-
વાનું" તેમના ઉત્થાપક વર્ગને જહેર રીતે જણ્ણાવી દેવું ઘટે છે:
કે-જેથી તે વર્ગમાંના પણું કેટલા વિક્ષનોએ તે ક્ષેખકની તે તે
વાતોને ચુક્ત માનેલ છે? તેની ખખર પડે. પૂરો ઉપરના બીજા-
ચાથા પેરાનું લખાણું તો મુખ્યત્વે શાસનપ્રાણું ગીતાર્થમહાત્માની
નિંદા અંગેના ટાયક્વારૂપ હોઈ ઉપેક્ષણીય છે.

(૨૧)—પૂરો ઉટના બીજા પેરાની પંક્તિ ૮ સુધીમાં ક્ષેખકે—
“સાગરજીમ૦ આવશ્યક વૃત્તિ છપાવતા હતા, તેનું એક મુર્દ
સમિતિએ પૂરો પંચ૦ શ્રી દાનવિ૦ મ૦ને મોકલેલ તેમાં શ્રી
આનંદસાગરસૂરિ મ૦ શ્રીએ સુધારેલ ભૂલો ઉપરાંત ઘણી ભૂલો
શુદ્ધ કરવી રહી ગયેલી નીકળી, એટલે શ્રી સાગરજી મ૦શ્રીએ
તેઓશ્રીને મુર્દ મોકલવાનું બંધ કરાયું. કારણ? એમનાથી રહી
જતી દગ્લાખંધ ભૂલો બીજાઓના હાથે શુદ્ધ થાય એમાં પોતાને

હાનિ હેખાઈ, તે કેમ પાલવે ? ” એ પ્રમાણે પ્રાયઃ તેના જન્મ પહેલાની વાત લખી નાખવા વડે તેની તે ‘તરણી’ ખૂકનું લખાણું તેમના વડિલ પ્રેરિત હોવાનું તેમણે જ નજી કરી આપ્યું ! તે તો શાસનહેવની જ કૃપા માનવી રહે; પરંતુ તેમના તે લખાણુંની મધ્યમાં તેમણે તે મુદ્ર મોકલવાનું બંધ કરવામાં જે કારણું જણાયું છે, તે કારણુને તો લેખક ને સર્વજ્ઞ હોય તો જ સાચું માનવું રહે. સિવાય તો એ વાત, ‘પૂરો આગમોદ્વારક-શ્રીની સૂચનાથી તે સમિતિએ, તેઓશ્રીને પણ એક ભૂલો સુધારેલું મુદ્ર તેઓશ્રીનો પણ જ્ઞાન વિકાસ વધારવાના શુભાશયથી મોકદ્યું હોય અને તેમાં તેઓશ્રીએ પોતાનું વિશિષ્ટ જણપણું બતાવવા જેવા કોઈ દરાહે અભૂલોને પણ ભૂલો હેખાડવાનું ડહાપણું ડહાજ્યું જણાયું હોય તો જ પૂરો આગમોદ્વારકશ્રીએ તે પછીથી તેઓશ્રીને મુદ્ર મોકલવાની તે સમિતિને ના જણાવી દીધી હોય’ એ ઇથે બનવી સંભવિત હોઈને લેખકે તેને કેવલ દ્વિર્યથી જ અસંભવિત રીતે ચીતરી કાઢેલ માનવી રહે છે. પોતાની ભૂલો બીજના હાથે શુદ્ધ થવામાં પૂરો આગમોદ્વારકશ્રી, માનહાનિ હેખતા હોત તો તેઓશ્રી, શ્રી દાનસૂરિલુને પેદું મુદ્ર જ ન મોકલાવતે.

(૨૨)-પૂરો ઉદ્ઘાના પહેલા પેરાની ચાથી પંક્તિથી માંડીને પૂરો ઉદ્ઘાના પહેલા પેરા સુધીના લખાણમાં લેખકે જે—“આગમો-દ્વારકશ્રીએ છપાવેલ ‘ભવલાવના’ના એ લાગમાં પૂરો સાહિત્ય પ્રેમી મુનિરાજશ્રીએ કુલ ૪૨૩૬ અશુદ્ધિએ, એક સાથે રહી ગાંધેલી કુલ ૧૨ ગાથાએ અને છૂઢું છૂઢું સંસ્કૃત ગદ્ય-પદ્ય

હેઠોએક પ્રમાણું લખાએ રહી ગયેલ હોવાનું તથા પૂરો આંશી મેધસૂરિલુચે (હસ્તલિભિત) સૂર્યપ્રશસ્તિ વંચાવતી વખતે તેઓશ્રીએ છપાવેલ સૂર્યપ્રશસ્તિમાં ૬૨૫ અશુદ્ધિઓ, એક પૃષ્ઠથી વધુ પાડ તથા ૧૬ સ્થળો એક એક ગાથા જેટલો પાડ રહી ગયેલ હોવાનું તેમજ એ સ્થળો એક એક ગાથા જેટલો વધુ પાડ છે, તે તેઓ પાસેની પ્રતિઓ જોવાથી જિજાસુઓને સ્પષ્ટ જણાશે.” એમ લખેલ છે તે તો તેની નિંદકવૃત્તિ મુજબ ટીક છે; પરંતુ તેમણે તે અશુદ્ધિકરણુને પૂરો આગમોદ્ધારકશ્રીના અશુદ્ધિકરણું ઇપે લેખાવેલ છે તે તેનો ઈધર્યાગલિંત દાંબિક ભૂષાવાદ છે. કારણ કે—“પૂરો આગમોદ્ધારકશ્રીએ, આગમાદ્ધિ શાસ્ત્રો શુદ્ધ છપાવવાની બુદ્ધિએ પ્રસિદ્ધાપ્રસિદ્ધ પ્રાયઃ તમામ જ્ઞાનભંડારો-માંથી પ્રાચીનતર પણ હસ્તલિભિત પ્રતિઓ મંગાવવા છતાં (કેટલાક ભંડારોએ નહિ મોકલવાથી) પ્રાપ્તપ્રતિઓને અતુ-સારે જ તપાસીને તેઓશ્રી શાસ્ત્રો મુદ્રિત કરાવી શકેલ હોવાની તેમજ તે મુદ્રિત થયા પણીથી વર્ષો બાદ પૂરો સાહિત્યપ્રેમી મુનિ-રાજશ્રી પુણ્યવિજયલું મહારાજે તથા પૂરો મેધસૂરિલું મહારાજે તેમાંના પુનઃ મુદ્રિત કરાવેલાં શાસ્ત્રો, પ્રથમની તે તે મુદ્રિતપ્રતો તેમજ તે તે પ્રતો છપાવતી વખતે પૂરો આગમોદ્ધારકશ્રીને જે જે ભંડારોમાંથી નહિ પ્રાપ્ત થયેલી પ્રતોને પણ મેળવીને મુદ્રિત કરાવેલા હોવાથી પ્રથમની અપ્રાપહસ્તલિભિત પ્રતિઓમાં જે જે વિશેષ પાડો કે પંક્તિઓ જોવામાં આવેલ તે પાડો કે પંક્તિઓ પ્રથમની પૂરો આગમોદ્ધારકશ્રીમુદ્રિત પ્રતિઓમાં નહિ હોવા ઇપે જ તે તે પ્રાથમિક મુદ્રિત પ્રતિઓમાં તે તે વિશેષપાડો ચાવતું પંક્તિઓ નહિ હોવાની વાત પ્રસિદ્ધ હોવાથી ‘પૂરો આગમોદ્ધારકશ્રી મુદ્રિત

પ્રતિઓમાંનું એ રીતે લેખકે જણાવેલું અશુદ્ધિકરણ પણ તેઓ શ્રીનું તો નથી જ.' એમ લેખક ચોતે પણ જણે જ છે."

આ લેખકને તે પૂરો આગમોષ્ઠારકશ્રીનું તેવું અવાસ્તવિક અશુદ્ધિકરણ પણ એ પ્રકારે વાસ્તવિક અશુદ્ધિકરણનું પે લેખાવવું ગમેલ છે, જ્યારે તેમના દાદાજુરુ શ્રી પ્રેમસૂરિજીના 'સંક્રમકરણ' ભાગ ફેલા તથા બીજામાંની કંઈ ૧૬૦ તથા ૮૦ મળીને કુલ ૨૪૦ તેમજ છેવટ ગતવષે' પ્રસિદ્ધ થએલ પ૮૮ પૃષ્ઠના 'ખવગ-સેઠી' તથા ૬૭૨ પૃષ્ઠના 'ઠિક્કિઅંધો' અંથોમાંની કંઈ ૫૦૦ તથા ૮૦૦ કુલ મળીને ૧૫૪૦ જેટલી મારી ખૂકથી ૨૧ ગુણી પ્રસિદ્ધ અશુદ્ધિઓને તો શ્રી પ્રેમસૂરિજીના વાસ્તવિક અશુદ્ધિકરણ તરીકે લેખાવવાનું મોકુડ રાખવું જ વાજથી મનાયું છે. આવા લેખકને કયું અસત્ય ત્યાજ્ય હોય ?

(૨૩)-પૂરો ઉચ્ચના બીજ પેરામાં લેખકે લખ્યા સુજાપ મેં પ્રસ્તાવનાતિમિરલાસ્કરમાં પૂરો આગમોષ્ઠારક આઠ માઠ શ્રીનું અગાધ જ્ઞાન બતાવવા માટે અને પૂરો દાનસૂરિજી માને ઉતારી પાડવા માટે આદુંઅવળું તો કાંઈ લખ્યું નથી; પરંતુ તેઓનું મેં જાતે અનુભવેલું માત્ર સ્વરૂપ જ લખેલ છે: સૂર્ય અને અધોતના જણેલ સ્વરૂપને ન લખનાર તો ગુણચોર જ ઠરે ને ?

(૨૪)-પૂરો ઉચ્ચના તે બીજ પેરાની પાંચમી પંહિથી માંડીને પૂરો ૪૨ના પહેલા પેરા સુધીમાં લેખકે, પૂરો સાહિત્ય-ગ્રેમી મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે બૃહૃતકલ્પની પ્રસ્તાવનામાં પૂરો આગમોષ્ઠારકશ્રીની તદ્વાંથાનુસારી ઐદ પર્યાર્થી જ્ઞાનધારા સામે પ્રતિપક્ષ રૂપે તદ્વસરવશાત જે કાંઈ તેમને યોગ્ય

જણ્યાયા તે વાકું પ્રહારેદા કરેલા છે, તે પ્રહારેને પ્રથમ રજી કરીને પછી જે—“આ વિદ્ધાન મુનિશ્રી આગમપ્રભાકરજી સામે તેઓ જવાબ તો કાંઈ આપી શક્યા નથી. ઉલટાતું—તેઓશ્રીએ આમઃ-ત્રણું આપી સુરત ઓલાંબ્યા, સામૈયાં વગેરે સન્માન કર્યાં એટલે આગમ પ્રભાકરશ્રીનું પ્રમાણપત્ર તેઓએ સહખ્યું વધાવી લીધેલું છે, એમ કહેવાને જરાય વાંધો નથી.” એમ લખ્યું છે તે લેખકે, એ જ્હાને ‘તે બંને પૂજયોં વચ્ચે તથા પ્રકારનું ધર્મણું પણ આંતરિક કેવી ઐક્યતા ધરાવતું હતું ? એ જાણવા સારુ લખ્યું હોવા સંભવ છે. કારણ કે—[એ જ પૂજય સાહિત્ય પ્રેમી મુનિ-રાજશ્રીએ, અનેક વર્ષોના પ્રયાસે પોતે સંપૂર્ણતયા શુદ્ધ કરીને ગત વર્ષે પ્રસિદ્ધ કરેલ ‘શ્રી નંદીસૂત્ર’ નામક આગમઅન્થ, પૂજય આગમોદ્ધારક આચાર્ય મંથીને સમર્પણું કરેલ હોવાની સાથે તે અંથમાં તે પૂજય આગમોદ્ધારક આઠ મંથીને તેઓ-શ્રીની સર્વાચાર્ય શ્રેષ્ઠતા ખ્યાપક—“ગંથસમપ્રણં॥૧॥ જોગાજોગ-વિહિન્નૂળં॥૨॥ આયરિયંગવાળં॥૩॥ કરકમલકોસમજ્ઞો॥૪॥ એ ચાર વિદ્ધદ્ભોગ્ય રચેલા શ્રીલોકોને, તેનો “જિનકા મન વચન-કાયયોગ શ્રેષ્ઠ શ્રુતસાગરકી તરંગોમેં તૈરતા થા, જે શ્રેષ્ઠ જિના-ગમકે પ્રકાશનમેં અપ્રમત્ત યોગસે પ્રવૃત્ત થે, યોગ અયોગ કે વિવેકમેં કુશલ થે, ગાંભીર્ય ગુણુકી ગરિમાસે અનિવત થે, ‘આગ-મોદ્ધારક’ કી શ્રેષ્ઠ પદવીસે વિભૂષિત સન્ત થે, ઔર હૃષમકાલમેં જિનહેને અપને અપમેં ‘મહાનાદ’ શબ્દકો સત્યસિદ્ધ કિયા થા, એસે સાંપ્રતકાલ (વિંસં ૦ ૨૦૦૬)મેં દિવંગત આચાર્ય શ્રેષ્ઠ શ્રી સાગરાનંદ (આનંદસાગર) સૂર્યજી કે પવિત્ર કરકમલ કોષમેં યહ અન્થ વિનયપૂર્વક સમર્પિત કરતા હું !

પુષ્યવિજય” એ પ્રમાણે સહુ અર્થું પણ રળુ કરવા રૂપ સર્વોચ્ચ પ્રમાણુપત્ર પણ રળુ કરેલ હોવાની પ્રસિદ્ધ હકીકતથી તો એ લેખક માહિતગાર જ હોય.]

(૨૫)-પૂર્ણ ૪૨ના બીજ પેરામાં લખેલ-‘ ખરી વાત એ છે કે-ગમે તેવા મોટા ધુરંધર આચાર્યો વગેરે હોય પણ શ્રીમાન હંસસાગરજીને તેમના તિથિપક્ષની ભાષતમાં જરા સરખા પણ જ્યારે વિરોધમાં લાગે ત્યારે તેઓની સામે પણ તેઓ યદ્વાતદ્વા લખ્યા વિના રહ્યા નથી.’ એ વાક્યમાં લેખકે લખેલ ‘તેમના તિથિપક્ષની’ અને ‘યદ્વાતદ્વા’ એ એ જૂડી વાક્યોને સ્થાને ‘શાસનમાન્યતિથિપક્ષની’ અને ‘યથાર્થ’ એ એ વાક્યોને લેખકે ધરાદાપૂર્વક ચોનેલ નથી તે તેમની મલિન-વૃત્તિનું ધોતક છે: સિવાયની તે વાત બદલ તેમનામાં જો શાસન-પ્રેમ હોય તો તેમણે પણ ગૌરવ લેવા જેવી હોવા છતાં નિદારિશે વર્ણવી છે, તે વિપરીત મતિના પ્રતીકરૂપ છે.

(૨૬)-તે પેરામાં આગળ જતાં લેખકે લખેલી-‘ સં ૦ ૨૦૦૪ પછીથી પૂર્ણ આરો શ્રી નેમિસૂરીધરજી મહારાજ વગેરે બધા તેમનામાં લળતા થયા ત્યારે ‘આ ભાઈસાહેણે ઠંડા પડી ગુણો ગાવા માંડયા’ એ તોછડી વાત પણ ‘બધા તેમનામાં નહિ; પરંતુ ‘શાસનપક્ષમાં’ એટલો સુધારો માગે છે. સિવાય તો તે વાત ‘(સં ૦ ૧૯૯૮થી જ મૂલમાર્ગથી ભૂલો પડેલો) તે નવો વર્ગાંય, જો હળુ પણ શાસનપક્ષમાં જોડાઈ જવા રૂપે મૂલ માર્ગો આવી જય તો આ લેખક, તે વર્ગ સામે પણ તરત ઠંડા પડીને તેના પણ તે ગુણુને તો ગાવા જ સજજ છે.’ એ પ્રકારે તે લેખકને જ એધમ્રદ છે.

(૨૭)-તે પેરામાં તે લખાણું પછી લેખકે જે-'તેઓની આ ભાંડણુલીલાના ભયથી ઘણા તો બોલતા નથી.' એમ લખયું છે તે લેખકની જુહું તો બેધડક લખી નાખવાની આદતને આભારી છે. અરી વાત એ છે કે-'તે વર્ગમાંના કેટલાચે નામદારોનાં નિજમત ખાતર જિનમતને ઉથલાવી નાખવાનાં ઘોર પ્રપંચો, ગરખડો, કાવત્રાં તેમજ જુહાં લખાણુવાળાં પુસ્તકો અને જુહાં લખાણો વગેરેને આ લેખકે, પેતાના નામથી અદ્યાપિ પર્યંત શ્રીસંધમાં અનેકવાર તે તે સ્વરૂપે સપ્રમાણું પણ સિદ્ધ કરી દઈને તેઓને નિડરપણે શાસનમાર્ગના ઉત્થાપકો તરીકે એણાવી હેવામાં જરાય પાછી પાની કરેલ નહિ હેવાના ભયથી તેમાંના ઘણા તો અણોલ બની ગયા છે.' તે વર્ગની એ વર્તતી સિથિતિમાં પણ તે લેખકને એ રીતે મર્કટવેડા સૂજયા છે તે અચ્છેસરૂપ છે. હવે તો 'પાળેલા મર્કટે પોઢેલા માલિકના મુખ પર એઠેલી માખીને ઉડાડવા સારુ હાથમાંની તલવાર માલિક-પર વીંઝીને માલિકનું મોત નીપણવવા જેવું કાર્ય વખત જતાં તેવી કુટિલ કલમકારા આ ભાઈખંધ તો કરી એસશે નહિ ને?' એ એમના માલિકોએ સંજગદાદિએ જેતા રહેવાનું રહે છે. તેમની આ ચોપડીમાં તે લેખકે તેવું ઘણું અવળું બાદચું છે કે-જેને લીધે તેના વહિલો વગેરેને ભવિષ્યમાં ઘણું શોષવું પડે તેમ છે.

(૨૮)-તે પેરામાં એ પછી લેખકે, મને-'શાસનની સાચી દાઝ વિનાનો તેમનો આ પક્ષીય રાગ-ક્ષેષ તેમને કચાં લઈ જશો?' એમ કલિપત લખીને મારી ચિંતા કરી છે, તેનાં કરતાં તેમણે "નિજનાં વચ્ચેનોને 'જિન'નાં વચ્ચેનો લેખાવવા સારુ

આકાશપાતાલ એક કરનારા માર્ગચ્યૂત નવીનો પ્રતિનો શાસનની દાઝ વિનાનો પોતાનો એક ઉત્થાપકપક્ષીય રાગ-દ્રેષ પોતાને કચાં લઈ જશે ? ” એ પ્રકારે પોતાની જ ચિત્તા કરી હોત તો વધુ હિતમાં હતી.

(૨૬)-પોતાના વિવેકનું તેવું દર્શન કરાવનારા તે લેખકે, તે પેરાને અંતે તેમજ પૂરો દરના બીજા પેરાને અંતે મને જે “ઘડપણુમાં શાંતિ રાખી આત્માની શુદ્ધ આરાધનામાં લાગી જવાની તથા ‘હવે તો વૃદ્ધ જેવા થઈ ગયા—ઘણુા બાંધેલા કર્મને લીધે હાથે કુંપ ‘વા’ની પણ અસર આવી ગઈ, એનોહને મને ભાવદ્યા આવે છે’ એમ જણાવવા પૂર્વક આત્માનું સાધવાની વિનિતિ કરેલ છે, તે ઉભય વિનિતિ જે—“અમને છીએ તે સ્વરૂપે ખુલ્લા પાડનાર આ લેખક શાંત થઈ જય તો અમારા વર્ગ તરફથી દર વર્ષો જે—શાસ્ત્ર અને પરંપરાલોપક લખાણોથી ભરેલી હજારોની સંખ્યામાં બૂકો પ્રસિદ્ધ થઈ રહેલ છે, તે બૂકોને શ્રાસંઘોમાં વિના રોકટોકે શાસ્ત્ર અને પરંપરાનુસારી મનાવી શકાય’ એ પ્રકારના હૃષે ધરાદાપૂર્ણ ન હોત અને ભાવદ્યાપૂર્ણ જ હોત તો તે લેખકે, તેવી ભાવદ્યાપૂર્ણ વિનિતિ, [ઘણુા ઘરડા ખખ થઈને અનેકવાર બતાવેલી જવાની તૈયારી વાળી અવસ્થામાં ચાલુ વર્ષો પણ જેએઓ, ચાતુર્માસમાં સિદ્ધ-ગિરિજની યાત્રા નહિ કરવાની અવિચિદ્ધ સુવિહિત આચરણને મનસ્વીપણે જતીએાની આચરણુા કહીને લોપવાનું કરોડ પાપ,—પાંસઠ વર્ષ પૂર્વે ‘જૈનધર્મ’ પ્રકાશ, માસિકમાં તે અંગે શ્રીસંઘનો પ્રતિથંધ હોવાની પૂરો પંન્યાસ શ્રી ગંભીરવિજયજીમ૦ તરફથી થએલી જહેરાતનો પણ

ભંગ કરીને-ઉપાજોલ છે, તે] તેમના દાદાગુરુ શ્રીપ્રેમસૂરિજી આહિને જ-“ હવે તો આપશ્રી, આળુવન અપનાવેલ માયામયી જીવનથી પર થઈ-પર્વતિથિ, સૂતક, અસકાય આહિની શાસ્ત્ર-સંગત આચરણાના લોપક શિષ્ય પ્રશિષ્યોને થાબડયે જ રાખ-વાની હાથ ધરેલ પ્રછન્ન હુનીંતિથી પણ પર થઈ-તમોને પ્રકાશમાં લાવનાર શિષ્ય શ્રી રામચંદ્રસૂરિજી સાથે હીલની સંધી કરી આત્માની શુદ્ધ આરાધનામાં જ લાગી જાવ. ” એ મુજબ કરવાને બદલે મને શું કામ કરવી પડે ?

(૩૦)-પૂરો ૪૨ના શ્રીજિ પેરાના-‘ પૂરો આઠ શ્રી દાનસૂરો માટે શ્રીમાન હંસસાગરજીએ × × ×’થી માંડી પૂરો ૪૩ના હેલા પેરા સુધીના લખાણુંનો અગાઉ સર્વાંગ જવાબ અપાઈ ગયેલો છે. કે-જે જવાએ, એ લેખકે લખેલ ‘નહિ જરણતસ્યો’ ક્ષોંક, દીવાળીના ઓગસ અંકના પાત્ર તે લેખક તથા તેના ગુર્વાદિ પાખંડાપાસકોને જ યથાર્થ લાગુ પડતો હેલાનું ઠરાવી આપેલ છે. અભિજનતવર્ગ તેવું ગંધુ કોઈને લખે નહિ. મેતરની લાખા મેતરોના જ મુખમાંથી નીકળે. ‘મૂળ કડવે કડવો વેલો અને તે કડવા વેલાનું ફળ પણ તે લેખક જેવું કડલું’ તે આનું નામ.

(૩૧)-પૂરો ૪૩ના શ્રીજિ પેરાની-‘પ્રતિકુમણુમાં જે બધાય સાથે સ્તવન બોલે છે’ એ પંક્તિથી માંડીને પૂરો ૪૬ના હેલા ચેરાની-‘બધા સાથે ભષે અને બધા સાથે સાંલળે, એ શી રંતે બને ?’ એ અંતિમ પંક્તિ સુધીમાં લેખકે, પોતાના દાદા-ગુરુના ‘સોઅન્વો સુંવેહિં’ તરીકેના અર્ધદંગ રહસ્યને ઘેન-કેનાપિ સાચું લેખાવવા પુષ્કળ આવળાં મારતાંથે સાચું ઠરાવી શકેલ નહિ હોવા છતાં-“તેના દાદાગુરુએ ‘ભષિયુંવો’ કિયા-

પદ પર ધ્યાન આપ્યા વિના તે એકપક્ષીય રહસ્ય તાર્થયું છે તે ખોટું છે” એમ તો ન જ કખૂદ્યું અને સામેથી પૂછે છે કે— ‘એ શી રીતે બને ?’ આ કેવી અંધાઈ ? તે ગાથામાંના તે ‘ભણિઅવ્યો’ અને ‘સોઅવ્યો’ એ બંને કિયાપહોનો અર્થ, તે ગાથાના અર્થમાં આવી જાય એ રીતે તે ગાથાનો પૂર્ણ અર્થ કરાય તો એ સહેજે બને; પરંતુ તેમાં જે ગુરુગમ જોઈએ તે (તે લેખકના કહેવા પ્રમાણે લદે અમારા પૂર્ણ ગુરુઓએ અમોને ન આપેલ હોય; પરંતુ) તેમના વડિલોએ તો તેમને આપેલ છે ને ? કરી બતાવે—ગુરુગમથી તે બંને કિયાપહોના અર્થચુક્તા તે ‘પક્ષિખઅચાઉમાસિઅ’ ગાથાનો અર્થઃ તેમાં મહેસાણુ—લાવનગર આત્માનંદસલા—પ્રભોધટીકા વળેરેના પ્રતિકમણુસૂત્ર સાર્થમાં થવા પામેલા અર્થો આડાધ્યો કામ ન આવે.

(૩૨)—[મારી ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ ઘૂકના પૂર્ણ ૨૪ થી રટના ઘેલા ચેરા સુધીમાં મેં પૂર્ણ આરો શ્રી દાનસૂરિલુભૂ શ્રીના “(૧) ‘સોઅવ્યો સંવેહિ’ નું રહસ્ય (૨)—‘સમાધાવધાની’ વાક્યનું રહસ્ય (૩)—પંચાશક ટીકાના પાઠના અર્થમાંથી ‘કેવીને પણ અંથિલેદ કરવો બાકી રહેતો હોવાનું’ તારવેલું રહસ્ય (૪)—શત્રું જયમાહાતમ્યગત શ્લોદોના ‘સંલવડ્ય વર્ણનનું વિધેયદ્વારે’ કાઢેલું રહસ્ય (૫) ‘ગાથાસહસ્રી’માંના ‘સાધ્યસિરે’ પદનું સમજ્યા વિના ‘રૂપસિરે’ પદ લખીને તે પદનું ‘ચાંદીના મસ્તક ઉપર મોતી થાય છે’ એ અર્થદ્વારે તારવેલું રહસ્ય (૬) ‘વ્યવહાર લાયની ટીકા’માં સૂતકમાં જે વર્ણયું છે તેના એ લેદ જણાવેલ છે તેને બદલે ‘સૂતકના એ લેદ’ એમ કાઢેલું રહસ્ય (૭) ‘બંને ઓળિની અસજાય છે, પણ ‘આરો શ્રુતો ૧૦થી

કાલગ્રહણ લેવું સૂજે' એ શાસ્ત્ર અને આચરણા બંનેયના વચ્ચેનો-
માંથી 'ચૈત્રી ઓળાની અસજાયમાં પણ કાલગ્રહણ લેવું સૂજે' એમ તારવેલું રહસ્ય તથા (૮) મહેસાણે સં ૦ ૧૯૭૬માં પરમે-
ષિના પાંચ પદમાંથી છુટું-'સિદ્ધાંતમહેદધિપદ' તરીકે કાઢેલું
રહસ્ય" એ પ્રમાણે નંબરવાર આડ આગમરહસ્યો આપેલા છે,
તેમાંથી 'સોઅ૦વો સ૦વેહી'ના પ્રથમ રહસ્યનેથ શ્રી નિત્યાનંદવિં
તેની એ નવી ખૂકમાં કોઈ વાતે સાચું લેખાવી શકેલ નથી,
એમ ઉપરના ઉ૧મા ખુલાસા દ્વારા સ્પષ્ટ કરવામાં આવેલ છે.
એ પછીના બીજા ત્રીજા અને ચોથા એ ત્રણ રહસ્યોને તો તે
લેખકે તેની ખૂકમાં તેવા કૂટ ઉપાયેય સાચા લેખાવવાનો પ્રયાસ
કરવામાં ડહાપણ નહિ માનેલ હોવા છતાં 'તે ત્રણેય રહસ્યો
તો શાસ્ત્રવિરુદ્ધ છે જ' એમ સાચું ઉચ્ચરવામાં તો પાપ જ
માનીને ચૂપકીની સેવેલ છે તે, સત્યણીનાને તો ધેનકેનાપિ શૂપા-
વવાની બદવૃત્તિનું પ્રતીક છે. તેવા તે લેખકે એ પછીના પાંચમાં
રહસ્યને પણ અવળી રીતે ભાજીને] પૃ૦ ૪૬ના બીજા પેરામાં-
"પૃ૦૧૬ માં તેઓ (હંસસાગર) 'સખસિરે' કહીને 'સાપના
માથામાં મોતી પાકવાનું જણાવે છે. ××× સાપના માથામાં
મોતી કચાં થાય છે તે તેઓ બતાવશે ?'" એમ લખીને તેના
દાદાશુરુની તે ભૂલ કખૂલ્યા વિના જે સામેથી મને પ્રશ્ન કરેલ છે,
તે લેખકની અવળચંડાઈની ઉપેક્ષા કરીને પણ તે પ્રશ્નનો ઉત્તર
આપતા પહેલાં એ સ્પષ્ટ કરી છેવું જરૂરી છે કે—"એ વાતમાં
લેખકે, તે લખાણુવાળી મારી ખૂકના પૃ૦ ૨૬ને બદલે ૧૬ અને
મારા તે લખાણુમાંના 'સખસિરે' શફદને બદલે 'સખસિરે'
કરવાની આલોગિકભૂલ ઉપજાવીને મેં મારી ખૂકમાં તે સ્થળે

લખેલી—તેના દાદાગુરુની ‘ચાંદીના મસ્તક પર મોતી થાય છે’ એ ભૂર્ભૂજનેચિત વાતને તેમની વાત તરીકે લેખાવવાનું ઈરાદા પૂર્વક કપટ કર્યું છે.” તેવા તે માયાવી લેખકને સાપના માથામાં મોતી થવાનું સ્થળ ‘સાધસિરે’ પાડમાં જ પડેલ હોવા છતાં તે જેવા સાવ અંધ બનીને તે અજાભાઈ ‘સાપના માથામાં મોતી કચાં થાય છે?’ એમ સામેથી પ્રશ્ન કરે તે ખગતા સુચક છે.

(૩૩)—એ રીતે શક્લાગમરહસ્યવેદી (?)ના પાંચમા રહસ્યને લેખકે ખોટી રીતે જ સાચું લેખાવવા સાડું અશ્રક્ષિતને છાજીતી ચેષ્ટા કરેલ હોવાથી તે રહસ્યને પણ તે ભાઇંધાંધ અંતરથી તો ‘શક્લાગમરહસ્યવેદી’ના જ રહસ્યદ્વારે સમજેલ હોવા છતાં તેણે તે રહસ્યને વાચાથી તો ઓટાંનહી જ કખૂલવાની ભારે અનાત્માર્થીતા રાખી છે તે તેના—વિપરીતજ્ઞાનના ચોંગે અવળા અર્થો કરવા ટેવાઈ ગયેલા વડિલો પ્રતિના અંધરાગનું અને પ્રલુબ્યન પ્રતિના બાધ્ય રાગનું પ્રતીક છે: લેખકે, પાંચમા રહસ્યને એ રીતે ડહોઝ્યા પણી છદ્રઠા સૂતક અંગેના અને સાતમા ચૈત્રી ઓળિની અસજાયના અપાલનડ્યુ રહસ્યને તો તેવી વિપરીત અને વિચિત્ર રીતિઅય સત્ય નહીં લેખાવવામાં શોલા માનેલ છે, તે સારું કર્યું છે.

(૩૪)—મારી ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ ખૂકના પૃ. ૨૭ ઉપર મેં રણુ કરેલા તેવા તે પૂર્ણ આગમરહસ્યવેદીણના સં. ૧૯૮ ૭૬માં રહેસાણે પરમેષ્ઠિના પાંચ પદમાંથી છઢા કઢેલા ‘સિદ્ધાંત-મહોદધિ’ પહના રહસ્ય (કે—જેને મેં મારી ખૂકમાં ઓટાં ઠરાવેલ છે, તે)ને લેખકે—પોતાની ખૂકના પૃષ્ઠ ૪૬ના ત્રીજ પેરામાં ઓટાં કખૂલવ્યા વિના જ (પોતે પોતાના જ હાથે સં. ૨૦૧૧ની ખૂકમાં

સંં ૧૯૭૬માં તે પદ આણું હોવાની લખેલી) તે વાતને “ શ્રી પ્રેમસૂરિજીને પૂરો દાનસૂરિજીએ ઉપાધ્યાય પદ આપતી વખતે તે ‘સિદ્ધાંતમહેદધિ’પદ સં. ૧૯૮૭માં મુંખેઈમાં આપણું હતું.” એ પ્રમાણે જે ફેરવી તોણેલ છે તે પણ શ્રી પ્રેમસૂરિજીકૃત સંં ૧૯૮૮ના ‘સંક્રમકરણ’ના બીજા ભાગની પ્રસ્તાવનાના પેજ ૧૬ ઉપર પૂરો દાનસૂરિજી-પંચરામવિજ્યજી અને જંખૂળાએ મળીને મુનિ રક્ષિતવિજ્યજીના હાથે (શ્રી રામવિંના થનાર એ શિષ્યોને પોતાના કરી કેનાર આઠ શ્રી લખિધસૂરિજી પોતાને ‘સિદ્ધાંતમહેદધિ’ તથા ‘વ્યાખ્યાન વાચસ્પતિ’ કહેવરાવે છે તે બિરુદ્ધ ગુરુએ નહિ આપેલ હોવાથી ઐટું છે’ એમ લેખાવવા સારુ) કરાવી લીધેવા લખાણુને આધારે લખણું હોવાથી સાવમૂળ જીહું છે.

(૩૫)-પૂરો ઉના બીજા પેરાના તે લખાણ પદી લેખકે જે—‘તે વખતે શ્રી હંસસાગરજીની દીક્ષા થયેલી તેથી એ બધી બીના તેઓની જાણમાં છે, છતાં તે સાચી હકીકતને પણ તેમણે (તેની ખૂકના) પૂરો ૨૭ ઉપર ઐટી ચીતરી છે.’ એમ લખણું છે તે પણ તે ઐટી હકીકતને સાચી લેખાવવા માટેનું તે જૂડા લેખકનું સાવમૂળ જુડાણું છે. કારણ કે—આ લેખકની (૧૯૮૭ના કાઠ ૧૦ વં ૩ ની) દીક્ષા વખતે શ્રી પ્રેમસૂરિજીને ઉપાધ્યાયપદ અપાયેલ; પરંતુ ‘સિદ્ધાંતમહેદધિ’ પદ તો નહોતું જ અપાયું એમ આ લેખકને બરાબર યાદ છે. વળી મારી ખૂકના તે પૂરો ૨૭ ઉપર આ લેખકે, તે ‘સિદ્ધાંતમહેદધિપદ’ સંં ૧૯૭૬ માં મહેસાણે અપાયું હોવાની લખેલી વાતને ઐટી ચીતરી નથી; પરંતુ ‘પૂરો રહસ્યવેત્તિજી એ પરમેષ્ઠીના પાંચ પદમાથી

તે છદ્રકું પદ કાઢ્યું તેને ઓદું કહેલ છે' છતાં તે લેખકે, મેં તે પદ વાળી વાતને જોટી ચીતરી હોવાનું લખેલ છે તે પણ ઓદું છે.

(૩૬)-તે ત્રીજ પેરાના તે લખાણ પછીથી પૃષ્ઠ ૪૭ ના પહેલા પેરા સુધીની લખેલી-(૧) 'તે વખતે પંચ શ્રી રામવિંભીને વ્યાખ્યાનવાચસ્પતિનું બીજું પણ આપ્યું હતું (૨) આ બીજું આપવાનું સ્વરૂપ આચાર્ય શ્રી મેઘસૂરિજીએ ખાસ લખ્યું હતું' એ બંને વાત પણ સહંતર જૂડી છે. તે વખતના તેમના જ વીરશાસન' પત્ર વર્ષ ૯ અંક ૭ કાર્તિક વહિ ૮ શુક્લ તા. ૧૪-૧૨-૩૦ના પૃષ્ઠ ૮૨ સુધીમાં તે પ્રસંગને 'અમારા ખાસ પ્રતિનિધિ તરફથી' એમ લખીને તે પંચ શ્રી રામવિંભીને એ એ પત્રમાં પ્રસિદ્ધ કરવા મોકલેલ વિશાળ લેખ છપાએલ છે. તે લેખમાં ખુફ પંચ શ્રી રામવિજયજી મહારાજે પણ "પછીથી પૃષ્ઠ ૫ આચાર્યને પોતાના વરદ હસ્તે પદપ્રદાનની કિયા શરૂ કરાવી હતી. પહેલાં પૂજ્યપાદ મુનિપ્રવરશીને પંન્યાસપદનું સમર્પણ થયું હતું." એમ જ લખેલ છે; પરંતુ 'સિદ્ધાંતમહોદ્ધિ-પદ' તથા 'વ્યાખ્યાનવાચસ્પતિ' બીજું આપેલ હોવાની વાત લખેલ નથી. આપ્યું હોય તો લખે ને? સાં. ૧૯૮૭માં પ્રસિદ્ધ થએલ 'સંક્રમકરણ' ઘેલા ભાગની મુનિશ્રી રક્ષિતવિજયજીએ તે સંચ ૧૯૮૭ના મહા શુહિ પાંચમે અધેરી મુકામે લખેલી પ્રસ્તાવનામાં પણ તે વાત નથી. [એ વાત તો-'આઠ શ્રી લભિસૂરિજી તો શુરુથી વગર પ્રાતસિર્વહે પોતાને વર્ષોથી 'સિદ્ધાંતમહોદ્ધિ' તેમજ 'વ્યાખ્યાનવાચસ્પતિ' લેખાવે છે અને ૬૦ શ્રી પ્રેમવિજયજી તથા પંચ શ્રી રામવિજયજી તો શુરુથી

પ્રામણિકૃહે ચોતાને તેમ લેખાવે છે એમ શ્રીસંઘામાં પ્રચારવા સારુ-પહેલાં કહેવાયું છે તેમ-પૂરું આઠ શ્રી દાનસૂરિજી મં આદિ ચાર જણાએ, સંઠ ૧૯૮૮માં ઉપજવી કાઢીને તે વર્ષે પ્રસિદ્ધ થએલ 'સંકુમકરણુ'ના બીજા ભાગની (એજ મુનિ રક્ષિતવિઠના હાથે અમદાવાદ મુકામે સંઠ ૧૯૮૮ ના શ્રાવણ વહિ આઠમે લખાવેલી) પ્રસ્તાવનામાં (વડોદરા સંન્યાસ-દીક્ષા પ્રતિબંધક સમિતિની જુખાનીમાં દાખલ કરાવી હેવાએલા પૂરું સ્વરૂપ આઠ શ્રી કમલસૂરિજી મંના નામના બુહારીના બનાવટી કાગલમાંની પૂરું આઠ શ્રી વલલબસૂરિજી મંશ્રીની વિરુદ્ધ વાતોની જેમ) ધુસાડી દીધેલ વાત છે.]

(૩૭)-નિજના વર્ગની તેવી જુઠી વાતોને સાચી લેખાવવા સારુ એ પ્રકારે તે લેખકે ચોતાની એ બૂકમાં અનેક માયાવી જુઠાણાએનો જરે વહેવરાંયો હોવાને અંગે જેમને ('દૂચે કેશ ન મૂંચે માયા તો ન રહે વ્રત પંચે' એ મહોપાધ્યાય-જીનાં વચ્ચેન અનુસાર) જૈન સાધુ કહેવામાંય હોષનો સંલંઘ ગણણાય, તેવા તે મુનિ (?) લેખકે, તે પૂરું ૪૭ની પંક્તિ પાંચ-મીથી મને પૂછેલા-'તે યથાર્થ બીજેદોમાં ભૂલ કાઢનારા શ્રી હંસસાગરજીને હું પૂરું છું કે-તમારા દાદાગુરુને તેમના ગુરુએ આપ્યા વિનાજ તમે દેવસૂરતપાગચ્છલક્ષ્મક કહેવાને બદલે સામાચારીસંરક્ષક વર્ગેરે બીજેદ લખો છો, તે તો કેવળ તમે સંધ-સમાજને છેતરવાનું પાપજ કરો છો કે-બીજું કાંઈ?' એ પ્રશ્નનો ઉત્તર તો તે કુટિલકલમી અસાધુ લેખક પણ "તેમના દાદાગુરુના હૃયાત પદ્ધાતા ગુરુએ પણ આપ્યા વિનાના અને આગમરહસ્યના તથા પ્રકારે જાણુકાર પણ હોયા વિનાના પૂરું

આં શ્રી દાનસૂરિજી મંને અમે જેમ 'સર્કલાગમરહસ્યવેદી' ખોરદ લખીએ છીએ તેમ તેમના દાદાગુરુના (સં ૧૬૪૭માં કાલધર્મ પામેલ સ્વ૦) ગુરુએ (આપી શકે તેમ નહિ હોવાથી જ) આચ્યા વિનાના અને સં ૧૬૬૨થી જ નીકળેલા શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારીને ઉત્થાપનારાઓને તથાસ્વરૂપે નીડરપણે ખુલ્લા પાડી હોવામાં નિજના વ્યાપક માનમોલા અંગે જરાય પાછું વાળીને જેયું હોવા વિનાના પૂરો આગમોદ્વારકશ્રીને હંસસાં વગેરે 'દેવસૂરતપાગચ્છસામાચારીસંરક્ષક' વગેરે બીડિદ્હો લખે છે તે તો સાર્થક જ છે; પરંતુ તે બીડિદ્હની વચ્ચે (સં ૧૬૬૩ થી 'દેવસૂરતપાગચ્છભક્ષક' તો અમારો નવો વર્ગ જ બનેલ હોવાથી) 'દેવસૂરતપાગચ્છભક્ષક' વિશેવણું અમારા વર્ગને બદલે તેઓને લખવાનું કહેવું તે તો અમારું ઉનમત્તપણું જ લેખાતું હોવા છતાં અમારા તારક હંસસાંને તેવું પૂછવામાં શ્રીસંઘાને છેતરવાનું પાપ તો અમોજ કરી રહ્યા છીએ." એમ સમજવા છતાં તે લેખકે ઉત્થાપકના પાળેલ ચોપટના ઇચ્છે તેવું તિર્યંચપણું દાખવેલ છે, તે તથાપ્રકારની તેમની ભાવિ ગતિનું સૂચક છે. હંસસાં ન હોત તો તો કેટલા વધુ ગખડત ?

(૩૮)-તેવા તે લેખકે તે ખેલા પેરાને અંતે જે-'આમને આમ તેમણે દ્વધમાંથી પોરા કાઠવારૂપે આડ નંબરો કરીને જોડે જોટાં ભૂલ ભરેલાં રહુસ્યો તારવવાની નરી ભાક્તીશ ચૈષા જ કરી છે તે ખરેખર ઉપેક્ષણીય છે' એમ લખેલ છે, તે નિર્મલ શાનજલમાં શ્રીરહસ્યવેદીના હાથે નખાયેલ ભારોભાર અજ્ઞાન-રૂપી પોરાને નહિ જ કાઠવાના કુલોત્તાર ફુરાબ્રહુના ચોપણું સૂચક હોઈ સહંતર જૂકું છે. લેખકની તે નીતિ, સાખિત ગુન્હાને

अपलपनार रीढा गुन्हेगार जेवी गण्याय. पूर्वे नेहि गया तेम ते रहस्यवेदीलुना ते आठमांना एक पछु रहस्यने ते लेखक, अंशेय साचुं ठरावी शकेल नहिंहोवा छतां ए प्रकारे ते आठेय रहस्योने ऐटेऐटां भूलभरेलां तारब्यां होवानुं जूठाणुं ऐधडक उचरी शकेल छे तेथी ते माणस सत्य करतां असत्यनो विशेष उपासक ठरे छे.

‘चारना चोपटने साचुं ओलवुं पालवे नहि, ए खड़; परंतु ए तो तिर्यंचनी वात छे. मानवने तो ते वात चोते जे आत्मार्थी न होय तो ज पालवे.’ ए वात ते लेखक न समजता होय तेम तो केम ज मानी शकाय? परंतु ज्यां सुधी ते खीचारा पूर्वकर्मवशात्—“(१) माहुंगे आकाशमांथी प्रलुने लक्ताणीना धरमां उतरावीने दर्शन करवा कराववानी (२)—रामविंश्ये भने पूछ्या विना तिथिमत काढेल होवानुं निजनुं निवेदन ‘मे बहार पाडयुं पडाव्युं नथी’ एम कहेवानी (३)—‘मारे नवो तिथिमत भूकी ज देवो छे’ एम वर्षी सुधी अनेकने कहेवा छतां सं० २०१३मां श्रीपञ्चविंश्यना नामे चोते लभावेला लेखमां ते नवातिथिमतने ज साचो कहेवानी (४)—०याघ्यान आपतां पछु आवडतुं नहि होवा छतां चोताना गुरुथी तो चोताने धण्णा—धण्णा महान् लेखाववा सारु शिष्योना हाथे चोताने धण्णाज कुत्रिम टाइटलो जेडाववानी (५)—जे भना प्रतापे श्रीसंघामां चोते अणकवा पामेत छे ते शिष्यनी प्रलाने हुणीने तेना—ऐकडानो वध बंध कराववा जेवा—प्रलावक कार्यने चोताना नामे चढाववा देवानी (६)—सं० २०१६मां का० शु० १५ सवारे अने चौदश सांजे करवानी विपरीतताने चेपरैमां प्रमाणिक लेखा-

વવાની (૭)-પોતાને મહાનું લેખાવવા સારું પચાસેક સાધુનું જૂથ તો આ ભીષણું કાળમાં પણ કાયમ સાથે રાખીને તેના નિર્વાહ અથે' લારે ખર્ચે' રખાતા ખાનગી રસોડેથી પ્રાય: સદ્ગુરૂ આધાકમી' અશન-પાનાઢિ વહેઠાવાના દાંબિકપણે જારી રાખેલા સુંયમધાતક વ્યાપારને તો પંપાળતા જ રહેવા પૂર્વક 'અમારા નિમિત્તનું હોય તો ન કહેપે' એમ માત્ર વાચાથી જ સર્વત્ર કહેતા રહેવા પૂર્વક નિજને સુવિહિત શિરોમણિ લેખાવવાના તેમજ (૮)-'સર્વાધિક શિષ્યસંખ્યાંક'ના આકર્ષક વિશેષણુથી અવલે-પાઈને શિષ્યોની લદ્રિકતાનો લક્ષ્ણના ઘણાને લાલ ઉઠાવવારૂપે શિષ્યોની ખાંધે જીવતા ચઢીને ગામેગામ ફરવાની" સંવિગ્ન પાક્ષિકત્વની પણ ગંધ વિનાની (હેવસૂર તપાગન્ધલક્ષક જ નહિ; પરંતુ) સાધુતાલક્ષકરીતવાળા શ્રી સિદ્ધાર્થાન્તમહેદધિની ભવ-વર્ધક ચુંગાલમાં સપડાએલ હોય ત્યાં સુધી સાચ્યું ઓલે પણ શ્રી રીતે ? શું બિચારાની દશા ?

(૩૬)-નિજના સમુદ્દરાયમાં પણ 'આગલ હાથ પાછલ હાથ રક્ષા કરે ગોરખનાથ'ની ભાદ્યાલ્યાંતર આખરૂવાળા તે લેખકે તે ખૂકના પૃઠી ૪૭ના બીજી પેરાથી પૃઠી ૪૮ના ફેલા પેરામાં જે- "પ્રસ્તાવનાતિમિરલાસ્કર ખૂકના પૃઠી ૨૮માં તેચો જરૂર પડે એવાં સો ઉપરાંત રહુસ્થેને પ્રસિદ્ધ આપવાની ધમકી આપે છે; પરંતુ બીજોએને શિખામણું આપવા જનાર તેચો શ્રીમાનું જ તેમની પોતાની તથા તેમના દાદાગુરુ આઠ શ્રીએ કરેલી સેંકડો ભૂલોને ભૂલો તરીકે પહેલાં જહેરાત કરી સુધારી લે, જેથી તેની તેવી ધરખમ ભૂલો અતાવવાનો પરિશ્રમ બીજા કોઈને કરવો ન પડે." એમ લખ્યું છે, તેનો જવાબ તે ભાઈ સહિત તે વર્ગને એ છે

કે-ને તેમ જ જણાયું હાય તો તમો તેવો પરિશ્રમ કરવા જ માંડો, શાસનના આ સેવકે તો તે કાર્ય શરૂ પણ કર્યો છે.

(૪૦)-પૃ. ૪૮ના ભીજ પેરામાં તે લેખકે-કવિપનાના હોડા-ચેલ દ્વેષમૂલક ઘોડા, તેનું હૈયું પારખવાની પારાશીશીર્થી રૂપ છે.

(૪૧)-તે પૃષ્ઠના ગ્રીજ પેરામાં લેખકે, મારી બૂકના પૂરો ૪૪ની મારી લખેલી—‘પૂરો ઉપારોશ્રી વીરવિંમોશ્રીને પૂરો મુનિ-રાજ શ્રી અવેરસાગરજી મહારાજશ્રીએ સૂત્રો વંચાયા તેમાં રસ રહી ગયો, એમ જણાવનારા તે પૂરો વીરવિંમોશ્રીના પત્રો છે’ એ વાત હુકીકતરાંથે સાચી હોવા છતાં તે લેખકે-તે સામે શાંકા વ્યક્તા કરેલ છે તો તે ભાઇઅંધ તે બાબત મુનિવર્યશ્રી અભય-સાગરજી ગણિ તેમજ મુનિવર્યશ્રી હોલતસાગરજી ગણિને પૂછાવી ખાત્રી કરે. સંઠ ૨૦૧૪ના અમદાવાદ મુનિસિનેલનમાં (તે ઉપારો શ્રી વીરવિંમોશ્રીના પત્રની સાથેના) સંઠ ૧૬૭૩ લગભગના પૂરો આત્મારામજીમ૦ તથા પૂરો મૂલચંદ્રજી ગણિના પત્રો તો મેં તે વર્ગની સામે જાહેર વાંચી પણ સંભળાયા હતા, એ વાત લેખકથી શું અછાની હતી ? ને નહિ, તો તેણે તે પેરાને છિકેથી લઈ પૂરો પ૧ના રહેલા પેરા સુધી તે અંગેની કરેલી કવિપત્રવાતોમાં આત્મકલ્યાણ શું માન્યું ?

(૪૨)-પૂરો આગમોદ્વારક આરોશીની દીક્ષા બાદ સાત જ મહિને તેઓશ્રીના ગીતાર્થગુરુ પૂરો અવેરસાગરજીમ૦શ્રી સ્વર્ગ-વાસી બન્યા હોવાનું લેખક જાણે છે, છતાં તેણે પૂરો પ૧ના ભીજ પેરામાં—‘તેમના દાદાગુરુએ શ્રીમાન્ અવેરસાગરજી પાસે એકે વર્ષ ગુરુકુલવાસ કેમ ન સેંયો ? અને તેમણે તેમની પાસે જ

અભ્યાસ કેમ કરો નહિ ?' એમ પૂછે છે તે લેખક ઘોર દ્રેષ્ટામિમાં સણગી રહ્યો હોવાનું સૂચક હોઈ ત્યાં કોઈ ઠારે તો સારું.

(૪૩)-પૃ૦ ૫૧ના પેરા બીજથી પૃ૦ ૫૨ના ઘેલા પેરા પર્યાતના યદ્વાતદ્વા લખાણનું ઐવળુદ્ધપણું મારી 'પ્રસ્તાવનાતિમિરલાસ્કર' બૂકમાં તેમજ આ ઉપરના લખાણમાં સ્પષ્ટ કરી આપેલ હોવાથી આ લેખકે-હવે તો આવા 'નિજમતિને ચેનકેનાપિ જિનમતિમાં ખપાવવાની'-ઘોર ભવાલિનંદીધૂનવાળા દિશિરાગીએને શાસનહેવ સન્મતિ આપે, એમજ ઈચ્છાવું રહે છે.

(૪૪)-પૃ૦ ૫૨ના બીજ પેરાથી અને પૃ૦ ૫૩ના ઘેલા પેરાથી પૃ૦ ૫૬ના ઘેલા પેરા સુધીમાં લેખકે-'પ્રસ્તાવનાતિમિરલાસ્કર' બૂકમાં સમ્યક્રચર્ચિત મુદ્દાને પણ યદ્વાતદ્વા ગ્રકારે અસમ્યક્ર લેખાવવા ચર્ચેલા કૂટ લખાણને ઉપેક્ષણીય માનવું રહે છે.

(૪૫)-પૃ૦ ૫૬ના બીજ પેરાનું લખાણ લેખકના હૃદયની હાયવરાળરૂપ હોઈને ઉપેક્ષણીય છે.

(૪૬)-પૃ૦ ૫૬ના બીજ પેરાથી માંડી પૃ૦ ૫૦ પદ્ધના બીજ પેરા સુધીનું લેખકનું શ્રી અભ્યાસાગરજી ગણિના ભગવતીજીના ચોગ અંગેનું ગાળાગાળીપૂર્ણ નિધ લખાણ, 'પ્રસ્તાવનાતિમિરલાસ્કર' બૂકના તથ્ય લખાણથી તે અંગેની શ્રી પ્રેમસૂરિજીની 'એ જ્હાને શ્રી પ્રેમસૂરિજીએ, તે મુનિશ્રીને-ચાતુર્માસમાં પોતાના વીશેક સાધુને અહિથી તહી હોડાવવા પૂર્વક-અમારા સમુદ્દરથી અસેડી લેવરાવીને પોતાના કરી લેવાની ભવિનતર પ્રવૃત્તિપર્યાતની' લિખણ ચાલખાળ ખુલ્લી થઈ જવા પામી તેની આંતરિક આતશ-તાને આખારી છે.

(૪૭)-પૂરો ૬૦ ઉપર તે લેખકે-'આં શ્રી હેવેન્ડ્રસાગરજી વગેરેએ તે વખતે મને આવું કહેલું અને તેવું કહેલું' એમ ધડા વિનાની કઠંગી વાતો વડે પૂરો આં શ્રી હેવેન્ડ્રસાગરજીને 'કુપ-મંડુકીયા-ધમંડી' કહી હેવાનું પાપ કરીને પણું પોતાના શાસન-માર્ગ-ઉત્થાપકેને સુવિહિતો કહી દીધા, તેટલા માત્રથી તેઓ કુવિહિતો અને કુપમંડુકશાનવાળા મટી જતા નથી; અને તેથી મેં 'પ્રસ્તાવનાતિમિરલાસ્કર' બૂકમાં તેઓને ઘટાવેલો 'રે પશ્ચિમ્ન્દ્ર' શિલોંક તે લેખકે જે-અમોને ઘટાવવા પ્રયાસ કરેલ છે તે વ્યર્થ છે. ઉલટાનું તેમની 'પ્રસ્તાવનાતિમિરતરરણી'માંનું આ બૂકે ઉપર પ્રમાણે તાજું ઐલી બતાવેલું પારાવાર અજ્ઞાન તો તેઓને વિશેષે અજ્ઞાની-ધમંડી અને અસફર્થના પોષક તરીકે એણખા-વતું હોધને તે 'રે પશ્ચિમ્ન્દ્ર' શિલોંક તો તેઓને વિશેષે યથાર્થ ઘટે છે.

(૪૮)-પૂરો ૬૧ના ઘેલા પેરાનું લખાણું તો લેખકે-મારા લખાણું અંગેના વિષયથી ખસીને=વિષયાંતર થઈને ચાલુ વિષ-યમાં પત્થરો ફેંકવાડ્યે કરેલું હોધને-લેખકની હૃષ્ટવૃત્તિનું ઘોતક છે.

(૪૯)-પૂરો ૬૧ના બીજા પેરાથી માંડી પૂરો ૬૨ના ઘેલા પેરા સુધીમાં લેખકે જે-(મેં તેની 'પિડનિર્યુક્તિપરાગ'માંની ભૂલો અદ્દલ 'તેના વડિલોમાં જે કોઈ એકાદ પણું ગુરુગમવાળા હોય તો આવી ભૂલો ન થવા પામત' એ લાવનું લખેલ તેને) અધમહૃદે પહેંચ્યાનું લખીને તેના બધા વડિલોને ગુરુગમવાળા છે, એમ લખયું છે તે તેમના વિધમાન સર્વ વડિલો કરતાંથે વડિલ આં શ્રી ગ્રેમસૂરિજી પણું તેમના રચેલા સંક્રમકરણું ભાગ બીજાના પૂરો ઘેલા ઉપરજ 'વિશાત્યગ્રશતં' વાક્ય લખવામાં ગુરુગમના લારોલાર અલાવવાળા સાભિત થતા હોવાથી સહંતર જૂડું છે.

ગુરુગમવાળાએ તો ‘વિશાત્યધિકં શતં’ ‘વિશાત્યુત્તરશતં’ ‘સવિશતિ શતં’ એવા પ્રયોગો કરે. ‘લોકાગ્ર’ એટલે ‘લોકનો છેડા,’ ‘કુશાગ્ર’ એટલે ‘ડાલની અણી’ એમ શ્રી પ્રેમસૂરિજીનું ‘વિશાત્યગ્ર’ એટલે વીશને છેડે. શુ ? તો કે-‘શતં’ એટલે (૧૨૦ને ખદલે) ‘૨૦ હજાર એકસો’ બંધ પ્રકૃતિએ. બાંધે, એમ થતો તે ‘વિશાત્યગ્રશતં’ વાક્યનો અજ ગુરુગમવાળો અર્થ, તે લેખકને જ માન્ય છે ? જે નહિ, તો પછી તે લેખકના તે ‘નિજ ગણુ સંચે-મન નવિ અંચે-અંથ ભણી જન વંચે૦’ની ઉપમાવાળા દાઢાશુરુનો તે ગુરુગમ કેવો ? લેખક જવાબ આપે.

(૫૦)-‘સંકુમકુરણુ’ અન્થ લાગ છેલાના પૂરો ૨ ઉપરના છઢા શ્રોકનું બીજું પાછ, ‘ગણધરૈઃપ્રસ્તુતાતુલસૂત્રતઃ’ એ પ્રમાણે કર્તાં અને કિયાપદને જેડે ગોઠવવામાં કર્તાંનાં સાધનને કિયા-પદની પછી યોજવાની વિદ્વતા ધરાવનાર આંદો શ્રી પ્રેમસૂરિજીના તે વાતુલ પ્રશિષ્યાભાસે તે પછી પણ આગળ વધીને જે-‘મેને જે લખ્યું છે તે મારું ચેતાનું નહિ; પરંતુ પૂર્વાચાર્યોએ અંથમાં જે લખેલું હતું તે લખ્યું હતું’ એમ લખેલ છે તે, તેણે પ્રસંગે પોતાના વડિલને પણ પૂછવા છતાંથ ‘પિંડનિર્યુક્તિપરાગ’ ખૂકમાંના લખાણુમાં તેના હાથે ઘોટા લખાએલા અર્થની જવાબ-દારીમાંથી તેના વડિલોને ખસેડી લેવા પૂર્વક ચેતે પણ ખસી જઈને તેઓના તે તે ઘોટા અર્થોની જવાબદારી પૂર્વાચાર્યોને માથે ઓઢાડવાની કારમી અને કુટિલ ચેષ્ટારૂપ હોઈ અનાત્માર્થી પણાનું સૂચક છે.

તેમની ‘પિંડનિર્યુક્તિપરાગ’ ખૂકના પૂરો ૩૧૨ ઉપરની ‘જા જયમાળસ્સ ભવે૦’ ગાથાની ટીકામાં-‘કર્મ’ પ્રથમ સમયે

અધ્યતે, દ્વિતીયે જીર્ણતે, તૃતીયે ત્વકર્મતામનુભવતિ' એ પ્રકારની પંક્તિ, 'પિંડવિશુદ્ધિ' અંથમાં ખરતરગચ્છની શ્રદ્ધાસન્મુખ કાળે તપાગચ્છીય લેખાતા શ્રી જિનવલ્લભગણિએ એકલાએ જ લખેલ હોવા છતાં એ લેખકે,—ઉપરનાં લખાણુમાં 'પૂર્વાચાર્યોએ અંથમાં જે લખેલું હતું.' એમ કહેવા દ્વારા ઘણા પૂર્વાચાર્યોએ તેવું લખેલ હોવાનું જણાવેલ છે તે પોતે કરેલા ઐટા અર્થને અધા પૂર્વાચાર્યોના અર્થો તરીકે લેખાવવાના બદાયાશયરૂપ છે. શ્રી જિનવલ્લભગણિએ જે અંથના આધારે તે 'પિંડવિશુદ્ધિ' અંથ રચેલ છે તે 'શ્રીપિંડનિર્યુક્તિ' જેવા શ્રી ગણુધરભગવંત-વિરચિત આગમ અંથના ૫૦ ૧૭૮ ઉપર જણાવેલ તે મૂળ ગાથાની ટીકામાં પણ તેવી પંક્તિ નથી: છતાં 'અધા પૂર્વાચાર્યોએ તેવું લખ્યું છે' એમ એધડક જૂદું લખનાર એ લેખકમાં આત્મા-ધીતા શે મનાય ?

તે લેખકની—'મહેં જે લખ્યું છે તે, અંથમાં લખેલું લખ્યું છે' એ વાત પણ માયાવી છે. કારણ કે—'મારી ખૂકમાં મેં, તે લેખકે અંથમાંથી લખેલી તે સંસ્કૃતપંક્તિ સામે વાંધો દર્શાવેલ નથી; પરંતુ લેખકે તે સંસ્કૃત પંક્તિના—'પ્રથમ સમયે બાંધે, ભીજે સમયે લોગવાય અને ત્રીજે સમયે તે કર્મનો અલાવ થઈ જાય છે.' એ પ્રમાણે કરેલા ઐટા અર્થ સામે વાંધો દર્શાવેલ છે. (કે—જે અર્થ તે અંથમાં પણ લખેલ નથી.) તે વાંધાને અંગે 'પ્રસ્તાવનાતિમિરભાસ્કર'ના પેજ ૬૦ ઉપર તે લેખકને મેં જણાયું છે કે—'તે સંસ્કૃત પંક્તિમાંના 'જીર્ણતે' પદનો અર્થ—'નિજીર્ણ' કરવાને બદલે તમે 'લોગવાય' કર્યો તે અણોધમૂલતા છે.' મારા તે સત્યજ્ઞાપનથી તે લાઇબાંધે ઉર્કેરાઈ જઈને તેમની

‘પ્રસ્તાવનાતિમિરતરણિ’ના પૃઠો ૬૧ની ઘેલી પંક્તિથી માંડીને પૃઠો ૬૨ની એ પંક્તિ સુધીમાં ‘તેનો અર્થ’ સંગત કરવાની તમારામાં ખુદ્ધિ ન હોય તો તે તમારામાં ગુરુગમનું હેવાળું બતાવે છે, એનો બણાપો તમે બીજી ઉપર શું કામ કાઢો છો ?’ એ પ્રમાણે ભીયાંલાઈની જેમ સામેથી ગળે પડીને ગાલી પ્રદાનો કર્યો; પરંતુ તે ‘જીર્યતે’ પદનો પોતે એટો કરેલો ‘લોગવાય’ અર્થાતો હુરગીજ ન ફેરંયો ! આ છે તેની ‘નિજ’ને તરીકેના સાચા અર્થના લોગે પણું પોતાનો તે એટો ‘લોગવાય’ અર્થ તો નહિ જ છેડવાની શાખાઅર્થ પ્રિયતા ! એ જ છે એમની એચો વડે ગવાતી સુવિહિતતા ! એક કવિએ ઠીક જ કહ્યું છે કે-

હીનપુણ્યા ન પદ્યંતિ, રાગાન્ધાસ્તત્વસંસ્થિતિ ।
લામેડલાભફલં ચૈવ, લભંતે તે નરાધમાઃ ॥૧॥

તે નવા વર્ગના નેતા શ્રી રામચંદ્રસૂરિજીના શિષ્ય મુનિ શ્રી માનવિજયજીએ સંવત् ૧૯૬૬માં તે શ્રી ‘પિંડવિશુદ્ધિ’ અંથ સટીકના પ્રસિદ્ધ કરેલ પ્રતાકાર ભાષાંતરના પૃઠો ૭૨ની ઘેલી પુઠી ઉપર તે ‘જીર્યતે’ પદનો અર્થ ‘લોગવાય’ એમ એટો નહિ; પરંતુ ‘અપી જાય છે’ એમ સાચો જ કરેલ હોવાનું જાણુવા છતાં પણું તે વેષવિડંબકલાઈએ મારા સત્ય એવા ‘નિજ’ને અર્થનો ન તો સ્વીકાર કર્યો અને ન તો ચોતે ‘લોગવાય’ તરીકે કરેલો જુઠો અર્થ ફેરંયો ! અને ઉપરથી એમને ચોંધ ગાલીપ્રદાનો મને કર્યાં ! ત્યારે તો ‘શ્વપ્યજલત એથી વધુ શું કરે ?’ એ જ વિદ્ધાનોએ વિચારખું રહ્યું.

મણં ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ના પૃઠો ૬૧ના ઘેલા ચેરામાં “પ્રથમસમયે બંધ અને બીજી સમયે તો નિજ’ના જ હોય છે,

ત્રીજે સમયે અકર્મતા હેતી નથી. આમ છતાં તમે ત્યાં તે છઢા ગુણુઠાણુવાળા મુનિનેય જે—‘ત્રીજે સમયે કર્મનો અભાવ થઈ જય છે’ એમ કહેણો છો તો તે ૧૧ થી ૧૩મા ગુણુઠાણુની વાત તે છઢા ગુણુઠાણુવાળા મુનિને કેમ ઘટે ?” એમ પૂછેલ, તેના જવાબમાં તે લેખકે તેની આ ખૂફના પેજ દરના ઘેલા પેરામાં મારી તે વાતને “તેઓ, (હંસસાગર) ‘હેલે સમયે બંધાય, બીજા સમયે નિર્જરા અને ત્રીજા સમયે કર્મનો અભાવ’ એમ કહેવા માગે છે” એ પ્રમાણે મારા નામે જૂહું રૂપેક આપીને પોતાની તે જૂઠી વાતને મારી માન્યતા તરીકે લેખાવેલ છે, તે તેના માયા પૂર્ણ મિથ્યાત્વશલ્યનું પ્રતીક છે. ઉપરના મારા પ્રશ્નમાં મં તો ‘ત્રીજે સમયે અકર્મતા હેતી નથી’ એમ જ લખેલ હોવાનું જાણવા છતાં તે લેખકે—એ રીતે મારા નામે ‘ત્રીજે સમયે કર્મનો અભાવ (હંસસાગર) કહેવા માગે છે’ એમ એધડક જૂહું લખવાનું આત્મહિતધનકાર્ય કર્યું, તે તેવા કારમા શલ્ય સિવાય નામધારી મુનિના હાથે પણ કેમ જ બને ?

તેવા તે અસ્ત્યવાદી લેખક, તેની ‘તરણી’ ખૂફના પૃષ્ઠ ૬૨ના તે જ બીજા પેરાને અંતે તેના—‘છઢા ગુણુઠાણુવાળા તેવા ઉચ્ચમુનિને કર્મ, ઘેલે સમયે બંધાય, બીજે સમયે લોગવાય અને ત્રીજા સમયે નિર્જરા’ એમ જાણવનારા જુદ્દા લખાણુના આધારમાં શ્રીલગવતીઝૂત્રનું પૃષ્ઠ ૧૮૨ વાંચવાની લલામણુ કરે છે તે પણ જૂઠમિશ્રિત છે. કારણુકે—‘શ્રીલગવતીઝૂત્રના તે પૃષ્ઠ ઉપરની વાત છઢા ગુણુઠાણુવાળા મુનિને અંગે નથી; પરંતુ ૧૧ થી ૧૩મા ગુણુઠાણુવાળા મહામુનિઓ અંગેની છે, એમ જાણવા છતાં તેણે તે વાતને મારી તે છઢા ગુણુઠાણુવાળા મુનિની

વાતમાં એટા રીતે જ આધાર તરીકે રણ્ણ કરી છે !” ૧૧થી૧૧માં ગુણુઠાણુવાળા મુનિઓને—“હેલે સમયે બંધાય-બીજે સમયે લોગવાય અને ત્રીજે સમયે નિજુરે” એ વાત તો મેં મારી ખૂકમાં જણુવેલ જ છે: તે લેખકે તો તેની—“ઇંડાગુણુઠાણુવાળા ઉત્તમ-મુનિને ત્રીજા સમયે ‘અકર્મતા’ હોય છે” એ વાત બદલ જ આધાર બતાવવો રહેતો હતો. તે તો લેખક બતાવી જ શકે તેમ નહિ હોવાર્થી અને ‘પોતાનો તે અર્થ’ પણ એટો છે’ એમ કણ્ણૂલ પણ કરવું નહિ હોવાર્થી તેમણે આ અસત્ય સેવ્યું છે ! આ છે તેની શાસ્ત્રપ્રત્યેની વફાદારી ! આ જેતાં મહોપાધ્યાયજીનું—‘ટોળે પણ જે લોળે અંધપ્રવાહ નિપાત.’ એ વચન, આ ટોળાં માટે તો નહિ હોય ને ? એમ હરકોઈ સમજુને લાગવું સંભવિત છે.

(૫૧)—તે લેખકે તેની ‘પિંડનિર્યુક્તિપરાગ’ની તે પંક્તિ-માંના કરેલા—‘અંજે સમયે લોગવાય અને ત્રીજા સમયે તે કર્મનો અલાવ થઈ જાય છે’ તે એટા અર્થને જ (કલમ ૫૦માં જણાવ્યા પ્રમાણે) સાચો લેખાવવા સારુ તે લેખકને ઉપરોક્ત પ્રકારે અનેક જૂડાણું સેવવાં પડેલ છે, તે જેતાં તો એમ ખચિત સંલઘ છે કે—‘તે લેખકના વડિલોમાં એક પણ વ્યક્તિ અર્થ’ પૂછવાના સ્થાનરૂપ ગણ્ણાય તેવા ગુરુગમવાળી નથી.’ જે હોત તો તેણે તે લેખકને મેં ઉપરની કલમમાં જણુવેલ સાચો અર્થ ‘જણ્ણાયો’ જ હોતાઃ આ જેતાં ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ પૃષ્ઠ ૬૧ના બીજા ચેરાને મથાળે તે લેખકને મેં—‘તમારા વડિલોમાં જે કોઈ એકાદ પણ ગુરુગમવાળા હોય તોં’ એ પ્રમાણે જે વાક્ય લખ્યું છે તેને વાચેકોએ હવે નજીર સત્ય ગણ્ણાવું રહે છે.

(૫૨)—એ પ્રમાણે ગુરુગમના અલાવવાળા વડિલોને શરણે

પડેલ તે બિચારા અસાધુ લેખક, તે પિંડનિયુંક્રિયાપરાગમાંની તેને મેં પૂછેલી તેની ‘કર્જં સર્જેણ હોયવં’ વાક્યમાંના ‘સર્જેણ’ પદવાળી બીજી ભૂલને તો તેવા યદ્વાતદ્વા પ્રકારે પણ સુધરાવી જ શકેલ નહિ હોવાને અંગે ખૂબ મૂંજાએલ હોય તે સહજ હોવાથી તેની અનુકંપાએ તેની તે મૂંજવણુ ફર કરવા સારુ અત્ર તેને તે ભૂલનો સુધારો પણ જણાવાય છે કે—‘લદાલાઈ! તે ‘સર્જેણ’ પદને સ્થાને ‘સર્જેણ’ પદ સ્થાપીને તે અનર્થકારી પદને બીજી આવૃત્તિમાં સુધારી લેજો. સચ્ચાટ આધાર માટે શ્રી ‘બૃહત્કંડપ-સૂત્ર’ની ૩૩૩૦મી ગાથા જેવી. લેખકના વડિલોની આવી ગુરુગમ વિહેણી સ્થિતિ જેતાં ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’માં મેં જણાવેલી મુનિશ્રી ધર્મગુમવિજ્યજીની ‘પાંચેય કારણો જેધાએ’ વાળી ભૂલોનો ખુલાસો તો હવે આઠ શ્રી પ્રેમસૂરિજીમ૦ પણ અવસર મેળવીને અમારા પૂર્ણ ગંધાધિપતિશ્રીથી ગુરુગમ પ્રાપ્ત કર્યા પછી જ આપી શકશે એમ ભાસતું હોવાથી તેઓશ્રી તરફના તે ખુલાસાની રાહ જેવી હાલ તુરત તો મુલતવી રાખવી પડેલ છે.

તે લેખકે—પોતાની જણાવાતી તે ‘તરણ્યિ’ ખૂકના પૂર્ણ ૬૨ના તે પહેલા ચેરાથી લઇ પૂર્ણ ૬૪ સુધીમાં પણ કેટલુંક હાથપગ—વિનાતું લરડયું તો છે જ, પરંતુ તે સધળું પોતે આવાં જૂડાં અને ગંધા લખાણોમાં પણ જેમનો છૂપોયે સાથ પ્રાપ્ત કરી શકે છે તે આઠ શ્રી પ્રેમસૂરિજીને ખુર્શી-ખુર્શી રાખવા સારુ તેમના પરમલકૃતના દેખાવ તળે કરેલ હોધને કેવળ ફ્યાપાત્ર છે.

હિ...ત...શિ...કા.

નિત્યાનંદવિજ્યજી ! તમારા જણાવવા મુજબ ‘પ્રત્રન્યા-

ચોગાહિ વિધિ સંબંધ' ખૂફની પ્રસ્તાવના જે તમારી જ છે તો તેમાં તમે 'ચૈત્રી મહામહુની અસજાયના લોપકેને વગર સમજે જ સાચા લેખાવેલ છે' એમ મેં મારી 'પ્રસ્તાવના તિમિરલાસ્કર' ખૂફમાં શાખાપાઠીના આધારે આપીને પણ સિદ્ધ કરી આપેલ હોવાનું જાહ્યા પછી તો તમારે મારી સૂચના મુજબ તમારી તે ભૂલોને સુધારી લેવાની જ પ્રમાણિક કેજ હતી. તેને બદલે તમે તો તમારી 'તરણી'માં તે અસજાય લોપકેને-મારી એક પણ દલીલને સાધાર પ્રમાણિક રીતે અસત્ય લેખાવવાની અશક્ત સ્થિતિમાં પણ-ચેનકેનાપિ સાચા લેખાવવાનો જે તે ભાવાથીયે પ્રયત્ન કરેલ છે તે અપીજનને તો નહિ જ; પરંતુ બીજી અપી એવા વ્યવહાર સજજન સદ્ગૃહસ્થને પણ શોલે તેમ છે? શાંતિથી વિચારશો.

અને એ સાથે—“તમારી એ 'તરણી'માં તમે જે-'તું આવો આવો અધમ અને તેઓ આવા આવા અજ્ઞાન' સિવાય મનન કરવા ચોગય કોઈ સૈદ્ધાંતિક વાત તો નક્કરપણે જણ્ણાવી જ શકેલ નથી, તેથી તે ખૂફ વાંચનાર વિદ્ધજ્ઞનોમાં તમે સમજુ સદ્ગૃહસ્થ જેવાયે લેખાવા પામશો કે નહિ ?” તે પણ વિચારશો.

તમારી 'તરણી'માંથી તમે, તમારી પ્રસ્તાવનામાં આપેલ શ્રી વિજયલક્ષ્મીસૂરિજીના દાખલાને 'પ્રસ્તાવનાતિમિરલાસ્કર'ના પ્રતાપે જ જૂઠો માનવો પડેલ હોવા છતાં તેટલોય તે ખૂફનો તમે આલાર ન માન્યો તેમાં તમેય તમને પ્રમાણિક લાગો છો? વિચારશો, અને તે સાથે તે પરંપરા લોપકેનો ગ્રેમ સંપાદન કરવા સારુ તમે તમારા તે તે પૂરુષ દાનસૂરિજી મ૦ આહિ વડદાદા શુરુનાયે વડદાદા શુરુના 'ચૈત્રી ચોળીની અસજાય 'સવ જગે'

એ ટંકશાળી વચનનો તમારી આ ‘તરણિ’માં લોપ કરી દેવાનું જે આલોગિક ગુરુ દ્રોહી અપકૃત્ય કરેલ છે તે હોષ્ટનું તો જહેર પ્રાયશ્ક્રિત લઈને જ શુદ્ધ થશોઃ કે-જેથી ‘વઠીયારહેશમાં તે અસજાય ગણ્ણાતી નથી’ એમ નિરાધાર ઈંકવાની અનારાધક દશા પણ સુધરે અને એ સાથે ‘વિવિધ પ્રક્ષોત્તર’ લાગ બીજાની પ્રશસ્તિમાં પૂઠ આઠ શ્રી કમલસૂરિલુના પદ્મપ્રભાવક તરીકે જણાવેલા પૂઠ ઉપાઠ વીરવિંભો, એ હિસાએ પૂઠ આઠ શ્રી લભિધસૂરિલુના ગુરુભાઈ થતા હોવાથી તેઓ શ્રી પૂઠ આઠ શ્રી દાનસૂરિલુભોના કાકાગુરુ થતા હોવાની મારી વાતને સાચી માનવાની અને તમારી ‘દાનસૂરિ, લભિધસૂરિલુના કાકાગુરુ થતા હોવાની’ કહિપત વાતને સહંતર જુઠી માનવા-મનાવવાની સહખુદ્ધિ પણ સૂઝે.’

ब्रह्मापि तं नरं न रंजयति

ગુરુગમ અને શુદ્ધચોદ્દ્વલનાદિ કિયાના અભાવવાળી સ્થિતિમાં સ્વતંત્રપણે શાસ્ત્ર વાંચવાના ચોગે પ્રાસ થાયેલ નિજ-મત્યનુસારી લેખાવવામાં ‘અહુ’ના ચોગે પાછું વાળી નહિ જોનાર નિર્ણયક-નાયકના જ્ઞાનલવરૂપી જલથી પોષાઈને વૃદ્ધિ પામેલ નવા વર્ગિલી કઢુ વેલાએ, તાજેતરમાં શ્રી નિત્યાનંદવિંભોના નામે પ્રસિદ્ધ કરાવેલ ‘શ્રી શાખેશ્વર પાર્થનાથ’ અને ‘વિવેક-દર્શન’ ગલિત ‘પ્રસ્તાવનાતિમિરતરણિ’ બૂકમાં પોતાના કરાવેલા કઢુતામય ‘વિવેકદર્શન’નું જ આ બૂકમાં સવિસ્તર અને સપ્રમાણુ ખંડનાત્મક પ્રહર્શન ચોજવામાં આવેલ છે. તથાપિ-લેખકના ‘યન્માધવેનોક્તં તત્ત્વ’ની હુનીતિવાળા ગુર્વાદિ જેવા અંગે કહિના

‘अज्ञः सुखमाराध्यः, सुखतरमाराध्यते विशेषज्ञः। ज्ञानलवदुर्विदग्धं,
ब्रह्मापि तं नरं न रंजयति ॥’ એ સૂક્તને તો લક્ષમાં રાખવું જ રહ્યું:

એક જરૂરી પ્રશ્ન:

નિત્યાનંદવિજ્ઞયજી ! તમને આ સાથે એક જરૂરી પ્રશ્ન પણ છે કે—“તમારી ‘તરણી’ ખૂકમાં તમે પૂર્ણ આરો શ્રી વિજ્ઞય-વલ્લભસૂરિજીને તથા અમારા પૂર્ણ વડિલોને તેમજ મને ‘શ્રીમાન्-વલ્લભવિજ્ઞયજી-ગંધાધિપતિ’ આરો શ્રી માણેકસાગરજી-આરો શ્રી હેવેન્દ્રસાગરજી-શ્રી અવેરસાગરજી, શ્રી હંસસાગરજી’એ રૂપે સંભોધવા દ્વારા પ્રેરણા કરી છે કે—“હવે પછીથી તમો પણ અમારા વડિલો વગેરેને આરો શ્રી કમલવિજ્ઞયજી-આરો શ્રી દાનવિજ્ઞયજી-આરો શ્રી ગ્રેમવિજ્ઞયજી-આરો શ્રી રામચંદ્રવિજ્ઞયજી શ્રી જંખૂકજી-શ્રી વીરવિજ્ઞયજી’ રૂપે જ સંભોધવાનું રાખશો.” એ તો ઠીક; પરંતુ તે સંભોધનો તમારા તે તે વડિલોને રૂચશો? પૂછીને ખુલાસો જણાવશો.

‘તરણી’ પૂર્ણ ઉપરની ‘ફેંસલા’ અંગેની વાત-

માં તો લેખકજી ! તમે લારોભાર મૃષાવાદ સેવેલ હોવાથી તે પાપના પ્રાયશ્ક્રિત રૂપે તમારે નિજના વર્ગને જ ડિમત કેળવીને સત્ય કહી દેવું રહે છે કે—“તમે વૈઘને ઝોડીને જ તે કહેવાતો ફેંસલો મેળવેલ હોવાની વાત તો શ્રી સંદોમાં સર્વત્ર વસ્થી હક્કીકત રૂપે કખૂલ પણ થઈ જવા પામેલ હોવાથી તમે હજુ પણ તે વાતને તમારી ઉપરના તહેંમત રૂપે લેખાવી રહ્યા છો તેમાં તો તમારા અંધલક્તોમાં પણ તમે સાવ જૂડા લેખાતા થઈ ગયા હોવાની સ્થિતિમાં મૂકાઈ જવા પામેલ હોવાથી જૈન જગતમાં

तेवा कोड कुडा प्रचारथी पणु कदी साचा लेखावाना ज नथी. आ हुद्दशामां ओछामां पूळूळू हवे तो ‘ते झेंसलो चेताना मत मुजब भेणववामां तमोअे तमारा नवा तिथि मतना रींगलीडर पं० श्री कल्याणविठ्ठना हाथे ते मतनुं लभाणु ‘गुडाखालोतरा’ मुकामे लभावीने अवेरी आपावाल तथा लगवानलु कपासी द्वारा भेणवीने वैधने भोडलेल अने ते वैधे पणु ते लभाणु मुजब ज ते कडेवातो झेंसलो लभेल’ ए वगेरे ते प्रसंगती उपरोक्त वातोने वीश वर्ष सुधी छूपावनार तमारा ते (तमोने नूतन तिथिमत पकडावी हेनार) पं० श्री कल्याणविजयलुअे पणु तमारा वर्गमांथी कुटी जधने सं० २०२१ मां छपावेल ‘निधनियय’ पुस्तकना पू० २५२ थी २६५ उपरना ‘तिथि अचार्यो पर सिंहावलोकन’ शीर्षक तणेना अस्थिर लेखमां ‘नवा भतीओनो हुं अग्रेसर हतो, वैधने रामचंद्रसूरिलु तरङ्गी अपाएलुं लभाणु में ज लभी आपेल हतुं अने भींतीया जैन पंचांगमां पणु टीपण्यागत पर्व-पर्वतिथनी क्षय-वृद्धि राखवानुं में ज प्रचारेलुं हतुं !’ ए प्रमाणे स्पष्ट ऐकरार पणु करेल हेवाथी तेम ज ३० वर्ष सुधी दुंगर खाद्यो छतां उंदर पणु नहि प्राप्त करेल हेवाथी तमारे ए भाषत हवे तो सदंतर चूप ज रहेवामां सार छे.”

आ (३) वातोना खुलासा पूछीने जणावशो ज.

तदुपरांत आ (३) वातोना तो तमारा वडा श्री प्रेमसूरिलु म०ने खुलासा पूछीने जणावशो ज के-

“(૧)-આપશ્રીએ, આ૧૦ શ્રી લગ્નિસૂરિનું સં. ૧૯૬૬થી શિષ્યે કાઢેલા નવા તિથિમતમાં જોડતી વખતે આપેલ કબુલાત મુજબ સં. ૧૯૬૮પના ‘વિવિધ-પ્રક્ષોત્તર’ ભાગ ઓળને છેડે પ્રશસ્તિમાં—‘પૂ. ૭૫૦ ઓપા૧ શ્રી વીરવિજયજી મ૦ને પૂ. ૫૦ આ૧૦ શ્રી કમલસૂરિજી મ૦શ્રીના પદૃપ્રલાવક અને તે પૂ. ૭૦ શ્રી વીરવિજી મ૦ના શિષ્ય પૂ. ૫૦ આ૧૦ શ્રી દાનસૂરિજી મ૦ને પૂ. ૫૦ આ૧૦ કમલસૂરિજી મ૦શ્રી (ના પદૃધર નહિ; પણ)ની પાટે મોટા આચાર્ય’ તરીકે પ્રસિદ્ધ પણ કર્યા હોવા છતાં આપશ્રીએ તૈથાર કરાવી—શોધીને ગત વર્ષે ‘પ્રસિદ્ધ કરેલ ‘ઠિદ્ય-અંધો’ અંથની પ્રશસ્તિના પૂ. ૬૬૭ ઉપરના રર મા શ્રોક પર્યાંત તેમજ ‘અવગ-સેઠી’ અંથની પ્રશસ્તિના પૂ. ૫૬૦ ઉપરના ૧૬મા શ્રોક પર્યાંતમાં પૂ. ૭૦ શ્રી વીરવિજીમ૦શ્રીને પૂ. ૫૦ આ૧૦ શ્રી કમલસૂરિજી મ૦ના પદૃપ્રલાવક લેખાવવાનું અંધ કરવાનું અને પૂ. ૫૦ આ૧૦ શ્રી દાનસૂરિજી મ૦ને પૂ. ૫૦ આ૧૦ શ્રી કમલસૂરિજી મ૦ (ની પાટે મોટા આચાર્ય લેખાવવાનું અંધ કરવા પૂર્વીક)ના પદૃધર લેખાવવાનું આપની તે કબુલાત અને પ્રસિદ્ધિની વિરુદ્ધનું નવું પગલું, ભાવિમાં પૂ. ૫૦ આત્મારામજી મ૦ શ્રીના પદૃધર પૂ. ૫૦ આ૧૦ શ્રી વલ્લબ્ધસૂરીમ૦ના સમુદ્દ્રાય પ્રતિની અંતરની કોઈ હુલ્લાવનાને સિદ્ધ કરવા લયું છે કે કેમ?

(૨) તે ‘ઠિદ્ય-અંધો’ અંથની અનુકમણિકાની પહેલાના પૂ. ૪૮ ઉપરના ‘શ્રીજાંજલિ’ શીર્ષીક તળેનાં લખાણુની પહેલી પંક્તિમાં આપશ્રીએ ‘આપને અનેક જન્મોથી સિર્જ જ્ઞાનગંભીત વૈરાગ્યવંત’ લેખાવ્યા તેમાં જો ગૌરવ નથી માન્યું તો એ શાશ્વત વિરુદ્ધ પંક્તિને રહ કેમ ન કરાવી? વૈરાગ્યની દુઃખગંભીત-

भेदभागलिंग के ज्ञानगलिंग तरीकेनी शास्त्रव्याख्या तो सामान्यतया वर्तमान सुज्ञन अनुबवित लवने आश्रयीने होय छे; परंतु वर्तमान आत्माना ज्ञवनने अनुलक्षीने तेना भूतकालीन लवो पणु तेवा आंकवा इपे होती नथी, एते वापश्ची जाणुता ज हो, छतां ते वात रह केम न करावी ?

(३)-ते अंथनाते ४८मा पृष्ठनी पाइथनी गुरुस्तुतिएमांना अंतिम श्लोकना आध्यरण्यमांतुं आपश्रीए अपनावेल आपश्रीनुं-‘कर्मग्रन्थविदारणैकसुभटो’ विशेषणु तो आपश्रीए-“सं० १६६८उथी श्रीसंघमां स्वच्छं हे ज पर्वतिथि-सूतक-अहणु तथा एोणीनी असज्जाय अने आगमादि अनेक शास्त्रोना अनेक सह अथेनो लोपक एवो महान् क्लेशकारी नवो मत पेहा! करनार-स्वशिष्य आ० श्री रामचंद्रसूरिलुना संघना पणु एकडेशीय कौशल्याधार श्री प्रेमसूरिलुए, पूर्वाचार्योना आचीन कर्मथेमांनी भूण गाथाएो अने टीकाएोने- श्री संघमांथी कमे नामशेष भनावी हेवा इपे-विदाशीने ज ते ‘खवग-सेढो’ अने ‘ठिह-बन्धो’ अन्थनुं निर्माणु, शिष्याचार्योना अनुकरणु इपे नवुं ज पेहा कयुं छे, एम भावि जैनोने याद रहे ! ” ए हीर्घ दृष्टिने ज आलारी छ ने ? (कारणु के-आपश्रीनुं प्रसिद्ध सिद्धार्थान्तमहेदधिपणुं तो ते विशेषणुने सुधारीने पणु तेनो ‘अंथिलेह’ अर्थ करवानी साई ना ज कहे छे.)

हुवे वणी यात्राप्रतिभृथ पणु लोभ्यो !

सूक्ष्म अने त्रसलुवोनी उत्पत्ति, चातुर्मासमां सर्वंत्र पुण्यत

પ્રમાણુમાં હોય છે. તે જીવોનાં રક્ષણુ માટે શ્રી જીનેશ્વર લગ-
વંતોએ પ્રદેશ સાધુ અને શ્રાવકનો-પ્રત અને નિયમ વિશેષ
-યતનાધર્મ, એ ભાવ અનુષ્ઠાન છે અને યાત્રા વગેરે દ્રોય અનુ-
ષ્ઠાન છે. દ્રોય અનુષ્ઠાનોનું આસેવન, ભાવ અનુષ્ઠાનની પ્રાપ્તિ અથે
કરવાનું હોતું હોવાથી ભાવઅનુષ્ઠાનવાળાને દ્રોયઅનુષ્ઠાન ગૌણુ
માનીને પોતાનું ભાવઅનુષ્ઠાન નિર્મણ અને સુદૃઢ બનાવવા સારુ
પૂર્વમહાપુરુષોના સુદૃઢ ભાવઅનુષ્ઠાનોના આદંબને ભાવઅનુષ્ઠાનમાં જ
પ્રવર્ત્તવાનું હોતું હોવાથી તેઓને યાત્રા આવશ્યક પણ નથી.
એટલે ચોમાસામાનો યાત્રા પ્રતિબંધ મુખ્યત્વે અપ્રત અને અનિ-
યમવાળાને માટે છે. કારણ કે-તેઓથી યતના ધર્મ યથાવત
સ્થાયી શકતો નથી.

વળી યાત્રા મુખ્યત્વે સમ્યકૃતવની શુદ્ધિનું કારણ હોઈ (પ્રતો
કે નિયમની શુદ્ધિનું કારણ નહિ હોઈ) તદ્ધર્થી અવિરતસમ્યગ્રદિષ્ટ-
માર્ગનુસારી વગેરે આત્માએ પણ વતો અને નિયમોના તો
ઇન્ધ્રજી હોય જ છે, તેથી પણ તેઓને ચોમાસામાં યાત્રાનો નિષેધ
છે. એમ શ્રીસંઘમાંના તે સૌ કલ્યાણુકામી આત્માએનો જીવ-
યતનાધર્મ અને તે ધર્મનો મનોરથ જળવાઈ રહે, ધત્યાદિ કારણે
સર્વજ્ઞ લગવંતોએ જ્ઞાનથી ચોમાસાની યાત્રામાં દર્શનશુદ્ધિના
લાભ કરતાં પુણ્ય જીવોની થવી સંભવિત વિરાધનાના ધોર
પાપથી લેપાવું પડતું હોવાનું અને તે દશામાં થવી સંભવિત-જીવ-
યતના ધર્મની અને તે ધર્મની શુલેચ્છાના-ધાતનો ગેરલાલ
તો પારાવાર હોવાનું જાહીને વિરતિ અને અવિરત્યાદિ સર્વ
નૈનધર્મી આત્માએને માટે ‘વર્ષસ્વેકત્ર સંવસેત’ એ ટંકશાલી
આજા ઝરમાવેલ છે.

તદ્દનુસાર સાધુ-સાધ્વી-દેશવિરતિ કે અવિરતિ પણ શ્રાવક શ્રાવિકાએ ચોમાસામાં યાત્રા નહિ કરવાના અવિચિછિજ્ઞ પરંપરા=આચરણા છે. સં. ૧૮૫૭ના જૈન ધર્મપ્રકાશ (ભાવનગર) અંક ૮ માં એટલે કે-આજથી ૬૫ વર્ષ પૂર્વે (૫૦ સૂરિસભાઈને આચાર્ય પદવી આપનાર) પૂર્ણ ૫૦ શ્રી ગંભીરવિજ્યજી મહારાજે તો ‘ચોમાસાની યાત્રા માટે સંધ તરફથી બહુ વખતનો પ્રતિબંધ’ હોવાનું પણ જણાવેલ છે. છતાં પોતાની નામના ખાતર શ્રી સંધમાં કલેશ કાયમ ચાલુ રહે એવો શ્રી સંધમાં કાંઈ ને કાંઈ નવો ઉખ્ખો ઉલા કરતા જ રહેવાના ચાણે ચડી ગાંધેલા નવાવર્ગના નેતા આઠ શ્રી પ્રેમસૂરિજીએ, છેલ્લા ચાર વર્ષથી તે પારંપરિક યાત્રા પ્રતિબેધને પણ શિષ્યો દ્વારા શ્રી સંધોમાં સર્વત્ર કોઈ પણ આધાર વિના મનસ્વીપણે જ ‘ગાંડીયાની અને ગોરળની’ પરંપરા કહેવડાવવા લાગી જઈને ગત વર્ષે ચોમાસામાં તો તેમના શિષ્ય આઠ જ ખૂસૂં (?) તથા ૫૦ માનતુંગવિં આદિ સાધુઓને નૂતન દેરાસરના ખાતમુહૂર્તને ખાને ગિરિરાજ ઉપર બાણુના ઢહેરા સુધી અને કેટલાક શ્રાવકેને ઠેડ ઉપર સુધી યાત્રા કરાવીને શાસ્ત્રવચનો, અવિચિછિજ્ઞ પરંપરા અને ૬૪ વર્ષ પહેલાં જહેર થએલ ‘ધાર્ણા વર્ષના સંધના પ્રતિબંધ’નો પણ લંગ કરવાનું એક વધુ અપકૃત્ય કર્યું; તે ખરેખર સકલ શ્રી સંધના ઘાર અપમાન રૂપ હોધિને અત્યંત હુઃખ છે.

તેઓશ્રીના એ શાસ્ત્ર અને પરંપરાલોપક કૃત્યથી અકળાઈ ઉઠીને તેઓના પક્ષનાજ સુનિરાજ શ્રી સુમિત્રવિજ્યજીએ એ અપકૃત્ય સામે ચાલુ વર્ષે મુદ્દામ વિરોધદર્શક એ

બૂડો ઉપરાઉપરી પ્રસિદ્ધ કરીને નેમાંના સૌભાગ્ય લખાણું દ્વારા તેઓશ્રીએ, આં શ્રી પ્રેમસૂરિજીની ‘મૌખિક કષુલાતથી છાંપામાં વિપરીત લખનાર અને પ્રચારનાર’ તરીકેની યથાર્થ ઓળખ આપીને તેઓશ્રીને અવિચિષ્ટ પરંપરાગત યાત્રાપ્રતિબંધના લોપક તરીકે પણ સત્તાવાર ભુલ્લા કરી હેવાની જે હિંમત કરી છે તે પ્રભુ શાસનના આંતરિક રાગના પ્રતીક રૂપ હોઈને ત્રિવિધે અનુમોદનીય છે.

શાસનપક્ષની પર્વતિથિ વિષયક અવિચિષ્ટ આચરણું ઉપર સર્વાંગ સાચાપણાની મહોરણાપ મારનાર ‘શ્રી તત્ત્વતરંગિણી’ અન્થરતનો અનુવાદ અમોએ સંં ૨૦૧૬માં પ્રસિદ્ધ કર્યા પછી તેમાંની એક પણ વાતને આપણો આ નવો વર્ગ, સંં ૨૦૨૧ પર્યાંત અસત્ય કે મનસ્વી લેખાવી શકેલ નથી. [ઉલ્લંઘન-તે પ્રસિદ્ધ થયા પછી તો તે વર્ગને રૂ. ૪૦૦૦૦)ના ખર્ચે છ્યાવાને તૈયાર રાખેલ અને ૨૦૧૪ના મુનિસિપેલન વખતે તો ‘તકની રાહ જેતા હતા તે તક આવી ગઈ છે, માટે હવે બહાર પાડીશું’ એમ જૈન પ્રવચનમાં અનેકવાર જાહેર પણ કરેલ પોતાના તિથિમતતું ૫૦૦૦ નકલ પ્રમાણું રૂ. ૧૧ ની કિમત રાખેલું ‘તિથિદિન અને પર્વતરાધન’ નામનું મોઢું પુસ્તક તો અધારી પર્યાંત ફૂપી જ રાખવામાં ડહાપણું સમજાએલ છે !]

તે વર્ગો, સંં ૨૦૨૨માં પ્રસિદ્ધ કરેલ ‘પ્રત્યક્ષાયોગાદિ-વિધિસંગ્રહ’ની પ્રસ્તાવનામાંના શાસનપક્ષના પર્વતિથિમંત્રોની વિરુદ્ધનાં તિથિ અંગેનાં લખાણુમાં પણ ‘શ્રી તત્ત્વતરંગિણી’ અનુવાદના તો અંશનેય અસત્ય કહેલ નથી: તહુંપરાંત તે વર્ગની તે પ્રસ્તાવનામાંના સમજ્ઞ શાસનપક્ષને લધુ

ગણ્યાવવા પૂર્વકના તે અસત્ય પોષક લખાણુની અસત્યતાને પણ અમોએ ગતવર્ષે 'પ્રસ્તાવનાતિમિરલાસ્કર' ખૂકમાં સવિસ્તર અને સપ્રમાણુ સાભિત કરી આપેલ લખાણુ-માનાચે એક અંશને તે વર્જે, પોતાની આ વર્ષે બહાર પાડેલ 'પ્રસ્તાવનાતિમિરતરણુ' નામની ખૂકમાં (ઉપર જોઈ ગયા તે મુજબ) 'તું આવો અને તે આવો' એ સિવાયના કોઈ શાસ્કીય આધારપૂર્વક પ્રમાણિક રીતે અસત્ય દાખવી શકેલ નથી.

આમ છતાં તે વર્જે, પોતાની એ ચાલુ વર્ષે બહાર પાડેલ ગાંઢી 'પ્રસ્તાવનાતિમિરતરણુ' ખૂકના પૃઠો ૧૪ ના ફેલા ચેરામાં—“વાત એમ છે કે-આ (પ્રસ્તાવનાતિમિરલાસ્કર) ખુસ્તિકામાં તેમણે (હંસસાગરે) પૂર્વે કરેલ શ્રી તત્ત્વતરણગણીના અનુવાદની માફક પોતાના જન્મસિદ્ધ કષાયોડ્યપ અને જૂડા આક્ષેપો કરવા ડ્યપ કચરો ફેંકવા (સિવાય કશું સારું કામ કરેલ નથી)." એમ એકાએક લખીને શ્રી શાસનસંધમાં એકી અવાજે ટંકશાળી ડ્યપે વર્ષોથી માન્ય ઠરેલ શ્રી તત્ત્વતરણગણીના અનુવાદના પ્રાચીન પરંપરા સંરક્ષક લખાણુને તેમજ ગત વર્ષની 'પ્રસ્તાવનાતિમિરલાસ્કર' ખૂકનાં ઐતિહાસિક અને શાસ્કાનુસારી સૌભ્ય લખાણુને કષાયો અને જૂડા આક્ષેપોના કચરા તરીકે નવાજેલ છે તે, પ્રસ્તુત 'પ્રસ્તાવનાતિમિરલાસ્કર'ના ઉદ્ઘેતે વર્ગની 'પ્રત્રણયાચોગાદિવિધિસંગ્રહ'ની—શ્રી સંધમાં અકારણે જ અશાંતિ પેહા કરનારી—પ્રસ્તાવના ડ્યપ મિથ્યાંધકારી અમાસ, અસત્સ્વ ડ્યપે સર્વાંગ ખુલ્લી થઈ આથમી પણ જવા પામી તેની પીડાને અલારી છે.

સિવાય અમારાં તે બંને પુસ્તકો, શ્રી સંઘમાં કેવો આદર પામેલ છે, એ વસ્તુ સુશર્જનોના ઘ્યાલ પર લાવવા સારુ હાલ તો આ નીચે ‘સુ’ ને ‘સુ’ તરીકે જાણીને જણાવનારા અનેક પૂર્ણ આચાર્ય—ઉપાઠ—પંઠ તથા મુનિરાજે વગેરેના—છેલ્લા તે ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ અંગેના જ—અલિપ્રાયો રણ્ણ કરાય છે. **‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ અંગેના કેટલાક અભિપ્રાયો**

૧—‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ પુસ્તક મળ્યું. હું લગભગ એ વખતથી વધુ વાર વાંચી ગયો છું. આ લાસ્કર નિખંધ, વિસ્તૃત મહાશાસ્ત્રાંથ છે.

લિંઠ પ્રતાપવિં (સૂર્ર) મુંબઈ પ્રદ શાઠ વં ૧૧

૨—પ્રસ્તાવનાતિમિરલાસ્કર ખૂક મળી, વાંચી, અલિપ્રાય માટે તમોને શું લખવાનું હોય? દરેક પ્રકારના આધાર—પૂરાવા પૂર્વક સચોટ જવાઓ લખાયા છે, અને સચોટ રહીયા આપી શાસનસેવા સુંદર કરી છે.

લિંઠ હેમસાગર (સૂર્ર) મુંબઈ ભાઠ શું ૮

૩—પ્રસ્તાવનાતિમિરલાસ્કરનો અલિપ્રાય જાણુશો કે—‘જેમને ત્યાં યોગોદ્ધર્ણની પરંપરા વર્ષો સુધી રહી નહિ, અને જેમની પરંપરામાં યોગની પ્રણાલિકાઓનો ત્યાગ કરીને પદપ્રદાન આદિ પ્રસંગો અને અનુષ્ઠાનો ચિરકાળ સુધી બનતાં રહ્યા હતા, તેમને ત્યાં શુદ્ધ પ્રણાલિકા કર્યાંથી મળી શકે? અર્થાતું ન જ મળે. એવા પરંપરાવિહીન વર્ગનાં લખાણુંની ક્ષતિઓને અંગે ધ્યાન એંચતું આપતું આ પુસ્તક ખૂબ જ સુંદર અને મનનીય છે.

લિંઠ રામવિજય (સૂર્ર ડેલાવાળા) સું સમી પોઠ શું ૧

૪-પ્રસ્તાવનાતિમિરલાસ્કરની ખૂકો મળી છે. પ્રવન્નયાયોગાદિવિધિસંઅહની પ્રસ્તાવનામાં તે લોકોએ પોતે અસજાયમાં કાલઅહણું લીધાં અને પદવીએ આપી વિગેરે શાસ્ત્રવિરુદ્ધ આચરેદી ભાષ્ટોને જોટી રહેતે શાસ્ત્રીય લેખાવવાનો દાંલિક પ્રયાસ કરીને તેમજ શાસનપક્ષીય તપગચ્છના સર્વ મુનિઓને પાસથા જેવા કહીને પોતાને મહાન् લેખાવવાનો જે નિધ પ્રયત્ન કર્યો છે, તેનો તમે યથાર્થ જવાબ આપીને સુંદર ઘટસ્ક્રોટ કરવા દ્વારા માર્ગ ભૂલેલાને જે સમજણું આપી છે તે ખરાખર છે.

લિંબો દેવેન્દ્રસાગરસૂરિ-ભાવનગર શ્રાંતં ૩

૫-આપશ્રીકે તરફસે શ્રી પ્રવન્નયાયોગાદિવિધિસંઅહ-પ્રસ્તાવનાતિમિરલાસ્કર નામક ૧૦ પ્રતિયાં મુજે મિલી હૈ, પદકરચિત આનાંદિત હુઅા, શાસ્ત્રકી અત્યધિક અવલોકન કર વ અનુભવસિદ્ધ પ્રમાણું હે કર સત્ય બાત લિખી હૈ.

વિજયજિનેન્દ્રસૂરિ-પાલીતાણું પ્રં શ્રાંતં ૭ રવિ

૬-પ્રસ્તાવનાતિમિરલાસ્કર કોપી ૧ મળેલ છે. પ્રયાસ પ્રશંસનીય છે.

વિજયસુશીલસૂરિ-ખીમેલ તા. ૮-૮-૬૬

૭-પ્રસ્તાવનાતિમિરલાસ્કર નામની ખૂક મળી અને વાંચી, તમોએ યોગ્ય રહીયા આપીને પ્રતીકાર કર્યો છે. અને હું તો એમ જ માનું છું કે-નવા પંથીઓનો મદ ઉતાર્યો હોય તો તમે જ ! બીજાની એ તાકાત નથી.

લિંબો યશોભદ્રસૂરિ-મુંબઈ શ્રાંતં ૫ શુક્ર

૮-પ્રસ્તાવનાતિમિરલાસ્કર ખૂક મળી છે, વાંચીને ધણો જ

આનંદ. આપશ્રીએ શાસનની પરંપરાએનું રક્ષણું તથા ઐટી ભ્રમજળણનું ખંડન બહુ જ સારી રીતે કર્યું. સચોટ પૂરાવાએ આપી સત્યનું સમર્થન કર્યું છે. ખરેખર આપશ્રીનો પ્રયત્ન ખૂબ જ ધન્યવાહને પાત્ર છે.

કૈલાસસાગર (સૂર્ય) ૭. શિહેર આઠ શું ૫

૮-પ્રસ્તાવનાતિમિરલાસ્કર ખૂક મળી, વાંચી યદ્વાતદ્વા ઐલનારાએને શાસ્ત્રપાઠીના સાચા અર્થો જણાવવાપૂર્વક હુમેશને માટે ઐલતા બંધ કરી હેવાનું સચોટ લખાણું કરીને લદજીવેને આપશ્રીએ બચાવ્યા છે. આપશ્રી શાસનને ખૂબ ખૂબ હીપાવે અને મોક્ષમાર્ગના સમર્થ સંરક્ષક બની રહે.

આઠ વિજયગ્રેમસૂર્ય સુંબદ્ર આઠ વર્દ ૧૪

૧૦-પ્રસ્તાવનાતિમિરલાસ્કર ખૂક અમરચંહલાઈ ઉપર આવેલી વાંચી, ‘મૂળ કડવે કડવો વેદો’ વગેરે સર્વ અક્ષરો વાંચ્યા. આપના-મગજ, સ્મરણુશક્તિ, શખ્દશૈલી, સદ્ગુરુજી વગેરે પૂર્વભવની કમાણી (માનું છું) સદ્ગુરુજનાથી શાસનના હિત ખાતર સ્પષ્ટ લખનારા ખૂબ જ કર્મનિર્જરા કરે અને પ્રશંસા પણ પામે.

(ઉપાઠ) ધર્મવિં (જથળમં) તલાજી આઠ શું ૭ સોમ

૧૧-પ્રસ્તાવનાતિમિરલાસ્કર પુસ્તિકા મળી. પ્રવન્યાયો-ગાહિ સંબ્રહની પ્રસ્તાવનામાંનું લખાણું સંધ શાંતિમાં નાહક વિક્ષેપ કરાવનારું એમણે ન લખવું જોઈએ. ભારી ઐદ થાય છે. આજે એકતા-સંગૃહનની ખૂબ જરૂર છે. હવે એમને એમના લખાણું બદલ પત્રીાત્તાપ થાય તેવો જવાબ આ પુસ્તિકા દ્વારા

મળી ગયો છે. આશા રાખીએ કે-તેઓ વાત આગળ નહિ વધારે.

લિં ૫૦ રાજેન્દ્રવિજયજી ગણી

(હાલ-આઠ મ૦)-નવાલ દ્વિં શાઠ શુદ્ધ ૭

૧૨-આપના તરફથી પ્રસ્તાવનાતિમિરલાસ્કર મળેલ છે. આપશ્રીનો પ્રયત્ન પ્રશંસાપાત્ર છે,. સામા પક્ષવાળાએ સૂતા સિહને જગાડેલ છે. આપનો પ્રયત્ન સ્તુત્ય છે.

લિં ૫૧ બૈદ્યોક્યસાગરજી ગણી ઉદ્દેશુર શાઠ શુદ્ધ ૧૪

૧૩-આપની પ્રસ્તાવનાતિમિરલાસ્કર ખૂક મળી છે. બરાબર વાંચેલ છે. શાસ્ત્ર અને પરંપરા વિરુદ્ધ વર્તીને શાસ્ત્ર અને પરંપરાને ચૂસ્તપણે અનુસરનારાએને હલકા કણીને હલકી લાખામાં વગોવનારાએને સપ્રમાણુ નિરૂતર કરનારું લખાણુ તેઓને બરાબર ઘટતું છે.

લિં ૫૨ કંચનસાગરજી ગણી પાલીતાણુ દ્વિં શાઠ વહ ૧૨

૧૪-આપે મોાકલેલ પુસ્તિકા પ્રસ્તાવનાતિમિરલાસ્કર મળી હતી. મેં સાધંત વાંચી હતી. ઐ નકલ આપ મોાકલવા કૃપા કરશો. પુસ્તિકામાં મુદ્દા બરાબર આપે રજુ કર્યા છે અને સમાદોચના પણ ચોગ્ય રીતે ટીક જ કરી છે.

(સાહિત્યપ્રેમી આગમપ્રલાકર) સુનિ પુષ્ય (વિજયજીમ૦)

અમદાવાદ લાઠ શુદ્ધ ૫

૧૫-પ્રસ્તાવનાતિમિરલાસ્કરની ખૂક મળી. આપનો પ્રયાસ ખીલ માટે અસાધ્ય છે. આપની નીડરતા અને લખાણુશૈલી સામાને લાજવાખ બનાવી હો છે. સત્યપ્રદૃપણું કરવાની આપની ખગશ બરાબર પ્રશંસનીય છે.

૬૦ સુનિ લુતેન્દ્રવિં (જ્યજીમ૦) દેવાસ તા. ૧૧-૮-૬૬

૧૬-આપશ્રીની પ્રસ્તાવનાતિમિરલાસ્કરની ડોપી મળી. સૌભ્ય-સચ્ચોટ અને ટંકશાળી ભાષામાં આપે જડખાતોડ જવાખ આપ્યો છે. જેમ જેમ આગળ વાંચતો ગયો તેમ તેમ અપૂર્વતા, અદ્ભૂતતા જ પ્રાસ થતી રહી છે. સામાવાળા પણ વાંચીને શાંત થઈ જવા સંભવ છે.

લિંબ મુનિ કનકવિં (જ્યલુ) મોરણી. તા. ૨૩-૮-૬૬

૧૭-આપશ્રીની પ્રસ્તાવનાતિમિરલાસ્કર પુસ્તિકા મળી. આખી મનનપૂર્વક વાંચી છે. સત્યને શાસ્ત્રો અને પ્રમાણોના આધારો ટાંકવા પૂર્વક અસત્યને સુંદર શૈલીથી ઝુલ્લું પાડીને આખાદ અળકાંયું છે. એ કાર્ય કરવામાં અસત્ય પ્રચારકો પ્રતિની પણ લખાણ શૈલીમાં જે સરલતાનું ચિત્ર ઉપસાંયું છે તે તો કેદી પણ સુસજ્જનને આશ્વર્ય પમાડે તેવું છે. આ ખૂક વાંચ્યા પછી સામા પક્ષમાં પણ જેએ શાંતિપ્રિય હશે તેએ, પોતાનામાં તેવાં દ્રેષ્ટમૂલક અને નિરાધાર લખાણો કરનારા-કરાવનારાએને જરૂર રોકશે એમ લાગે છે. કારણું કે-જવાખ, પ્રામાણિક દ્વારીઓ પૂર્વક યુક્તિયુક્ત અને રોચક અપાયો છે. શાસનરસિક દરેક પૂર્ણ શ્રમણુલગવંતોએ આ પુસ્તિકા અવશ્ય વાંચવા ચોગ્ય છે.

લિંબ મુનિ યશોભદ્રવિજય (જુ-દેલાવાળા)

રાજકોટ, ૧૭-૬-૬૬

૧૮-તમારી પ્રસ્તાવનાતિમિરલાસ્કર પત્રિકા મળી. અમો ભાપજી મહારાજના સમુદ્દરયના હોઈ તમોએ મોકલેલ ખૃષ્ણ-ચોગવિધિ પ્રમાણે કાલગ્રહણ લઈને મોટા જેગની કિયા કરીએ છીએ. (અર્થાતું ઓળિની અસજાયમાં અમો મોટા જેગના

કાલઅહણ લેતા નથી.) સૂતક અને અહણની અસજાય પણ માનીએ છીએ. તેમજ તિથિની બાબતમાં જે ગામના સંઘની માન્યતા હોય તે પ્રમાણે કરીએ છીએ. તે વખતે અમારી એ તિથિની માન્યતા છોડી ફંડાએ છીએ. આકોલા-ખુરાનપુર-શિવ-પુરી વગેરે ઠેકાણે (એ ચૌદશ, એ પૂનમ વખતે) એ તેરસની માન્યતા રાખી હતી. બાકી જે સમુહાય (અસજાયમાં) કાલ-અહણની કિયા કરે છે, સૂતક વિચાર માનતો નથી તેનું તે જણે.

લિં પ્રીતિ-તત્ત્વ (વિજયળી) લતીપુર તા. ૨-૬-૬૬

ધમકી નહિ પણ હકીકત સમજે.

આ નવા વર્ગ સાથેના ભતલેદો અંગે ૩૦ વર્ષથી ચાલતી આવેલ અનિષ્ટ ચર્ચામાં શાસનપક્ષ કદ્દી વાઢી ઘનેલ નથી. કારણું કે—એને શ્રી સંઘમાં શાંતિ કેમ હે, એ જ જંખના છે. જ્યારે આ નવાવર્ગો, સં ૦ ૧૯૬૮ થી શાસનના સાચા પક્ષને જોડો લેખાવવા સારુ સદ્ગુરૂનું જ કામ કરેલ છે. કારણું કે—‘તેમણે શ્રી સંઘની પ્રાચીન આચરણાઓને ભૂસી નાખીને તેને સ્થાને નિજની માન્યતાઓને જ સ્થાપી હેવાનું સદ્ગુરૂનું સદ્ગુરૂનું રાખેલ છે.’ એ કૂટ ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયત્નોમાં શ્રી સંઘમાં અશાંતિ થવાની, એમ તે વર્ગ પણ જણે જ છે: છતાં એ સાથે તે વર્ગ ‘શ્રી સંઘની તેવી અશાંતિમાં જ પોતાના પક્ષમાં હોડાઈ જવા પામેલા અણુસમજુ જનો પક્ષમાં જોડાઈ રહેવાના.’ એમ પણ જાણુતો હોવાથી ‘શ્રી સંઘમાં અશાંતિ કેમ રહે’ એ જ એની તમત્તા છે.

સુજગ્નનોને યાદ હુશે કે—આપણો એ વર્ગી, ચોતાના નવામતમાં શાસનપક્ષના હાથે સંઠ ૧૯૬૮થી માંડીને સંઠ ૨૦૧૬ સુધીમાં તો સર્વાદિક્રિ જૂઠો સાખિત જઈ જવા પામેલ હોવાથી સંઠ ૨૦૨૨ સુધીના છેલ્લા ત્રણુ વર્ષ સુધી તો ચોતાને મત ઉચ્ચારવાનું જ બંધ કરી એટેલ. આથી તે ત્રણેય વર્ષ શ્રી સંઘમાં નોંધપાત્ર શાંતિ જળવાએલ. પરંતુ શ્રી સંઘમાં વર્તેલ એ શાંતિકાળમાં તો ચોતાને પક્ષ ઢીલો પડી ગયો હીઠો, એટલે તેને સતેજ કરવા સારુ તે વર્ગી, ગતવર્ષે વિના પ્રયોજને જ આપણું શ્રી સંઘમાં પુનઃ કલેશને સળુવન કરનારી જૂઠી પ્રસ્તાવના પાલીતાણું ગુરુ ભંદિરની પ્રતિષ્ઠાના ટાંકણે જ પ્રસિદ્ધ કરવાની કલેશમૂલક પહેલ કરી.

એ જોઈ બિજી થએલ શાસનપક્ષે, તેમની તે પ્રસ્તાવનામાંના અસત્ય આક્ષેપો અને નિરૂપણોને તત્ત્વવર્ણપે સાધાર ખુલ્લા કરી હેનારી ‘પ્રસ્તાવનાતિમિરલાસ્કર’ ખૂક તેજ વર્ષે પ્રસિદ્ધ કરવાની પ્રતિવાદી તરીકે ફરજ બજાવવી પડેલ, અને તે પણ હળવા હાથે જ ! તે ખૂકના પૃથ્રી ૨૮ તેમજ ૬૦ ઉપર તે વર્ગને ‘શાસનપક્ષે, પુનઃ વિશેષ પ્રયાસ કરીને અશાંતિના સહભાગી અનવું’ ન પડે, એ સારુ આવો કલેશોત્પાદક પ્રયાસ પુનઃ કરવો સુલતવી રાખશો’ એમ ભાવભીની આરજી પણ કરેલ !

આમ છતાં તે વર્ગી તે પછી પણ શાંતિ રાખી નહિ અને અમારી તે ખૂકના જવાબના દંભી હાઉ તળે આ વર્ષે વળી પાછી ૬૪ પૃથ્રી ભરીને ‘પ્રસ્તાવનાતિમિરતરણી’ નામની આખી અસત્યપૂણું જ ખૂક પ્રકટ કરી! જેમાં અમારી ‘લાસ્કર’ ખૂકમાંના એક પણ લખાણુંને પ્રમાણિક રીતે અસત્ય ઠરાવવાની ફરજ ચૂકીને

મુખ્યત્વે વ્યક્તિગત નિંદાનું પણ પાયા વગરનું જ આવેખન કરવા દ્વારા પોતાની અસત્ય વાતોને સત્ય લેખાવવાનું પાખંડ આથયું !

આથી તે વર્ગની આ વર્ષની તેવી ગંધી-અરેલીલ અને દાંબિક ખૂકનો પણ અમારે આ નક્કર ખૂક દ્વારા મુખ્યત્વે તાત્ત્વિક જવાબ આપવાની પુનઃ અનિષ્ટ ક્રજ બળવવી પડેલ છે. તે વર્ગે અમારી ‘ભાસ્કર’ ખૂકમાંની પૂર્વોક્ત આરજુને પણ તેમની ‘તરણ્ય’ ખૂકમાં ‘ધમકી તથા દમદારી’ લેખાવીને પૂરો ૪૮ ઉપર જન્યારે ‘તેમ કરશો તો તમારા દાદાગુરુની ધરખમ ભૂલો તથા (પૂરો ૬૩-૬૪) તમારી અચોંઘતાદર્શીક ધણ્યી સામગ્રી પ્રકટ કરવી તો હજુ ખાકી છે, તે પ્રકટ કરીશું’ એમ પણ લખવા પૂર્વક મને સામેથી દમ ભીડેલ છે, ત્યારે જણ્યાવાય છે કે અમારા દાદાગુરુની તે વર્ગે કહેવાતી ધરખમ ભૂલો અને અમારી-અપ્રકટ રાખેલ-અચોંઘતા દર્શક સામગ્રી તેઓ સુખે પ્રકટ કરે, અને તે સાચી જણ્યાયેથી જણેર રીતે સુધારી લેવાની છંચ્છા ધરાવતા અમારી તો આજથી જ ક્રજ થઈ પડે છે કે—“ અમારી ‘ભાસ્કર’ ખૂકના પૂરો ૨૮ ઉપર અમોએ જણ્યાવ્યા મુજબ અમારે તો પૂરો આઠ શ્રી દાનસૂરિજી મંના ‘સો’ ઉપરાંત રહ્યોને થોડા મહિનાઓમાં જ પ્રસિદ્ધ કરી હેવા.” કે-લેવાંચાને તે વર્ગ, ‘એ ધમકી કે દમદારી નહોતી; પરંતુ હકીકત હતી’ એમ સમજે અને આવા કલેશોત્પાદક ખલજનોચિત ધંધાથી વિરમી જવાની શ્રી જ ખંનિત્યાનંદવિંને તાકીદ આપે. ઇતિ શમ.

શુ...દ્વિ...પ...ત...ક

પૂર્ણ	—	પંક્તિ	—	શુદ્ધ
૫		૬		પડવા
૨૬		૧૯		ઉપાડેલ
૩૪		૭		મ૦ ની
૩૭		૧૩		વર્ધીય
૪૩		૧૮		જિહ્વા
૪૫		૧૬		‘સુ’૦
૪૬		૨		૩
૬૦		૬		૪૩/૪૪

આ.૦ શ્રી પ્રેમસૂરિજી મંશ્રીને વિનંતિ

કર્મસાહિત્ય લખવામાં કરેલી ક્ષતિઓ બદ્ધ તથા આપના શિષ્યોના લખાણોમાં થયેલી ક્ષતિઓ બદ્ધ પણ પોતાને જવાબદાર ગણ્ણીને આપશ્રીએ, સં. ૨૦૨૧ના ભાગશર શુદ્ધ પૂર્ણિમાના ‘સંદેશ’ પત્રમાં આપની સહીથી ભિન્ધામિદુક્કડં જાહેર કરવાની સરલતા બતાવી હતી, તેમ મારી સં. ૨૦૨૨ની ‘પ્રસ્તાવનાતિમિરલભાસ્કર’ બૂકના ૫૦ દિપના ત્રીજા પેરાને છે આપશ્રીને મેં સુખ્યત્વે જે પાંચ કારણો અંગેની સજ્જડ અને સૈદ્ધાંતિક ભૂલ બતાવીને સુધારી લેવા વિનંતિ કરેલ છે તે વિનંતિ પર ધ્યાન આપીને પણ તે આપશ્રીના પ્રશિષ્યની કે આપની ભૂલના આપશ્રીએ આપને જ જવાબદાર લેખ્યાને તેવી જ સરળતાથી ભિન્ધામિદુક્કડં જાહેર કરી દેવાની આપશ્રીની ફરજ હજુ સુધી આપ બજાવી શક્યા નથી, તો તે ફરજ હવે બજાવવા આપશ્રીને આથી પુનઃ વિનંતિ છે.

એ સાથે આપશ્રીના આચાર્યશિષ્યે, પોતાના શિષ્યના હાથે લખાણીને ગત આપાઠ માસે જાહેર કરેલી ‘પ્રસ્તાવનાતિમિરતરણ્ણિ’ નામની ગંડી બૂકના પણ (સં. ૨૦૨૧ ની એ જાહેરાત સુજય) આપશ્રીએ પોતાને જ જવાબદાર ગણ્ણીને શિષ્ય-પ્રશિષ્યના તે સ્વર્ણંદી અપકૃત્ય બદ્ધ એ જ સુજય ભિન્ધામિદુક્કડં જાહેર કરી દેવાની ફરજ-માંથી નહિ ચૂકવા વિનંતિ છે.

તા. ક.-‘શ્રી સિદ્ધગિરિની યાત્રા, આતુર્માસમાં ન કરાય’ એમ રૂપણ મૌખિક કબુલાત આપશ્રીએ સુનિરાજ શ્રી સુભિત્રવિજયજીને અનેક શ્રાવકો મારણેત પાઠવી; પરંતુ તે સુનિશ્રીને તેમની ભાગણ્ણીને ધ્યાનમાં લઈને લખી ન આપી તેમજ આજ સુધી સંદેશાદિ પત્રોમાં પણ તે કબુલાત જાહેર ન કરી ! તેવી ડાઢ યુક્તિ મારી ઉપરોક્ત વિનિયોગમાં તો નહિ જ અજમાવવા ખાસ વિનંતિ છે.

૭૦ હંસસાગર

શ્રી સંઘની શાંતિ માટે નવો વર્ગ આ
તજે અને નીચેના ઉપાયોનો અ
એમ હાથ બેડી વિનવીએ



૧-પૂરો આત્મારામજુ મં શ્રીના સમસ્ત
સંગઠન સાધવા સાર્વ પ્રથમ તકે તો-સં. ૧
સુડામે પૂરુષ આ. શ્રી કમલસૂરિલુ મંની અ
વિજ્યાનંદસૂરિલુ મંશ્રીના શ્રમણુસમૃદ્ધાયે સર્વાનુમતે કરેલા
ડરાવોને સર્વાંગ માન્ય તરીકે પોતાના સહુ વડિલોની સહી પૂર્વક
જાહેર સંમતિ આપવી.

૨-શ્રીમત્તપાગચ્છના વિદ્યમાન પૂરો આચાર્યભગવંતો આદિ
સમસ્ત પહોંચદો તેમજ શ્રમણુભગવંતોને પોતાના આચાર્યાદિ
પહોંચદો તેમજ શ્રમણુભગવંતોની જેવાજ પૂજય જાહેર કરવા.

૩-પોતાની આજ્ઞાના સાધ્વીલુએને તપાગચ્છના સમસ્ત
સાધુભગવંતોને વંદન કરવાની આજ્ઞા જાહેર કરવી.

૪-અન્ય સમુદ્ધાયના સાધુ-સાધ્વીલુ ભગવંતોનો સમાગમ
ને કોઈ ગામ કે શહેરમાં થાય તે ગામ કે શહેરમાં પોતાની
આજ્ઞાના સાધુ-સાધ્વીલુ મહારાજે, તેઓ સાથે સાધર્મિકભાવે
હળી-મળીને રહે, એમ તેઓને આજ્ઞા ફરમાવી હોવાનું જાહેર કરવું.

૫-તપાગચ્છિય સમુદ્ધાયના પૂરો આચાર્યાદિ કોઈ પણ મુનિ
ભગવંતોને આગલી-પાછલી ભૂલેના જ્ઞાને ઉતારી પાડવાનો
પ્રચાર કાયમને માટે સ્થગિત કર્યો હોવાની સહુ વડિલોની
સહીથી જાહેરાત કરવી.

નેંધઃ-દર્શિત ઉપાયો યથાર્થ ન લાગે તો તે વર્ગના
વડિલશ્રીએ તેમ તરત જણાવવા વિનંતિ છે. સુધારા જણાવશું.

તપાગચ્છ જૈન ઉપાશ્રય }
વાંકાનેર શ્રાત શુઠુ પ શુરુ }
વાંકાનેર શ્રાત શુઠુ પ શુરુ }

વિજસિકારક-
૩૦ હંસસાગર